

॥ ହରି:ଓঁ ॥

ନାମସମରଣ

ପୂଜ୍ୟ ଶ୍ରୀମୋଟା

ସଂପାଦକ
ରମେଶ ଭଙ୍ଗ

ହରି:ଓঁ ଆଶ୍ରମ ପ୍ରକାଶନ, ସୁରତ

- प्रकाशक : ट्रस्टीमंडण,
હरिःअँ आश्रम, स्थापना वर्ष १८५६
કुरुक्षेत्र महादेवना मंदिरनी बाजुमां,
जहांगीरपुरा, रांडेर, सुरत-३८५ ००५.
फोन : (०२६९) २७६५५६४
- ◎ હરિઃઅઁ આશ્રમ, સુરત, નડિયાદ
- | | આવृત્તિ વર્ષ | પ્રત | આવृત્તિ વર્ષ | પ્રત |
|--------|--------------|------|--------------|------|
| પ્રથમ | ૧૮૯૨ | ૩૦૦૦ | ચોથી | ૨૦૦૦ |
| બીજી | ૧૮૯૩ | ૩૦૦૦ | પાંચમી | ૨૦૦૬ |
| ગ્રીજી | ૧૮૯૫ | ૩૦૦૦ | છઠી | ૨૦૧૦ |
- પૂછ : ૧૧૨
- કિંમત : રૂ. ૧૦/-
- પ્રાપ્તિસ્થાન :
- હરિઃઅઁ આશ્રમ, સુરત-૩૮૫ ૦૦૫
હરિઃઅઁ આશ્રમ, નડિયાદ-૩૮૭ ૦૦૧
- મુદ્રણશુદ્ધિ : જયંતીભાઈ જાની, ફોન : (૦૭૯) ૨૬૬૧૨૭૨૮
- ડિઝાઇનર : મધૂર જાની
બી-૮, રીપલ એપાર્ટમેન્ટ, નારાયણનગર, પાલડી,
અમદાવાદ-૩૮૦૦૦૭. મો. ૯૪૨૮૪૦૪૪૪૩
- ટાઈપસેટિંગ : અર્થ કોમ્પ્યુટર
૨૦૩, મૌર્ય કોમ્પ્લેક્સ, સી. યુ. શાહ કોલેજ સામે,
અમદાવાદ-૩૮૦ ૦૧૪, ફોન : (૦૭૯) ૨૭૫૪૩૬૮૮
- મુદ્રક :
સાહિત્ય મુદ્રણાલય પ્રા. લિ.
સિટી મિલ કંપાઉન્ડ, કંકરિયા રોડ,
અમદાવાદ - ૩૮૦ ૦૨૨, ફોન : (૦૭૯) ૨૫૪૬૮૧૦૧

॥ હરિ:ॐ ॥

સમર્પણાંજલિ

(ઇણી આવૃત્તિ)

આશ્રમમાં નિયમિતપણે આવીને પૂજ્ય શ્રીમોટાના
પદ સાહિત્યથી આકર્ષણીને પદ પંક્તિઓ ગાઈને
કંઠસ્થ કરનાર અને જેમના પિતાશ્રી સાથે
પૂજ્ય શ્રીમોટાનો નિયમિત પત્રવ્યવહારનો નાતો હતો
એવાં સ્વજન દંપતી
શ્રી કિશોરચંદ્ર સાકરલાલ તમાકુવાળા
અને
શ્રીમતી આશાબહેન કિશોરચંદ્ર તમાકુવાળાને
'નામસ્મરણ'ની આ ઇણી આવૃત્તિ
સમર્પિત કરતાં અમો આનંદ અનુભવીએ છીએ.

ગુરુપૂર્ણિમા

તા. ૨૫-૭-૨૦૧૦

ટ્રસ્ટીમંડળ,

હરિ:ॐ આશ્રમ, સુરત

અનુક્રમ

પ્રકરણ	પૃષ્ઠ
૧. નામસ્મરણમહિમા નામમહિમા	૨૩
૨. નામસ્મરણનો પ્રયોગ નામજપનો આરંભ, સ્મરણના તબક્કા, ચેતનાત્મક નશો	૨૮
૩. શબ્દની શક્તિ શબ્દનું મૂળ, બધી ઉપાસનામાં શબ્દ, શબ્દશક્તિ-વૈજ્ઞાનિક હકીકિત	૩૮
૪. નામસ્મરણ-વૈજ્ઞાનિક અભિગમ અને પૃથક્કરણ સર્મર્પણના પ્રયોગો, પ્રભુનું સ્મરણ-વ્યાખ્યા અને પ્રક્રિયા, જપની પદ્ધતિ, ‘ॐ’ વિશે, ‘ॐ’નું ઉચ્ચારણ, નામ અને નામી	૪૭
૫. નામસ્મરણનો હેતુ સાધનનો ઉપયોગ, સ્મરણથી સભાનતા, સ્મરણ સાથે પ્રાર્થના, ભાવનાનું સતત્ય, સ્મરણની સાથે, સ્મરણની અનિવાર્યતા, સાધના હાંસી ખેલ નથી, સતત પ્રયાસ, પ્રભુને બધું સોંપવું, અભ્યાસથી શુદ્ધિ, બેસી ન રહો, સ્મરણ શા માટે, જ્ઞાનભાવ સાથે સ્મરણ, પ્રભુસ્મરણ એ જ ખરું, મોટેથી સ્મરણ, મન અને સ્મરણ, જપયજ્ઞ, આ યજનું હુતદ્રવ્ય	૬૨
૬. નામસ્મરણસાધના નિરાશાની પણે, સ્મરણનું પરિણામ, ફરી ફરીને જાગો, નામસ્મરણથી આમૂલાગ્ર પરિવર્તન, નબળાઈથી મુક્તિ, ‘હરિઓ’ની ધૂન, સ્મરણમાં અંતરાયો, હુર્લિબ નામસ્મરણ, સ્મરણથી સત્ત્વાનતા, જપની સાથે સાથે, જપને ભાવયુક્ત કેમ રખાય ?, ઊર્મિનો ઉપયોગ, જપ માટે પ્રયત્ન, આપણું ખરું કામ, ખરા દિલનો પ્રેમ, સ્મરણથી પ્રસન્નતા, ભાવના દૃઢાવવા સ્મરણ, સદ્ગુરુનું ભાવસ્મરણ, સ્મરણનો અભ્યાસ, નામસ્મરણથી મનશુદ્ધિ, સાંભળો - પણ ન સાંભળો, સો વાતની એક વાત, સ્મરણ અને સંસાર, જપ કરતાં વૃત્તિઓ શાથી સાકાર થતી હશે ? નામસ્મરણનો પ્રતાપ, વિસ્મરણ સામે સાવધાન, સ્મરણની સાથે સાથે	૭૭

॥ હરિ:ઊ ॥

નામસ્મરણનું વૈજ્ઞાનિક નિરૂપણ

(સંપાદકીય)

આપણા દેશના ભિન્ન ભિન્ન ધર્મસંપ્રદાયોમાં જુદી જુદી સાધનાપદ્ધતિઓ છે. એમાં મોટા ભાગના ધર્મોએ નામસ્મરણને જુદાં જુદાં રૂપે સ્વીકાર્યું છે. જ્યાં નામસ્મરણ નથી ત્યાં ‘પ્રભુ’ના નામનો ઉદ્ગાર કે ઉદ્ઘોધન તો છે જ. આપણા દેશમાં હિંદુ ધર્મસંસ્કૃતિના મહાન ગ્રંથ વેદથી આરંભીને શ્રીમદ્ ભગવદ્ગીતા સુધીના ગ્રંથોમાં શબ્દઉપાસના - જપસાધના વર્ગેરેનો સ્પષ્ટ ઉલ્લેખ તથા મહિમા પણ છે. શ્રીમદ્ ભગવદ્ગીતામાં જપયજ્ઞને શ્રીભગવાનની વિભૂતિરૂપે ઓળખાવાયો છે. આપણી સંતપરંપરામાં પ્રભુસ્મરણે બહુ મહત્વનો ભાગ ભજવ્યો છે. આમ, નામસ્મરણ તો આપણા આધ્યાત્મિક વારસામાંથી મળેલું ઘણું મહત્વનું સાધન છે. આધ્યાત્મિક સાધનાનું એક અંગ છે.

ભગવાનનું નામ રટવાથી-જપવાથી-લલકારવાથી કે એની ધૂન કરવાથી મનહદ્દ્યને શાંતિ પ્રાપ્ત થાય છે. સંસારી જીવો પણ નામસ્મરણનો ઉપયોગ કરી શકે છે. એવું એ સરળ સાધન છે, પરંતુ આવું નામસ્મરણ જીવનમાં શાંતિ, પ્રસન્નતા, ઉત્સાહ, ઉમંગ કેવી રીતે પ્રેરે છે એની બુદ્ધિપ્રમાણ સમજૂતી આપણને ભાગ્યે જ જોવા મળી છે. એમ કહેવાયું છે ખરું કે નામસ્મરણમાં શ્રદ્ધા રાખી સ્મરણ કર્યા કરવું, પણ એમ કહેવામાં ‘શ્રદ્ધા’ એટલે શું એ સ્પષ્ટ કરવું પડે.

આપણા જમાનામાં પૂજ્ય શ્રીમોટાએ નામસ્મરણની સાધનાથી નવજીવનમાં પ્રવેશ કરેલો. (૧૯૨૨) અને એ જ

સાધનના ઉત્તરોત્તર વિવિધ રીતના અત્યાસથી પરમ પદને
પામેલા (૧૯૭૮). ૧૯૨૨માં નર્મદાકિનારે રણધોડજના
મંદિરમાં મળેલા એક સાધુએ ‘હરિ:ઊ’નું રટણ કરવાથી ફેફરું
મટી જશે એમ સૂચવેલું, પણ એ સમયના ચોવીસ વર્ષના
યુવાનના મનમાં પ્રશ્ન જાગેલો કે નામસ્મરણ-જ્યોતિ કરવાથી કંઈ
રોગ મટે ? એમની બુદ્ધિ આ હકીકત સ્વીકારતી ન હતી.
આથી, શ્રદ્ધા પણ બેસતી ન હતી, પરંતુ મહાત્મા ગાંધી તથા
એમનાં આધ્યાત્મિક માના વચન ઉપર વિશ્વાસ રાખીને
નામસ્મરણનો પ્રયોગ કર્યો. આ પ્રયોગના પરિણામથી પૂજ્ય
શ્રીમોટાએ કહ્યું કે શ્રદ્ધાથી નામસ્મરણ થવું જોઈએ એ વાત
ભલે સાચી હોય, પરંતુ નામસ્મરણના પ્રયોગમાંથી શ્રદ્ધા ઉંગે
છે તે હકીકત મહત્વની છે. ચાર કલાક સુધી સતત નામસ્મરણ
કરવાથી ફેફરુંનો રોગ મટયો ખરો પણ એ ઉપરાંત જે આંતરિક
શક્તિઓ પ્રગટી એથી એ સાધનને તેઓ વળગ્યા અને અખંડ
સ્મરણથી જીવનના પરમ આદર્શને પામવાનો-એટલે કે પ્રભુપદ
પામવાનો-સ્વરૂપનો સાક્ષાત્કાર પામવાનો ધ્યેય ઉંગ્યો.

નામસ્મરણના પ્રથમ પ્રયોગના અનુભવ પછી મન, મતિ,
પ્રાણ, અહ્મુ વગેરે કરણોના ગુણધર્મો અંતરાયરૂપ પણ બનતા.
અંત:કરણોને સ્મરણભાવમાં વાળવા માટે એમણે પ્રાર્થનાઓ
કરી. ‘મનને’ સંબોધીને (૧૯૨૩) એમણે જે પંક્તિઓ ગાઈ
છે એમાંની થોડીક પંક્તિઓ અત્રે ઉતારવાથી સમજાશે કે પૂજ્ય
શ્રીમોટાએ મનને માટે કેવી મથાપણ કરી છે :-

મનને

પ્રતાપેથી શું નામના તું અજ્ઞાયું ?
 કહેવાનું બાકી રહ્યું કેં તને શું ?
 રટ્યા તેં કર્યું તે ગયું કાં નકામું ?
 તને ભાન પૂરું હજી કાં ન આવ્યું ? ૮૭
 ગણાવું તને નામના શા પ્રતાપ ?
 બતાવું શું એની હું શક્તિનું માપ ?
 જગાયું તને કેંક ચંચુપ્રવેશો-
 -ધડો લૈ થકી તે, વધ્યું જા સદાયે. ૮૮
 હદે આદરે પ્રેમથી નામ લેવું.
 પ્રભુના રસેથી રસી ચિત્ત લેવું,
 અધી વિકૃતિને પૂરી બાળી નાખી,
 મથીને મથીને વિશુદ્ધિ વધારો. ૮૯
 હરિનામને ચિત્તમાં તું મઢી લૈ-
 હદે શ્રેય ને પ્રેય બે સાધી લેને,
 હંમેશાં પ્રભુઆશ્રયે લીન રૈને,
 સ્મર્યા વિશ તું ના ઘડી એક ખોજે. ૧૦૩
 હદે નામના જાપની પ્રેમમાળા-
 વહાવો પદે તે સદા ગંગધારા,
 શમાવી પૂરાં બુદ્ધિ ને ચિત્તભાવ,
 તહીં હોમજો પ્રાણની વૃત્તિ સર્વ. ૧૦૭
 સ્મરંતાં સ્મરંતાં થવું એક ધ્યાન,
 સ્મરંતાં સ્મરંતાં થવું એક ધ્યાન,
 સ્મરંતાં સ્મરંતાં થવું હેળમેળ,
 સ્મરંતાં સ્મરંતાં થવું એકમેળ. ૧૦૪

પૂજ્ય શ્રીમોટા એ વખતે હરિજન સેવક સંઘમાં સેવાનું કાર્ય કરતા હતા. કામ કરતાં કરતાં નામસ્મરણ ચાલુ જ રાખતા. એ નામ પ્રેમથી દેવાય એ માટે તો જે તલસાટ જાગવો જોઈએ એ અંગેની હકીકત તેઓશ્રીએ ૧૯૨૪માં કરેલી અનેક પ્રાર્થનાઓમાંની એક પ્રાર્થનામાં કેવી વ્યક્ત થઈ છે એનું આ દાખાંત છે.

ઉંહું રૂહેતું થતું ઉરે સ્મરણ ને નિત્યે પ્રભુભાવથી,
સેવાકાર્ય બન્યા કરે મુજ થકી હંમેશ કેં પ્રેમથી,
ભાવોથી છલકાતું રૂહે ઉર ભર્યું મારું સદા, હે પ્રભુ !
શ્રદ્ધાભક્તિ રહે વળી તુજ પરે, એવી કૃપા દે પ્રભુ.

લોભીને ધન વૃહાલું છે જ્યમ, વળી છે કામીને કામના,
તેવું હું તવ નામ વૃહાલું કરવા હૈયે ધરું ભાવના,
રૂહેવાયે પળ એક ના તુજ વિના, તું અજ્ઞિ એવો, પ્રભુ !
હૈયામાં પ્રગટાવજે વિરહનો, છોને ભલે ના જવું.

છોને પ્રાણ જતા રહે પ્રભુ, અને છો મૃત્યુ આવે કદી,
ને છોને દુઃખ-દુંગરો ન પરવા માથે પડે તેતણી;
કેમેય વીસરાય ના પણ જરીયે નામ તારું પ્રભુ !
તારી પાસ જ એટલું ગરીબ હું માર્ગી રહ્યો છું, પ્રભુ !

‘જીવનદર્શન,’ ચોથી આ., પૃ. ૬-૭

પ્રભુમિલનની તમના, લગની તો લાગી હતી, પણ આ
પ્રાર્થનામાં પોતાના જીવનધ્યેયને ફળાવવા માટે મરણિયો નિરધાર
વત્તિય છે. એમાં ખમીર પણ છે. ઉપરની પ્રાર્થનામાં કર્મ,
ભક્તિ છે છતાંય હૃદયનો તલસાટ એમાં વિશેષ છે.

આ ઉપરથી સમજાય છે કે નામસ્મરણ મન અને હૃદયમાં પ્રતિષ્ઠિત થાય તો જીવનવિકાસની સાધનામાં ગતિ આવે. પૂજ્ય શ્રીમોટાએ નામસ્મરણને પ્રયોગાત્મક રીતે સ્વીકારીને એને એટલું બધું અને એટલી બધી રીતે ઘૂંઠું છે એનો ઈતિહાસ ન્યારો છે. એમાં વિરોષતા એ છે કે તેઓશ્રીએ પોતાના અનુભવના પ્રત્યેક તબક્કાઓને બુદ્ધિગ્રાહ્ય કર્યા છે. નામસ્મરણથી પોતે જે શિખરે પહોંચ્યા ત્યાં સુધીના બધા જ તબક્કાઓનું સ્પષ્ટ પૃથક્કરણ તેઓશ્રીના પત્રોના ગ્રંથોમાં તથા બીજા સંખ્યાબંધ પદ્ય ગ્રંથોમાં છે.

પ્રભુનું નામસ્મરણ એટલે શું ? પ્રભુ એટલે શું ? પ્રભુનું ધામ ક્યાં ? એનું રૂપ કેવું ? એવા પ્રશ્નો કોઈ પણ જીવાત્માને થાય એ સ્વાભાવિક છે. પૂજ્ય શ્રીમોટાએ જીવનસાધનાના આરંભમાં જ આ પ્રશ્નોની પ્રથમ બૌદ્ધિક સ્પષ્ટતા કરી. ‘તુજ ચરણે’ની સ્તુતિમાં, એમણે ભગવાન કેવો હોઈ શકે ? અને કેવાં કેવાં રૂપે એને અનેક સંતલ્પકતોએ અનુભવ્યો અને ઓળખ્યો છે ? તથા અભિલ બ્રહ્માંડમાં એ કેવા તત્ત્વરૂપે રહીને વિલસી રહ્યો છે એનો ભાવનાત્મક તેમ જ બુદ્ધિગ્રાહ્ય આલેખ જોવા મળે છે. આ ઉપરથી આપણને સમજાય છે કે પ્રભુપંથે પળવાને તેઓશ્રીએ પૂરેપૂરું જંપલાયું ત્યારે ઘણી બુદ્ધિગ્રાહ્ય સ્પષ્ટતાઓ પોતે કરી લીધી હતી.

નામસ્મરણ એ સરળ, સહજ અને કોઈ પણ વ્યક્તિ ઉપયોગમાં લઈ શકે એવું સૂક્ષ્મ સાધન છે. ભગવાનના નામનો જ્યુ કરવાથી શાંતિ, હળવાશ કેવી રીતે મળી શકે એનું પૂજ્ય શ્રીમોટાએ કરેલું નિરૂપણ ‘સ્મરણવિજ્ઞાન’ સમું બન્યું છે. આ

ઘટના આપણા દેશના આધ્યાત્મિક વારસામાં વિરલ છે, કેમ કે નામસ્મરણનો મહિમા તો અપરંપાર છે. અનેક સંતભક્તોએ ગાયો છે, પરંતુ એની બુદ્ધિગ્રાહ્ય અને તર્કબદ્ધ સમજૂતી આપણને પહેલી જ વાર પૂજ્ય શ્રીમોટા પાસેથી મળે છે.

પ્રભુના નામસ્મરણથી શરીરના રોગ કેવી રીતે મટે છે તથા કામકોધાઈ કેવી રીતે શમે છે એની સમજૂતી પૂજ્ય શ્રીમોટાએ મહાત્મા ગાંધીને જણાવેલી. આથી, ગાંધીજી પ્રસન્ન થયેલા અને જવાબમાં જણાવેલું કે ‘આ સમજૂતી ઉપરથી મને લાગે છે કે તું આધ્યાત્મિક વિજ્ઞાનનો મોટો વિજ્ઞાની થઈશ.’ (આ હકીકત પૂજ્ય શ્રીમોટાએ શ્રી રમણભાઈ અમીન સાથે કરેલા સત્સંગમાં જણાવી છે.) H_2O સંજ્ઞાથી પાણી અભિપ્રેત છે, પણ એમાં બે પ્રકારના વાયુનું ચોક્કસ પ્રમાણ ભેગું થયું છે. આથી, પાણી થયું છે, એમ અનેક પ્રયોગો પછી સિદ્ધ થયું છે. એ જ રીતે પૂજ્ય શ્રીમોટા નામસ્મરણના અનેક પ્રકારના પ્રયોગો પછીથી જીવન-સિદ્ધિ પામ્યા. મતલબ કે પ્રયોગ સિદ્ધ થયો પછી આધ્યાત્મિક વિદ્યાનું રહસ્ય તેઓશ્રીએ ખુલ્લું કર્યું અને કોઈ પણ બુદ્ધિશાળી એને સ્વીકારી શકે એ રીતે તેઓશ્રીએ રજૂ કર્યું. આથી, નામસ્મરણ એક વૈજ્ઞાનિક હકીકતરૂપે વ્યક્ત થઈ શક્યું.

આખું બ્રહ્માંડ પાંચ તત્ત્વોથી સત્ત્વર છે, પણ માત્ર પૃથ્વી જ એવો ગ્રહ છે કે જ્યાં પાંચેય તત્ત્વો સાથે છે. એ પાંચેય તત્ત્વો એની તત્ત્વમાગ્રાઓ અને ત્રણ ગુણો સાથેના એના સંબંધને સમજાવીને નામસ્મરણથી આકાશતત્ત્વ કેવી રીતે મોખરે આવે છે અને સત્ત્વગુણનો ઉદ્દય થતાં રજસ-તમસના ગુણધર્મો કેવી રીતે ગૌણત્વ પામે છે એની સમજૂતી આપણી મતિને અત્યંત

પ્રકાશિત કરે છે. શબ્દનું મૂળ અને શબ્દના પ્રકાર, એની ગતિ વગેરેના નિરૂપણથી શબ્દશક્તિનો આહ્લાદક પરિચય થાય છે. પૂજ્ય શ્રીમોટાએ ‘ॐ’ શબ્દનું મહત્વ સમજાવ્યું છે. એમાં તાત્ત્વિક દાખિ ઉપરાંત બુદ્ધિગ્રાઘ્ય અભિગમ પણ છે. ‘ॐ’ના બાધ્યકારની પોતે સ્વીકારેલી ભાવના પણ જાણવા જેવી છે. ‘ॐ’માં દેખાતો ‘ઉ’ અંક-જે તે બધું ત્રાણથી ઉપજ્યું છે અને ત્રાણથી જ ટકે છે અને એમાં લીન થઈ જાય છે એ સૂચવે છે. ઉત્પત્તિ, સ્થિતિ અને લય, સત્ત્વ, ૨૪૪ અને તમસ એમાંથી અને આ વિશ્વ સ્હૃંગું છે એ ‘ઉ’ સાથે જોડાયેલ વળાંકવાળી લીટી દ્વારા સૂચવાયું છે. જગત અને જગતના સર્વ પદાર્થો અને ભાવોથી પર ઈશ્વરભાવ અર્ધ ચંદ્રાકારના ચિહ્નનથી સૂચવાય છે. આથીયે પર બિંદુરૂપે રહેલ પરબ્રહ્મનું પ્રતીક સૂચવાયું છે. આ બાબત તેઓશ્રીએ એક જાહેર સત્તસંગમાં જણાવી હતી.

ॐના ઉચ્ચારણથી ક્યાં ક્યાં સ્પર્શ થાય છે અને એનાં આંદોલનો કેવાં પરિણામ નીપજાવે છે એનું નિરૂપણ પણ સ્પષ્ટ છે. જપનો કોઈ પણ શબ્દ ભલે હોય પણ ઊંઠી માધુર્ય ઉમેરાય છે એ હકીકત નોંધપાત્ર છે. એ તો પ્રયોગ કરનારને અનુભવાય એવી હકીકત છે. જપ માટેના શબ્દની પસંદગી કરવા પાછળનું વિવરણ પણ આપડો સૌ સ્વીકારી શકીએ એવું સરળ વ્યવહારું છે.

જપ કેવી રીતે કરવો, કેવા ભાવથી કરવો, એ વખતે કેવી રીતે હેતુનું ધ્યાન રાખવું વગેરે બાબતો દ્વારા નામસ્મરણની પદ્ધતિઓ તેઓશ્રીએ દર્શાવી છે. એમાં વિજ્ઞાનની પૃથક્કરણાત્મક પદ્ધતિનો આપણને પરિચય થાય છે. નામસ્મરણ ભાવ સાથે

થવું જોઈએ. દિલથી થવું જોઈએ. પ્રેમથી થવું જોઈએ. પોતાને એ રીતે સ્મરણ કરતાં જે રીતે મથવું પડેલું એનું સચોટ ધ્યાન તેઓશ્રીએ આ ગજલમાં કર્યું છે.

સ્મરણ શું કોરું કોરું તે શરૂ શરૂમાં થયેલું છે,
પરંતુ જેમ અભ્યાસ થતાંમાં તો વહેલું છે.
વધારે ને વધારે મેં સમય સ્મરણો જ ગાળીને,
સ્મરણમાં ભાવ પ્રેરાવા મથામણ ખૂબ કરેલી છે.

સતત મંડ્યા રહેવાતાં પ્રયત્ને એકધારાએ,
થયા કરતાં હદ્ય કેવો સ્મરણમાં રસ પડેલો છે !
પ્રયત્ને રસ પડ્યો છે જ્યાં, પ્રયત્નો તે થવા વિશે,
હદ્ય શું ઉછળેલું છે ! પ્રયત્નો તે ફળેલા છે.

‘જવનસ્મરણ’ પૃ. ૮

આરંભમાં કોરું કોરું સ્મરણ થાય એનો અભ્યાસ-પ્રેક્ટિસ-ન મૂકી દેવો. વધુ ને વધુ સમય નામસ્મરણમાં ગાળીને સ્મરણ કરવા ભાવ પ્રેરાય એટલા માટે મથવું જોઈએ. એવા એકધારા સતત પ્રયત્નથી હદ્યમાં નામસ્મરણનો રસ નિષ્પન્ન થાય છે. જ્યારે પ્રયત્નોથી રસ નિષ્પન્ન થયો છે એવું જાણ્યા પછી પ્રયત્નો કર્યા કરવામાં હદ્યનો ઉમળકાભર્યો ઊંઘાળો રહ્યા કરે છે. આ આઠ પંક્તિમાં પૂજ્ય શ્રીમોટાએ સ્મરણને રસીલું બનાવવાની પ્રક્રિયા સૂચવી છે. એ સાથે ભારે જહેમત-પ્રયત્નનું ગૌરવ પણ કર્યું છે.

પ્રભુનું નામસ્મરણ અંતઃકરણોને કેવાં કેળવે છે એ ‘નામસ્મરણસાધના’વાળા પ્રકરણમાં વિગતે રજૂ થયું છે. નામસ્મરણ સાથે પ્રાર્થનાભાવ રાખ્યા કરવાનું તેઓશ્રી સૂચવે

છે, કેમ કે પ્રાર્થનાથી હૈયામાં ભાવ જાગે છે અને એ ભાવને નામસ્મરણ સાથે જોડવાથી એ સ્મરણભાવ હૃદયમાં ઉંડો ઉત્તરે છે. શબ્દ જ માત્ર નહિ પણ શબ્દની ભીતર રહેલો ભાવ હૈયામાં પરોવ્યા કરવાનો છે. કર્મ કરતાં કરતાં સ્મરણથી જે ધૂન જાગે છે, એક પ્રકારનો લય જાગતો હોય છે એને જાગૃતિથી હૈયામાં વાળ્યા કરવાનો છે. નામસ્મરણથી સાધના એ અસાવધ રીતે કરવાની સાધના નથી. આ હકીકતનું નિર્દર્શન તેઓશ્રીએ નીચેની ગજલની પંક્તિઓમાં કરાવ્યું છે.

‘હરિ:ॐ’ ભાવની ધૂન કરતાં કર્મમાં જ્યાં ત્યાં,
પરોવ્યા તે કરી હૈયે રહેજો જાગતાં જ્યાં ત્યાં.
સ્મરણ પ્રભુભાવનું ઉંઠું કર્યા કરજો સ્તવી સ્તવીને,
પ્રભુ ચેતાવવા હૃદયે બધું તે તે જરૂરી છે.

પૃ. ૧૫૨

● ● ●

સ્મરણ વિના પ્રભુના તે કશું ના કર્મ બનવા દો,
સ્તવંતા અંતરે રહીને પ્રભુને, સર્વ બનવા દો.

પૃ. ૧૪૨

● ● ●

પ્રભુના નામની ધૂન જગાડીને લગાડીને,
મતિ, મન, ચિત્ત, અહું, પ્રાણ કરો જોડ્યા ચરણમાં તે.

પૃ. ૧૨૦

‘પ્રણામપ્રલાપ’, પ્રથમ આ., ૧

આપણાં અંત:કરણો-મન, બુદ્ધિ, ચિત્ત, પ્રાણ અને અહમ્મુનામસ્મરણથી કેવાં કેવાં રૂપે પ્રગટે છે, એનાં કેવાં લક્ષણો વર્તાય છે અને એની શક્તિને નામસ્મરણથી કેવી રીતે

પ્રભુશરણે વાળી લેવાય-એ બધી પદ્ધતિઓ પૂજ્ય શ્રીમોટાએ દર્શાવી છે.

પૂજ્ય શ્રીમોટાએ નામસ્મરણ અંગે એક ખૂબ મહત્વની બાબત કહી છે. નામસ્મરણ એકધારું, સતત લેવાયા જાય અને એમ કરતાં નિરંતર થાય એ પછી જ શુદ્ધિ અનુભવાય છે. આથી, જ્યાં સુધી નામસ્મરણને નિરંતર-અખંડ ન બનાવાય ત્યાં સુધી સ્મરણસાધનાનો પૂરો લાભ પામી શકતો નથી. નામસ્મરણ મનહૃદયમાં સાથી બનીને નિરંતર રહે એ માટે પૂજ્ય શ્રીમોટાએ એક પ્રાર્થના રચી છે. જે જીવોનું એ દિશામાં મોં ફર્યું છે, પણ ગતિ વિધિ નથી એમને માટે એ દિશામાં જવા દોરવણી મળે એવી આ પ્રાર્થના છે. આપણા દૈનિક વહેવારની તથા આપણાં અંતઃકરણોનાં વલણોની પૂરી સ્પષ્ટતા આ પ્રાર્થનામાં છે. એવી બધી જ પળે નામસ્મરણ રહ્યા કરે એવી ભાવના રોજ રોજ દફાવવી જોઈએ.

સ્મરણભાવના

(હરિગીત)

પ્રિય નામને ઉરમાં સ્મર્યા કરશું અમે બહુ ગ્રેમથી,

પ્રિય નામને ઉરમાં સ્મર્યા કરશું અમે બહુ રીતથી.

પ્રિય નામને ઉરમાં સ્મર્યા કરશું અમે બહુ ખંતથી,

તુજ નામનો પ્રભુ તંત જરી ના છોડશું હરગિજ કદી.

જીવનતણા અતિશય કઠણ દારુણ ઝંગાવાતમાં,

કે સહુ દિશે સૂર્યે નહિ એવા જીવન અંધારમાં,

જીવનતણી ચઢતી અને પડતીમહીં પળપળ સદા,

તુજ નામનું પ્રિય સ્મરણ તે સાથી રહો મનહૃદયમાં.

સંસારનાં કર્તવ્યમાં, વ્યવહારીઓની સાથમાં,
સહુ કામમાં, ખાતાં, પીતાં, ઊઠતાં અને વળી બોલતાં,
જે જે કંઈ કરતાં, બધાંની સાથ વર્તતાં સદા,
તુજ નામનું પ્રિય સ્મરણ તે સાથી રહો મનહદ્યમાં.

મુશ્કેલીમાં નડતી અમોને ને ઉપાધિમાં જગે,
જઘડા અને કંકાસમાં, દિલમાં થતા સહુ દર્દમાં,
દિલની અમૃતજાણમાં અને આવી પડેલી ગૂંચમાં,
તુજ નામનું પ્રિય સ્મરણ તે સાથી રહો મનહદ્યમાં.

મનના વિચારોમાં અને મનની બધીયે વૃત્તિમાં,
મન વાસનામાં, પાપમાં, ચિત્તના બધા સંસ્કારમાં,
મનની રમત ને ગમતમાં મનના રમણ ને વલણમાં,
તુજ નામનું પ્રિય સ્મરણ તે સાથી રહો મનહદ્યમાં.

અમ શરીરથી બનતી કિયામાં, હંડ્રિયોના વિષયમાં,
અમ શરીરકેરા રોમરોમે, હદ્યકેરા લોહીમાં,
રગ રગમહીં નખશિખમહીં, ને શરીરના નવદ્વારમાં,
તુજ નામનું પ્રિય સ્મરણ તે સાથી રહો મનહદ્યમાં.

ખટરસતણા સહુ સ્વાદમાં, મીઠી મીઠી બધી વાસમાં,
ઉર ચેતનામાં, બુદ્ધિમાં, ચિત્ત પ્રેરણામહીં, પ્રાણમાં,
અમ લાગણીમાં, ભાવનામાં, પ્રેમમાં, રસમાં બધા,
તુજ નામનું પ્રિય સ્મરણ તે સાથી રહો મનહદ્યમાં.

આધાર સૌ નિજનો સદા માની ઉપર જે ધારતું,
માને અતિશય વૃદ્ધાલથી જ્યમ બાલું પોકારતું,

વિખૂટું પડેલું મારીથી હરપળ કરે શું આરહ્યાં !
તેવી રીતે તુજ નામ પ્રભુ ! તારું સ્મરાજો તાનમાં.

જીવનતણા સહુ ભંગમાં, જીવનતણા સહુ રંગમાં,
જીવનતણા એ અટપટા આડા ઊભા સહુ તારમાં,
મારી ગમે તેવી ભલે હો સર્વ જીવનભાતમાં,
રસીલું વણાયાં ત્યાં કરો પ્રિય નામ તારું ભાવમાં.

સંબંધીઓ ને સ્વજનની સહુ વાતમાં ને ચીતમાં,
સંસારના વ્યવહારમાં ને જે થતા સહુ કાર્યમાં,
પત્ની અને પરિવારમાં છોને પરોવાયેલ હો,
તે તે દશામાંહે પ્રભો ! તુજ નામ પ્રિય હૈયે વસો.

પ્રિય નામ-સૂર્ય ઊંયા થકી ઝીટે જીવનઅંધાર સૌ,
એવું કૃપાથી જીવનમાં અમને ફૂલવજો ફળવજો,
ચાનક અમોને લાગજો તુજ દિવ્ય જે પ્રિય નામની,
પ્રગટી રહો અમ જીવન તે છાયારૂપે તુજ પ્રેમની.

સારાય જીવનપટ્ટતણા તાણા અને વાણા વિશે,
ભીજાયેલા હો રગરગે તુજ પ્રેમથી રંગાયેલા,
તુજ નામના પ્રિય સ્મરણના ઠોકે સદા ઠોકાયેલા,
એવું પ્રભુપદ હો સમર્પિત આ જીવન હો, તુજ કૃપા.

તુજ નામનો મહિમા ઋષિઓ કેંક ભક્ત કવિ કથે,
હું તો બિચારું રાંકડું તે શું કથી કથીને કથે ?
જ્યમ સૂર્ય આગળ આગિયો, દરિયા કને ખાબોચિયું,
હીરા કને જ્યમ કાચ એવો સાવ હું નાદાન છું.

‘શ્રીગંગાચરણે’ પૃ. ૨૮ થી ૩૨

પૂજ્ય શ્રીમોટાએ નામસ્મરણ વિશે પુષ્કળ પ્રમાણમાં લખ્યું છે. એનાં અનેક પાસાંઓનું નિરૂપણ કર્યું છે. પોતે કરેલી સાધનાનો ઈતિહાસ આદેખતા આ બધું લખાયું છે. એ બધું જ આ નાનકડા પુસ્તકમાં આવરી લેવાયું નથી.

પૂજ્ય શ્રીમોટાના અન્ય પદ્ય ગ્રંથોનો અત્યાસ કરાય તો ઘણી જ ગૂઢ હકીકતોની પ્રતીતિ જિજ્ઞાસુને જરૂર થાય.

‘નામસ્મરણ’નું આ સંકલન એ પૂજ્ય શ્રીમોટાના અક્ષર સ્વરૂપની ઉપાસનાનું પરિણામ છે. ઘણાં વર્ષોથી આવું એક સંકલન કરવાની ભાવના રહ્યા કરતી હતી. મુરબ્બી પ્રિય જીજાભાઈ પટેલે આ ભાવનાને સાકાર થવા પ્રેરણા આપી, એ માટે એમનો હદ્યપૂર્વક આભાર માનું છું. આ સંકલન નામસ્મરણની સમગ્રતાને આવરી લેતું નથી-એ સ્પષ્ટ કરવું જોઈએ. આમ છતાં શ્રેયાર્થીને નામસ્મરણ વિશે બૌદ્ધિક સ્પષ્ટતા થવામાં આ સંકલન સહાયક બની રહેશે એવી પ્રતીતિ છે.

આ પુસ્તકના સંકલન-સંપાદનનું કાર્ય પાર ઉતારવા હરિઃॐ આશ્રમ, સુરતના કાર્યકરોએ ખૂબ જ પ્રેમ અને ઉમળકાથી અનુકૂળતા કરી આપી એ માટે એમનો આભારી છું.

મને શ્રદ્ધા છે કે આ નાનકદું પુસ્તક આપણને જીવનમાં નામસ્મરણ લેવાની પદ્ધતિ પ્રેરશે અને એના હેતુનું જ્ઞાન જગ્યાત કરાવશે.

તા. ૨૧-૨-૧૯૮૮

રમેશ મ. ભડ્ય

॥ હરિ:ઊં ॥

નિવેદન

(પ્રથમ આવૃત્તિ)

ભગવાનના નામસ્મરણની સાધના દ્વારા પૂજ્ય શ્રીમોટા પરમ પદને પાખ્યા. તેઓશ્રીએ નામજપની સાધના અંગે પત્રોમાં તથા એમનાં બીજાં બધાં જ પુસ્તકોમાં અનેક રીતે લખ્યું છે. કેટલાંક વર્ષો પહેલાં નામસ્મરણ વિશે ટૂંકું લખાણ શ્રી રજનીભાઈ બર્માવાલાએ તારવેલું. એનું યોગ્ય સંકલન-સંપાદન કરીને શ્રી રમેશભાઈ ભણે ‘નામસ્મરણ’ વિશે નાનકડી પુસ્તિકા તૈયાર કરેલી. અમદાવાદથી શ્રી યશવંતભાઈ પટેલે એનું પ્રકાશન કરેલું. એ પુસ્તિકા તરત જ ખપી ગયેલી. આથી, નવી આવૃત્તિ કરવાની ઈચ્છા રહ્યા કરતી હતી. આ અંગે અમે શ્રી રમેશભાઈને વાત કરી. એમણે તો ‘નામસ્મરણ’ વિશે પૂજ્ય શ્રીમોટાએ જે વૈજ્ઞાનિક નિરૂપણ કર્યું છે એનું નવેસરથી સંકલન કરવાની પોતાની ભાવના દર્શાવી.

શ્રી રમેશભાઈ ‘નામસ્મરણ’ વિશેના પૂજ્ય શ્રીમોટાના લખાણનું સંકલન કરવા તા.૮-૨-૧૯૮૨ થી તા.૧૬-૨-૧૯૮૨ દરમિયાન હરિ:ઊં આશ્રમ, સુરતના મૌનઓરડામાં બેઠા. એમના આ મૌનએકાંત દરમિયાન જે કામ થયું એ અધ્યાત્મરસિક જિજ્ઞાસુ ગુજરાતી પ્રજા સમક્ષ મૂક્તાં અમને ઘણો આનંદ થાય છે, કેમ કે પૂજ્ય શ્રીમોટાએ નામસ્મરણને લગતું જે લખ્યું છે એ કોઈ પણ બુદ્ધિશાળી વ્યક્તિ સ્વીકારે એ રીતનું છે.

‘નામસ્મરણ’ વિશે આ સંકલન-સંપાદન કરી આપવાની રમેશભાઈએ તત્પરતા દર્શાવી અને ઉમંગથી એ કામ પાર પાડી આપ્યું, એ માટે અમે એમની ભાવનાની કદર કરીએ છીએ.

આ પુસ્તક પ્રગટ કરીને શ્રી નગીનભાઈ પટેલ હરિ:ઊં આશ્રમને બેટ આપ્યું છે. ડૉ. ઠાકોરભાઈ પટેલ (સરભોણ)ની પુત્રી જ્યોતસ્નાબહેન ઉર્ફ કલુબહેન સાથે લગ્ન થયા પછી પૂજ્ય શ્રીમોટા સાથે એમનો પરિચય અને સંબંધ થયો. એમના સુરત નિવાસ દરમિયાન શ્રી નગીનભાઈ, હરિ:ઊં આશ્રમે પૂજ્ય શ્રીમોટાનાં દર્શન માટે આવે અને પૂજ્યશ્રીની તથા આશ્રમની સેવા દિલની ભક્તિથી કરે. શ્રી નગીનભાઈ વિદ્યાનગરથી સ્થિવિલ અંજિનિયરીંગનો અભ્યાસ કરીને ઈંગ્લેડ જઈને હાલ અમેરિકામાં સ્થાપી થયા છે. પોતાના કુટુંબ સંસ્કારોથી અધ્યાત્મરસિક છે. પ્રભુનું નામસ્મરણ, ધ્યાન વગેરે કરે છે. અમેરિકામાં પૂ. બાલ યોગેશ્વરના સંપર્કથી ધ્યાન પ્રક્રિયા પણ કરે છે. પૂજ્ય શ્રીમોટાના આવા એક જિજ્ઞાસુ સ્વજનની ભાવનાની અમે કદર કરીએ છીએ અને એમનો હદ્યપૂર્વક આભાર માનીએ છીએ. આ પુસ્તકનું ટાઈટલ ચાર રંગમાં આકર્ષક બનાવીને સાહિત્ય મુદ્રણાલયે (અમદાવાદ) વિના મૂલ્યે છાપી આપ્યું છે. આ માટે અમે શ્રી શ્રેયસભાઈ પંડ્યા તથા શ્રી યજોશભાઈ પંડ્યાનો હદ્યપૂર્વક આભાર માનીએ છીએ.

પૂજ્ય શ્રીમોટાનું આ પુસ્તક ખરીદીને વાંચે એવી ગુજરાતી પ્રજાને વિનંતી કરીએ છીએ, કેમ કે પૂજ્ય શ્રીમોટાનાં પુસ્તકોના વેચાણમાંથી થતી આવક પૂજ્ય શ્રીમોટાએ પ્રેરેલાં સમાજોપયોગી કાર્યો પાછળ જ વપરાય છે.

હરિ:ઊં આશ્રમ,

કુરુક્ષેત્ર, જહાંગીરપુરા, સુરત-૩૮૫ ૦૦૫
તા. ૧૧-૪-૧૯૯૨ (રામનવમી)

જીણાભાઈ મ. પટેલ

બ્યાંસ્થાપક ટ્રસ્ટી

॥ હરિ: ઊં ॥

નિવેદન (પાંચમી આવૃત્તિ)

પૂજ્ય શ્રીમોટાએ સમાજને કેટલાક પાયાના સંદેશા આપ્યા છે. તેમાં પરમાત્મા સમીપ રહેવા માટે 'નામસ્મરણ'નો સંદેશ મુખ્ય અને પ્રથમ હરોળનો છે.

'નામસ્મરણ'ના સંદેશાને સમજવા માટે પૂજ્ય શ્રીમોટાનું આ પુસ્તક ધાણું (ઉપયોગી) છે.

પૂજ્ય શ્રીમોટાનાં કેટલાંક પુસ્તકો ધાણા સમયથી અપ્રાપ્ય છે. તેમાં આ પુસ્તકનો પણ સમાવેશ થાય છે. અપ્રાપ્ય પુસ્તકોનું પુનર્મુદ્રણ કરાવવાનું કાર્ય હાથ ધરવામાં આવ્યું છે, તે અન્વયે આ 'નામસ્મરણ' પુસ્તકનું પુનર્મુદ્રણ કરાયું છે.

પૂજ્ય શ્રીમોટાના સ્વજન એવા સ્વ. શ્રી ઉપેન્દ્રભાઈ અલમૌલાની પુષ્યસ્મૃતિમાં તેમના પરિવાર તરફથી 'નામસ્મરણ' પુસ્તકના પુનર્મુદ્રણના આ કાર્યમાં અમોને આર્થિક સહયોગ ગ્રાપ્ત થયો છે, તે બદલ એ સદ્ગત સ્વજનના અને તેમના પરિવારના અમો ખૂબ ખૂબ આભારી છીએ.

આ પુસ્તકની મુદ્રણશુદ્ધિનું કાર્ય પૂરા સદ્ગત અને ચોકસાઈપૂર્વક શ્રી જ્યંતીભાઈ જાનીએ કરી આપ્યું છે. ટાઈટલ ડિઝાઇનનું કાર્ય શ્રી મયૂરભાઈ જાનીએ કરી આપ્યું છે. આ પુસ્તકને સદ્ગત છાપી આપવાનું કાર્ય સાહિત્ય મુદ્રણાલયના શ્રી શ્રેયસભાઈ પંડ્યાએ કરી આપ્યું છે. પૂજ્ય શ્રીમોટા પરત્વેના ભક્તિભાવથી પ્રેરાઈને આ સર્વેએ આ પ્રકાશનમાં આપેલા સહકાર બદલ તે સૌના અમો ખૂબ ખૂબ આભારી છીએ.

અગાઉની આવૃત્તિઓની જેમ આ નવી આવૃત્તિને પણ સ્વજનો આવકારશે એવી આશા અને શ્રદ્ધા છે.

તા. ૨૬-૨-૨૦૦૬

મહાશિવરાત્રી

ટ્રસ્ટીમંડળ,
હરિ:ઊં આશ્રમ, સુરત.

નામસ્મરણ



પૂજ્ય શ્રીમોટા

‘હું સર્વત્ર વિદ્યમાન હું.’

‘જીવનદર્શન’, ૧૦મી આ., પૃ. ૩૮૨

- શ્રીમોટા

૧. નામસ્મરણમહિમા

નામસ્મરણ એ તો આપણું એક મુખ્ય અંગ છે જ. એ તો આપણને ધનંજ્યના ગાંડિવની જેમ, પતિતપાવની ગંગાની જેમ અથવા બરફને ઓગાળી નાખનાર સૂર્યનાં કિરણોની જેમ છે. જ્યાં નદી સમુદ્રને મળે છે ત્યાં સંગમસ્થળ આગળ કેટલીક નદીઓ જોશથી દરિયામાં ઘણો લાંબે સુધી પેસી જાય છે, તેના જેવી નામસ્મરણની સરિતાની અસર છે. આ ઉપમા પણ બરાબર નથી. નદીના પ્રંચડ પૂરમાં તણાતા માણસને કોઈક લાકું મળી જાય એના જેવું, ભૂખથી વ્યાકુળ થયેલાને અન્નની પ્રાપ્તિ જેવું, તૃપ્તિ કંઠને જલની ઠંડક અને મીઠાશ જેવું, અનેક મુશ્કેલીઓને ઓળંગીને આખરે અભિસારિકાને મળનાર પ્રેમીના જેવું, કંજૂસના ધન જેવું અથવા લાડકવાયા દીકરા જેવું, હૈયાની હામ જેવું, દુકાળમાં વર્ષા જેવું, કંક્ષીને ઈચ્છિત વસ્તુ મળવા જેવું છે, સત્સંગીને સંગી મળવા જેવું અથવા શ્રમિતને આરામ મળવા જેવું છે. આ તો બધું સાહિત્યિક વર્ણન કહેવાય. મીઠાઈનું વર્ણન વાંચ્યાથી કે સાંભળ્યાથી ઓછી જ તે મોંમાં આવી જાય છે? એવા વર્ણનથી આપણી તૃપ્તા ન છીપે.

નામસ્મરમણ એ આપણું એક રીતનું જીવન છે. કોઈ દિવસ જમ્યા વગર જીવાય, પણ જેને ભગવાનને શરણે જવું છે તેવાને નામસ્મરણ વિના એક દિવસ પણ ન ચાલવું જોઈએ. સ્થૂળ રીતે, દેખીતી રીતે, નામસ્મરણ વિના સ્થૂળ જીવન ચાલી શકે છે, પણ પ્રભુમય જીવન માટે નામસ્મરણ પ્રાણ સમાન છે. એ ન હોય તો કશું નથી. એટલે ધ્યાન વગેરે કરતાં પણ એનું સવિશેષ ધ્યાન રાખવાનું તો આપણામાં પ્રધાનપણે છે જ, પણ જ્યારથી આપણને એનો વિશેષ ધ્યાલ આવે ત્યારથી એ બાબતમાં ઉત્સાહિત થઈને

મંડ્યા કરવાનું રાખીશું તો સારું જ છે. ભગવાનના નામનો મહિમા તો અપરંપાર છે. નામી કરતાંથે નામ ચઢી જાય એમ આપણામાં કહેવાય છે.

ભગવાનના નામનો મહિમા અપરંપાર છે. તેનું કારણ એ છે કે આપણામાં રહેલ તત્ત્વોને વિકસાવવાની અજ્ઞબ શક્તિ નામસ્મરણમાં છે. જેટલું વધારે ભગવાનનું સ્મરણ રહે એટલો વધારે ભાવ આપણામાં આપોઆપ એના તરફ વધે, કારણ કે નામની પાછળ જીવતાજગતા સંકલ્પનું બળ જ હોય છે અને પ્રેરણાત્મક બળ નામીની ભાવનાને મૂર્તિમંત આપણામાં કરી દે છે. કંઈ પણ કામ કરતાં પણ જો આપણું નામસ્મરણ રહ્યા કરતું હોય તો એ કામ આપણે ભગવાનના એક સાધન તરીકે જ કરીએ છીએ એવી ભાવના આપણામાં ઉંડી ઉત્તરતી જ જાય, કેમ કે આપણને ઉંદું ભાન તો એ નામસ્મરણને લીધે રહે કે આપણે એ કામ કરતાં ભગવાનની શક્તિનું આહ્લાદન જાણોઅજાણો કરીએ છીએ. એટલે એ શક્તિ થોડીવતી પણ આપણામાં ઉત્તરે જ. એ શક્તિને આપણે જ્યારે નામસ્મરણથી જ્ઞાનપૂર્વક જગ્યાત કરીએ છીએ ત્યારે એ શક્તિ વળી વધારે શક્તિ માટે આપણામાં ભૂખ જગાડે છે. તમના ઉપજાવે છે. આપણા જીવનમાં અને જીવનના દરેક કાર્યમાં પોતાની સુવાસ ફેલાવે છે અને પોતાની પ્રત્યે પ્રેમ જગાડે છે તથા જન્માવે છે, અને એમ વ્યાજનુંય વ્યાજ ઉમેરાતું જ જાય તો જેમ મૂડી કંઈ કેટલાયગણી વધી જાય તેમ નામસ્મરણનું એક નાનું જરણું પોતાનાં એવાં અનેક જરણાંને પોતાની તરફ બેંચીને પોતાનામાં ભેળવીને એક મોટી નદી થાય છે, જે આખરે ભગવાનરૂપી અનંત સાગરમાં ભળે છે. એ નામસ્મરણનો મહિમા તો માત્ર અનુભવી જ વર્ણવી શકે. એની

મજા તો એને લુંટનારા જ ચાખી શકે. એના મહિમા વિશે એક ભજન છે. તેમાં લઘ્યું છે :-

‘ગાયો તુલસીદાસે એને, ભક્તજનોએ લહો,

રાંક તે એને હું શું જાણું, હું તો નાનું છોરું.’

નામસ્મરણનો મહિમા જગતમાં અનેકવાર પુરવાર થઈ ચૂક્યો છે. એ કંઈ ગપગોળા નથી, પણ પ્રસિદ્ધ વાત છે. અનેક સંતભક્તોએ એના ઉપર જીવન ન્યોધાવર કર્યા છે અને હાલમાં એવા છે કે જેઓનું જીવન નામસ્મરણથી ધન્ય થયું હોય. મહાત્મા ગાંધીજીએ પણ પોતાને મળેલી શક્તિનો આધાર નામસ્મરણ છે એમ અનેકવાર જાહેર કરેલું છે. એઓ તો શરીરની સુખાકારી માટે પણ નામસ્મરણનો ઈલાજ બતાવતા એ જાણીતી વાત છે. આમ, નામસ્મરણ એક રામબાણ ઈલાજ તરીકે સિદ્ધ થયેલ વસ્તુ છે. તે શરૂઆતમાં દિલને ઓપ ચઢાવે છે, પણ પછી તો આખા આધારનું દિવ્ય રૂપાંતર-પરિવર્તન તે કરાવે છે. એટલી અવસ્થાએ પહોંચ્યા પહેલાં પણ તે દુઃખી દિલને આરામ આપે છે, તેની તપેલી લાગણીઓને શાંત કરે છે, તેનો પ્રેમ વિકસાવી તથા ઊંડો કરી તેને પ્રેમીમાં ફેરવી નાખે છે. એ સર્વ કંઈ છે.

પ્રાચીન હિંદની સંસ્કૃતિ વિશે અભિમાન ધરાવનારા કેટલાક એમ કહે છે કે વેદના વારામાં વિમાન પણ હતાં અને અંજિન પણ હતાં. સર્વ કળાઓ અને શાસ્ત્રો વેદમાં લખેલાં પડ્યાં છે એવો દાવો તેઓ કરે છે, પણ નામસ્મરણની બાબતમાં આવા દાવાનો સવાલ જ નથી રહેતો, કેમ કે સર્વ વસ્તુઓ એમાં જ સમાયેલી છે અને જુદા જુદા દેશના તથા કાળના અસંખ્ય સંતોનો ઈતિહાસ એની સાક્ષી પૂરે છે. જગતમાં દેખાતી સર્વ સમૃદ્ધિ પણ એના પ્રભાવ આગળ ધૂળ સમાન છે.

એવું નામસ્મરણ આપણા દિલમાં સતત જાગે ત્યારે આપણો સૂર્ય ઊગવા માંડ્યો છે અને સાચા જીવનની શરૂઆત થવા માંડી

છે એમ ગણી શકાય. જેને દિલમાં જિજ્ઞાસા અને તમન્ના જગી
 હશે અને એમ થવાનું જ છે. જેને એવી વૃત્તિ પણ જગી છે તેને
 પણ યથાશ્રમે એ પ્રાપ્ત થવાનું પણ છે જ એમાં પણ શંકા નથી.
 ભગવાન પોતાનું પ્રાગટ્ય ઉદ્ભવવાને આપણા કરતાં વધારે
 આતુર છે એ વાત નક્કી છે, પણ એથી તો આપણે વધારે જગૃતિ
 અને કાળજી રાખવાની જરૂર રહે છે, કેમ કે આપણે એવી ભૂમિકા
 તૈયાર કરવામાં મંડ્યા જ રહ્યા કરેલા હોવા જોઈએ. આપણા
 જીવનમાં કંઈ અન્યથાપણું ન રહેવું જોઈએ. બીજ વાવવાને માટે
 જમીનને જેમ એકરસ કરી દેવામાં આવે છે તેમ આપણે પણ
 કરતા રહેવાનું છે. ખરી રીતે તો ભગવાનને પ્રગટ થવાપણું રહેતું
 જ નથી. અમુક રીતે થવાયું એટલે આપોઆપ એ તો પ્રગટે જ
 અથવા પ્રગટી રહેલો જ છે, પણ આપણા જીવનનો કમ અને
 જીવનની દસ્તિનો કમ એ બંને ઊલટી બાજુનાં હોય છે. એટલો
 જ મૂળમાં વાંધો છે. એક ઠેકાણે ગાયું છે કે ‘સંતકૃપાથી છૂટે માયા,
 કાયા નિર્મળ થાય જોને.’ પણ ત્યાં પણ ‘સંતકૃપા’ એટલે
 ભગવાનની કૃપા. એની કૃપા હોય-મળે, તો જ એવી કૃપા એના
 યંત્રરૂપે મળી રહેવાની જ છે એ નિશ્ચિત વાત છે. માત્ર, આપણે
 આપણું સર્વ કાર્ય મન દઈને, યજ્ઞરૂપે, એના શરણભાવે કર્યા
 કરીએ અને એનામાં વિશ્વાસ ધરીએ કે એ યોગ્ય કાળે યોગ્ય
 કરશે જ. બસ એટલું થયું એટલે આપણું કામ પત્યું. એમ આપણે
 હૃદયથી નિશ્ચિત રહ્યા કરીને આપણા ભાગનું જે કંઈ હોય તે
 પૂરતું દક્ષતાથી કર્યા કરીએ અને એમાં કોઈને કંઈ પણ કહેવાપણું
 બાકી ન રહે એવી રીતે કરીએ. એમ વત્યા કરીએ તો આપણને
 પણ નિરાંત છે.

‘જીવનસંદેશ’, બીજ આ.,

પૃ. ૨૫૫ થી ૨૫૮

નામમહિમા

(જૂલાણા)

શાસ્ત્ર હું ના ભણ્યો, વેદવેદાંતને, ના કશું જાણું છે એ વિશે મેં,
તોય પ્રિય નામનું એક શરણું ગ્રહ્યો, હદ્ય સ્થિર તે થતાં સર્વ લાખે. ૧

તે પ્રભુનામનો કેંક મહિમા બધો, કેમ કરી મૂર્ખ વર્જન કરું હું,
સૂર્ય ઢાંક્યો ન રે' વાદળાંએ કરી, તેજ થોડા સમયમાં પ્રકાશે. ૨

જો જરા ઉતરી કેં ઉંઠું ત્યાં જુઓ, નામરૂપે બધુંયે જણાશો,
'નામ' વિષા કેં કશું વિશ્વમાં શું દીહું? નામ સર્વસ્વ જ્યાં ત્યાં બધ્યે. ૩

તોય ના માનવી હદ્યમાં તે ઠરે, શું કરે નામ એને પછી કેં?
દાણિ જ્યાં જ્યાં પડે નામ ત્યાં ત્યાં ખરે, નામ વિના નથી ક્યાંય કશુંયે. ૪

નામ જો હોય ના કંઈ કશાનું કશો, સર્વ અટકી પડે તે બધ્યે,
નામ આધારથી સહુ કંઈ તે થતું, હુંપણું માનવી મૂર્ખ રાખે. ૫

માનવી મૂર્ખતા ક્ષુદ્ર કેવી દીસે, ત્યાગ મિથ્યાત્વનો કેમ આવે?
સૂર્યની આગળે આગિયો ક્ષુદ્ર છે, તેથીયે તે વધુ નામ આગે. ૬

જાનમાં ઓળખે કોઈ પણ ના છતાં, ફોઈ વરની થઈ ખૂબ મૂછાલે,
ભારનો પોટલો માનવી શિર લઈ, વરની મા ના છતાં મુહોડ ઘાલે. ૭

નામની નાથમાં હદ્ય નથ્યઈ જતાં, દોરશે નામ ત્યાં આપમેળે,
કંઈ કશો ભાર ના કંઈ જ ચિંતા ન ત્યાં, દિવ્ય નિશ્ચિતતતા નામખોળે. ૮

'જવનપાથેય', ગ્રીજ આ.,

પૃ. ૧૧૦-૧૧૧

૨. નામસ્મરણનો પ્રયોગ

નામજપનો આરંભ

મને શરીરે ફેફડું થયેલું ત્યારે આરામ લેવાને નિભિતે રજા લઈને બે વાર નર્મદા કાંડે જવાનું બનેલું. એકવાર તો મારી સાથે શ્રી મહેશભાઈ મહેતા તથા શ્રી ભાનુપ્રસાદ પંડ્યા હતા. બીજી વાર તો તદ્દન એકલો હતો. નર્મદા નદીના મોખડી ઘાટની પાર એક રણાછોડજનું મંદિર હતું. ત્યાં થોડાક દિવસ રહેવાનું કરેલું. ત્યાં એક સાધુ મહાત્મા રહેતા હતા. તેમની હું રોજ સેવાચાકરી કરું. ત્યાં પણ આ શરીરને ચારપાંચ વાર ફેફડુનો હુમલો આવેલો. ત્યાંથી નીકળતી વખતે તે સાધુ મહારાજને હું પગે લાગ્યો અને તેમના આશીર્વાદ માગ્યા. તેઓશ્રીએ મને ભગવાનનું સ્મરણ કર્યા કરવાનું કહ્યું અને તેથી રોગ મટી જશે એમ પણ કહ્યું હતું, પરંતુ ત્યારે મારા મને એમ વિચાર્યું કે આ સાધુ મહાત્માએ જુંગલની કોઈ કશીક જડીબુઝી આપી હોત તો તેમાં મને વિશ્વાસ બેસત, પરંતુ ભગવાનના માત્ર નામસ્મરણથી રોગ મટી જાય એવું બિલકુલ સાચું અને શ્રદ્ધાપ્રેરક લાગ્યું ન હતું.

વળી, આ સાધુ મહારાજે મને એમ પણ કહેલું કે ‘એક વર્ષ પછી તને કોઈ સદ્ગુરુ પણ મળી આવવાના છે કે જે તારા જીવનનો વિકાસ કરાવશે, પરંતુ તે વેળા ‘જીવન’ અને ‘વિકાસ’ એ મારે માટે તો માત્ર શબ્દ જ હતા. ત્યારે દેશની સેવા કરવાની ઉત્કટ ધૂન હતી એટલી હકીકત મારા માટે તદ્દન સાચી હતી. સેવાની એ ઉત્કટ ધૂનથી પ્રેરાઈને ગરીબાઈની સ્થિતિમાં પણ ટકી રહેવાનું બની શક્યું હતું.

આ બનાવ પછી હું, વડોદરા ચાલ્યો આવ્યો. ત્યાં મારાં

એક આધ્યાત્મિક મા રહેતાં હતાં. જેમને મેં ‘મનને’માં ભાવાંજળિ અર્પેલી છે. એમના મકાનમાં ગ્રીજે માળે શરીરને ફેફરુનો હુમલો થવાથી શરીર દાદરથી ગબડતું ગબડતું છેક નીચે બીજે માળે પડ્યું અને ઈટોની પરસાળમાં તે ઘસાયું અને છોલાવાથી શરીરે સાધારણ લોહીની ટશરો પણ ફૂટી હતી. તે કાળે કંઈક જરા ભાનમાં આવતાં નર્મદાના તે સાધુ મહાત્માનું મને દર્શન થયું અને એમણે મને કહ્યું, ‘અલ્યા, ભગવાનનું સ્મરણ તો કરી જો ! પ્રયોગ કરી જોવામાં તારું શું જાય છે ?’ આ બધું પ્રગટ્યું તો ખરું, પરંતુ તે કાળે મારાં મનાદિકરણો જરા પણ આ પ્રકારની ભાવનાવાળાં નહિ હોવાથી તે સાધુ મહાત્માના વચનને અને તેના સંસ્કારને બિલકુલ મહત્વ આપી શકેલો નહિ. તે પછી શરીરે ઠીક થતાં આ બધી બનેલી હકીકત મેં મારી આધ્યાત્મિક માને જણાવી. મારી આવી હકીકત સાંભળીને તે તો બહુ રાજી થયાં. તેમણે કહ્યું, ‘અલ્યા, ચૂનિયા, તું તો ભારે બડભાગી છે. તું તારે હવેથી ભગવાનનું સ્મરણ જ કર્યા કર. ઊઠતાં, બેસતાં, હરતાંફરતાં, ખાતાંપીતાં, સકળ કંઈ કર્મ કરતાં કરતાં એકમાત્ર ભગવાનના સ્મરણમાં હવે લાગી જા અને તને જરૂર મટી જશે.’

તે કાળે મને તે સાધુ મહાત્મા કરતાં મારી આ ‘મા’માં વધારે વિશ્વાસ હતો. અને તેમના તેવી રીતના સમજાવવાથી જ ભગવાનનું નામ લેવામાં હું પ્રેરાઈ શક્યો.

‘જીવનદર્શન’, ચોથી આ., પૃ. ૨૦૦-૨૦૨

પરંતુ ખરું પૂછો તો તે કાળે મને એવું ભગવાનનું સ્મરણ કરવાથી શરીરના ફેફરાનો રોગ મટી જાય એવો દિલમાં મુદ્દલે વિશ્વાસ ન હતો. મહાત્મા ગાંધીજી ભગવાનનું સ્મરણ કરતા હતા અને નિત્ય પોતાની પાસે માળા રાખતા હતા, તે હકીકતની

મને પૂરેપૂરી ખબર હતી. તેથી, મેં પૂજ્ય શ્રી ગાંધીજીને એક કાગળ લખી તેમાં ઉપરની બધી હકીકત જણાવી.

પૂજ્ય શ્રી ગાંધીજીએ મને તરત કાગળનો જવાબ વાય્યો કે ભગવાનનું સ્મરણ કરવાથી તો રોગમાત્ર મટી જાય. તેમના વચનમાં મને સંપૂર્ણ ભરોસો. તે પછીથી મેં ભગવાનનું સ્મરણ લેવા માંડ્યું. એટલું જ નહિ, પરંતુ દઢ મક્કમ નિશ્ચય કર્યો અને પ્રત લીધું કે રોજનું અઢી કલાક તો સ્મરણ કરવું, કરવું ને કરવું જ. ન થાય તો તે દિવસે મુદ્દલે જમવું નહિ. આમ, હું તો કરવા લાગ્યો.

સ્મરણ અઢી કલાકથી પણ વધારે થતું. એક તો રોગ મટાડવાની ગરજ. વળી, સ્મરણ લેતાં લેતાં કદી મને કંટાળો આવ્યો ન હતો. પંદર દિવસ પછીથી પાંચદસ મિનિટ ઉમેરતો જતો હતો. એમ ત્રણ માસમાં રોજનું ચાર કલાક ઉપરાંત ભગવાનનું સ્મરણ થવા લાગ્યું અને ભગવાનનું કરવું કે તેટલામાં શરીરનો ફેફરાનો રોગ મટ્યો.

આ ગાળામાં ભગવાનનું સ્મરણ લેતાં લેતાં જીવનમાં મને ઉત્સાહ, ઉમંગ, ખંત, ઉઘમ વગેરે વગેરે મળતું જતું લાગતું હતું. મારે દિલ તે બધું સંપૂર્ણ વાસ્તવિકપણો હતું. એક તો રોગ મટ્યો અને બીજું ગુણો વધવાનો અનુભવ મળ્યો. તેથી, દિલમાં દિલથી બેવડો પ્રોત્સાહિત થઈને શ્રીહરિનું સ્મરણ વધારતો ગયો. સ્વપ્ન્યત્ને અને દિલના આનંદ, ઉમંગ અને ઉત્સાહથી સ્મરણનો સમય ચૌંદ કલાક સુધી તો પાંગર્યો. તે શ્રીપ્રભુની કૃપાથી દિલમાં દિલથી જીવનના ધ્યેયનું ભાન જાગી ગયું હતું. જીવનમાં હવે આ એક જ કર્મ શ્રીપ્રભુપ્રીત્યર્થે જ કરવાનું છે, એવી તે કાળની સભાનતા મારા દિલમાં પ્રવર્તી ગયેલી જ હતી.

પછીથી તો ખેડા જિલ્લાના બોરસદ તાલુકાના બોદાલ ગામે

એકાંતમાં એક બેતરમાં જાડની નીચે હું સૂતો હતો. પડબે જ એક બાજુ સદ્ગત શ્રી ઠક્કરબાપા અને બીજી બાજુએ શ્રી શ્રીકાંત શેઠ સૂતા હતા. ત્યાં સાપ કરડ્યો અને તે વેળાએ જ વીજળીના જબકારાની પેઠે મારા દિલમાં થયું કે જીવનધ્યેય હજી સંપૂર્ણ સધાયું નથી ત્યાં સુધી મૃત્યુને વરવું નથી. સ્મરણાની સાધના રોજની ચૌદ કલાકની થયેલી હોવાથી એક એવો ટકોરાબંધ જીવતોજાગતો ચેતનાત્મક નિશ્ચય જીવનમાં પ્રગટી ચૂક્યો હતો જ. એ નિશ્ચયે સાપના ઝેરનો ભયંકર સામનો કરવાને મારા દિલને તેણે (નિશ્ચયે) ખૂબ મક્કમ કરાવ્યો. એક બાજુથી સાપનું ઝેર તદ્દન બેભાન બનાવી દઈને (ભયંકર તીવ્ર, ઉત્કટમાં ઉત્કટ વેદના પ્રગટાવીને) શરીરને મૃત્યુમય બનાવવાનો પ્રયત્ન કર્યા કરતું હતું અને બીજી બાજુથી જીવનનું ધ્યેય પ્રાપ્ત થયું નથી ત્યાં સુધી મૃત્યુને ન વરવાનો દફ મક્કમ જીવંત નિશ્ચય, તેનો ભારે સામનો કર્યા કરતો હતો. આવો તુમુલ સંગ્રામ રચાયો. ત્યારે હરિજન સંઘના બધા જ કાર્યકર્તાઓ પણ ત્યાં હાજર જ હતા. જેમાંના આજે પણ હજી ઘણાખરા જીવે છે. મોટેથી હું તો હરિસ્મરણ કર્યા જ કરતો. કેટલાયે બધા મને પૂછ્યા કરતા. કોઈને કશો ઉત્તર દેવાતો જ ન હતો. બસ એકમાત્ર હરિસ્મરણાની ધૂન લાગી હતી. આવો પ્રસંગ કે જે ભયંકરમાં ભયંકર અને જેની કસોટીમાંથી, પરીક્ષામાંથી પાર ઉત્તરવું મહા મુશ્કેલમાં મુશ્કેલ હતું. શ્રીભગવાનની કૃપાથી તેમાંથી પાર ઉત્તરી શકાયું અને તેમાંથી સ્મરણાની અખંડતા પ્રગટી. આ છે સ્મરણાની સાધનાનો નાનકડો ઈતિહાસ.

આવું સ્મરણ લેવાતાં લેવાતાં, એવા સ્મરણાની ધૂનની તાનમાંથી એકાગ્રતા થતાં થતાં, દિલ લાગી જતાં, હૃદયમાં એક પ્રકારનો ભાવ ઉભરાવા લાગ્યો. એવા ભાવના મૂળમાંથી

પ્રભુકૃપાથી આ જીવને પ્રાર્થના, ભજનકીર્તન, આત્મનિવેદન, ત્યાગ, પરમાર્થ, સત્કર્મ, સર્મર્પણ, સન્મુખતા આદિ સાધન ફૂટતાં ગયાં. અને તે તે પ્રમાણે વર્તતું જવાયું. ભાવનાને સાકાર કરવાથી જ હૃદયનું સુષુપ્ત શક્તિબળ જાગૃત થવા માંડે છે, તેનો પણ મને હૃદયમાં હૃદયથી હૃદયનો અનુભવ થયો. તે રીતે મને અનેક પ્રકારનાં સાધનો ઉંયાં છે.

‘જીવનઆહ્લાદ’ની પ્રસ્તાવનામાંથી

સ્મરણના તબક્કા

શ્રીભગવાનની કૃપાથી આ જીવે શી રીતે સ્મરણ કર્યું છે તેના જુદા જુદા તબક્કાનું વર્ણન આ ગીતમાં છે :

સ્મરણની લત પડતાં દિલ, સ્મરણમાં ધ્યાન લાગ્યું છે,
સ્મરણના ધ્યાનમાંથી શો સ્મરણનો સંગ સ્હુર્યો છે !

હૃદય તે સંગમાં ઉંદું રમ્યા કરવાનું જાગીને,
હૃદય તેમાંથી હેતુનું પ્રવત્ર્યું ધ્યાન જગમગીને.

હૃદયના ભાનથી તેવા ફળવવા હેતુને દિલમાં,
હૃદય અજિનિ ભલ્લકીને મને હોમાવી દીધો ત્યાં.
જીવનના ધ્યેયના ધ્યાને, મનનચિંતવન સતત ઉંડે
-થયા જઈને, વિષયમાં દિલ શું એકાકાર ! શરણે જે !

સ્મરણના પણ જુદા જુદા તબક્કા છે, જુદી જુદી ભૂમિકાઓ છે અને તેમાં સ્મરણ પણ જુદા જુદા પ્રકારનું હોય છે. સ્મરણની અખંડતા પ્રગટ્યા પછીથી જ ભાવનાનો પ્રદેશ શરૂ થાય છે અને ભાવનાની અખંડતા પ્રગટે છે અને તે ભાવના તેના સર્વોત્તમ શિખરની ગાઢતામાં પ્રવેશે છે ત્યારે જ રૂપાંતરની જીવતીજાગતી ચેતનાત્મક પ્રક્રિયાની શરૂઆત થઈ જતી હોય છે. અને ભગવાનના

અનુભવ પ્રદેશનો કિનારો ત્યાંથી શરૂ થાય છે. ચેતનના જુદા જુદા પ્રકારના અનુભવો પણ તેવી દશામાં જ થાય છે.

સ્મરણ એ તો મારા જીવનનો નક્કર પાયો છે. સ્મરણથી જ આ જીવ હંમેશાં ટંડારી અનુભવી રહ્યો છે. સ્મરણથી જ મને ખબરદારી મળેલી. સ્મરણમાંથી જ મને જીવનના હેતુનું ભાન જાગ્યું. જીવનવિકાસના માર્ગમાં માત્ર ઉપરછલી બૌદ્ધિક સમજણ મુદ્દલે કામ આપી શકતી નથી. હૃદયની એકાગ્રતાના ઊંડાણમાંથી જે ભાવનો સૂર પ્રગટે છે તે જ જીવનને ઘડી શકે છે. ઘડવાને માટે તે જ માત્ર યોગ્ય હથિયાર છે. ભાવ પ્રગટ્યા વિના અને તે જીવંત અખંડ થયા વિના જીવન કદી ઘડાઈ શકતું નથી.

સ્મરણ કરતાં અને સ્મરણ લેતાં લેતાં અને એ સ્મરણ ભાવનાપૂર્વક, ભક્તિપૂર્વક લેવાય છે ત્યારે તેમાંથી આત્મશ્રદ્ધા પ્રગટે છે ત્યારે એવી આત્મશ્રદ્ધા જીવનનો નક્કર આધાર બની જાય છે. જીવનવિકાસના માર્ગ જો પળવું જ હોય તો શ્રદ્ધા અનિવાર્ય છે, અને તે શ્રદ્ધા જ્યારે તપશ્ચર્યામાંથી ઉગે છે, કોઈ સાધનના નિરંતર અભ્યાસમાંથી કે તેવા પ્રકારની સાધનામાંથી જે શ્રદ્ધા નીતરે છે, તેવી શ્રદ્ધા મને સ્મરણના અભ્યાસમાંથી શ્રીપ્રભુકૃપાથી મળી છે. સ્મરણના સેવનમાંથી જીવનને ઘડવાને માટે ઉપયોગી એવા ગુણો પણ મને મળેલા. ભાવ તો ખરો જ. આત્મવિશ્વાસ પણ સાથે સાથે હોય જ. હિંમત, મર્દનગી, સાહસ, ધીરજ આદિ ગુણો પણ તેમાંથી જ ઉપસ્યા છે. મર્દનગીનેય પડકાર કરે એવા કોઈ પ્રકારનાં સાધનો શ્રીભગવાનની કૃપાથી હૃદયની સ્હુરેલી પ્રેરણમાંથી જે મળ્યાં, તે ઓની કૃપાથી સાધી શકવાને માટે ઉપર વર્ણવ્યા તેવા ગુણોની આવશ્યકતા તો ખરી જ, પરંતુ એકલા તેવા ગુણોથી જ ચાલી શકતું નથી. શ્રીભગવાન

ઉપરનો પોતાના હદ્યથી નિરંતર જીવંત સેવાયેલો સક્રિય ચેતનાત્મક વિશ્વાસ તે પણ સાથે સાથે તેટલો જ જરૂરનો.

આ સ્મરણ જ્યારે નિરંતરનું જીવતુંજાગતું ચેતનાત્મક પ્રગટ્યું ત્યારે જ હરિલીલાની રમતની જરા જરા કંઈક સમજણ પડવા લાગી હતી. ભાવનામાંથી જીવન કેવું પુષ્પસ્વરૂપે વિકસિત થતું જતું હોય છે તેનો કંઈક યત્કિચિત્ત ચિતાર આપવાનું બની શક્યું છે.

‘હરિ, તુજ શક્તિ આધારે સળેકું ખાડ ચડતું છે,

સમુદ્રો સાત પણ કેવા તરીને પાર કરતું જે !’

શ્રીભગવાનની કૃપાશક્તિથી આ જીવથી શું શું અને કેવું કેવું થઈ શક્યું છે તે દર્શાવવાનું આ સ્થળ નથી. સ્મરણના એકધારા લગાતાર અભ્યાસમાંથી ભક્તિ જાગે છે અને ભક્તિના નિરંતરના હદ્યસેવનથી ભાવની જે સર્વોત્કૃષ્ટ ગાઢતા પ્રગટે છે અને તેના આધારથી મનાદિકરણો હરિલીલાને અનુભવવાની પાત્રતા પામે છે અને તે ભૂમિકાનો જે આવો અનુભવ તે વાણીથી જોકે વર્ણવી શકાય તેવો નથી છતાં મારા જેવા બુદ્ધલનો તેમાં નહિ જેવો ચંચુપાત છે.

‘સમર્થોનેય ચઢી જાયે સમર્થ શ્રેષ્ઠ એવો છે,

હરિ સમ કોઈ ચઢિયાતું સકળ બ્રહ્માંદમાં ના છે.’

હરિના ભક્તને જીવનમાં એવો પ્રત્યક્ષ અનુભવ થાય છે અને હરિના રસમાં જ બધાંનું મૂળ સમાયેલું છે તેવો તેનો જીવતોજાગતો પ્રત્યક્ષ અનુભવ પણ છે. હદ્યનો ધડકાર પણ હરિ, સર્વત્ર હરિનાં ચરણની વિસ્તારલીલા અને પાછો કેંદ્રમાં પણ પોતે અને કેંદ્રના મધ્યબિંદુમાં પણ તે જ. આવી બધી હરિલીલા અનુભવવામાં તેના ભક્તને છોળો ઉપર છોળો ઉડે છે.

‘અણુ ફૂટ્યા વિના શક્તિ અનુભવ આવતી ના છે,

અણુને ફોડવાની રીત ખરેખર સાધના શી તે !’

સાધના એટલે શું ? તેની સમજણ ઉપરની કડીમાં એની સમગ્રતાથી સમાઈ જાય છે. જેમ અણુને ફોડ્યા વિના અણુની શક્તિ અનુભવાતી નથી અને એ શક્તિ જ્યારે ફોડ્યા પછી મળે છે ત્યારે તે શક્તિની મદદ વડે જ અશક્ય લાગે તેવાં મોટામાં મોટાં કર્મ થઈ શકે છે. નવા પ્રકારનાં મૌલિક સર્જનો પણ તેના આધારે જ થાય છે અને આવા પ્રકારની સાધના આ જીવથી શ્રીપ્રભુકૃપાથી થઈ છે.

‘ભૂમિકા ભાવની જ્યારે હદ્ય સંપૂર્ણ પ્રગટે છે,
શરીરનાયે શું પલટાતા બધા ગુણધર્મ જે તે છે.’

એવી થતી જતી સાધનાના ભાવમાંથી જ્યારે ખરેખરો રસ પ્રગટે છે ત્યારે એ પ્રકારનો રસ તે રસના પ્રકારના જીવનમાં સર્વ કોઈને જિવાડતો હોય છે. રસના પણ જુદા જુદા પ્રકાર છે, જુદી જુદી ભૂમિકાઓ છે અને જુદા જુદા દિવ્ય દેશો પણ છે. આ બધી અનુભવની સમજણ સાધનામાંથી પ્રગટતા ભાવ અને રસને કારણે મને જાગી છે.

‘અણુને ફોડવું સહેલું નથી કોઈ પ્રકારે તે,
પ્રક્રિયા કેટલીમાંથી પસાર ત્યાં થવાનું છે.’

આવા પ્રકારનું મારા જીવનમાં બનેલું છે. અને એ શક્તિને પ્રાપ્ત કરીને તેનો અનુભવ થવા માટે સંકટો, વિદ્ધો, ગૂંચો, મુશ્કેલીઓ, વિમાસણો, અથડામણો એવા અનેક પ્રકારના અવરોધની ભૂમિકા જ્યારે જીવનમાં પ્રગટી હતી ત્યારે શ્રીપ્રભુકૃપાથી તેનો સામનો કરવા માટે દિલમાં કેટલો જીવંત તલસાટ, તત્પરતા, તાલાવેલી, તમન્ના વગેરે હતાં.

‘જીવનતપ’ની પ્રસ્તાવનામાંથી

આ સ્મરણનો પ્રયોગ ભગવાનની કૃપાથી મેં પ્રયોગાત્મક રીતે પણ ચલાયો છે. આધ્યાત્મિક માર્ગના વિકાસને માટે બીજાં એવાં સાધનોમાં ચિત્તશુદ્ધિ, પ્રાણશુદ્ધિ અને અહંકૃતિ - આ બધું જોઈએ. એવી શુદ્ધિનું પ્રગટીકરણ થયા વિના યોગ તો થઈ શકે નહિ. યોગને માટે શુદ્ધિઅનિવાર્ય. જ્ઞાનમાર્ગને માટે પણ. પાપીમાં પાપી અને અધમાધમ એવા છેક નિભન્મમાં નિભન્મ ગતિના જીવ ભગવાનનું સ્મરણ કરીને આ ભવસાગરમાંથી તરી ગયા છે એવા ઐતિહાસિક દાખલા પણ છે. આ કાળમાં (જેને હું પ્રપંચકાળ કહું છું) ભગવાનનું સ્મરણ એ જ એક ઉત્તમમાં (ઉત્તમ તરવાનું સાધન છે, અને એ સાધન પ્રયોગ દ્વારા શ્રીભગવાનની કૃપાથી આ જીવથી સિદ્ધ થયેલું છે.

રસ્તે જતાંઆવતાં ભગવાનનું સ્મરણ, ભજન, કીર્તન, ધ્યાન, ત્રાટક આદિ સાધનો આ જીવ કર્યા કરતો હતો અને તે પણ ગુજરાતના સેવાક્ષેત્રમાં તે તે પ્રકારનું સેવાકાર્ય પ્રભુપ્રીત્યર્થે કર્યા કરતાં. આ હકીકત ઘણાની જાણમાં છે.

લાખોગણી સાબિતી ભલેને આપો, પરંતુ જ્યાં સુધી જે જીવને ભગવાન પરત્વેની ગતિશીલ, કિયાશીલ એવી અદ્ભુત જ્વાળામુખીના અગ્નિસમી હૃદયમાં હૃદયથી જિજ્ઞાસા પ્રગટેલી નથી હોતી તેવો જીવ કશું કરી શકે નહિ અને તે આગળ વધી પણ ના શકે. થોડીધણી પણ જેનામાં જિજ્ઞાસા છે એવો જીવ તેની પ્રકૃતિ અને સ્વભાવને સાનુકૂળ પડે તેવું કોઈ સાધન લઈ, તેને સતત એકધારું વળગ્યા કરીને તેમાં જ મચેલો, મંદેલો અને મથ્યા કરતો રહે તો તેવા જીવમાં પ્રાણ પ્રગટી શકે છે. મંજ્યા કરાયા વિના આ માર્ગમાં કે બીજા કોઈ માર્ગમાં વિકાસનું કામ થઈ શકવાનું નથી.

‘જીવનસ્પંદન’ની પ્રસ્તાવનામાંથી

ચેતનાત્મક નશો

હાલના કાળમાં કેટલાક પ્રતિષ્ઠિત એવા મૌલિક વિચારકો આવા સ્મરણને કંઈક થોડેદાંશે અંશે એને અવગણતા હોય એવું કંઈક લાગ્યું છે. વળી, કોઈક તો એને L.S.D.ની સાથે પણ સરખાવી દે છે. શ્રીભગવાનનું નામ લઈ લઈને અનેક સંતભક્તો આપણા દેશમાં થઈ ગયા છે અને સંસાર તરી ગયા છે. એવા ભક્ત પ્રત્યેક દેશમાં થયેલા છે અને એવાં નામો કાલ્યનિક પણ નથી. ઈતિહાસમાં એવા ભક્તો પ્રભુભક્તિથી રંગાયેલા અને પ્રતિષ્ઠિત થયેલા છે. શ્રીભગવાનના નામસ્મરણની ભક્તિમાં જે મણો જે મણો ઊંડામાં ઊંડું અવગાહન કરેલું છે અને પ્રેમભક્તિજ્ઞાનપૂર્વક સર્વસ્વ રીતે અને સર્વ ભાવે જીવનને સમર્પણ કરી દઈને શ્રીહરિભક્તિમાં પ્રયોગાત્મક રીતે એકધારા સતત અનુભવમજ્ઞ થયેલા છે, તેઓને દિલ સ્મરણ એ એક સાંસારિક મોહકલિલવાળી ભૂમિકામાંથી જીવનને ઊંચે તારવનારું એક મોટામાં મોટું અમોઘ સાધન છે.

સ્મરણમાં ભક્તિનો ભાવ પ્રગટતાં તેમાં એક પ્રકારનો ચેતનાત્મક નશો જરૂર છે. કોઈ સ્થૂળ પ્રકારનો નશો તેને ઉત્તેજિત કદાચ કરે ખરો અને બુદ્ધિમાં પણ ચમકારો લાવે, તેમ છતાં મનાદિકરણમાં સ્થૂળ નશાથી પ્રગટેલા એવા ચમકારા જીવનની ઊર્ધ્વમાં ઊર્ધ્વ ભૂમિકામાં જીવનની પ્રાકૃતિક ભૂમિકાથી મુક્ત એવા કોઈ અગોચર, અગમ્ય અવર્ણનીય દિવ્ય દેશમાં અનુભવગમ્ય એવી ઉત્તરોત્તર ઊર્ધ્વગામી ભૂમિકામાં લઈ જવા માટે મુદ્દલે કામિયાબ નથી તે નિશ્ચિત હકીકત છે.

સ્મરણ એ તો જીવનને અનુભવના ઊર્ધ્વપ્રદેશમાં લઈ જનારું સાધન છે. જ્યારે સ્થૂળ નશો પ્રગટ કરનારી વસ્તુ એ ભલે નશો તો ચડાવે કે પ્રેરાવે અને નશાના સમયે તેનાથી કરીને ઉત્તેજના

પણ પ્રગટાવી શકે છે, પરંતુ એ બધું પત્યા પછી તો તેવો જીવ નર્યો તામસમાં જ પડે તે પણ નિર્વિવાદ હકીકત છે, જ્યારે સ્મરણમાં તેવું નથી.

જીવનમાં સ્મરણની અખંડાકાર ભાવના પ્રવર્તતાં જીવની દશા કેવી કેવી થાય છે તે હકીકત મેં વ્યક્ત કરેલી છે.

સ્મરણની ભાવના બઢતાં બઢતાં અને તે સ્મરણમાં જીવની ભાવ પ્રગટાતાં, જીવનના તેવા પ્રયોગવીરને ચરણની રજનીયે રજ થયા વિના તે જીવનવિકાસના માર્ગમાં આગળ પ્રગટી શકતો નથી. તેવું તેને પ્રત્યક્ષ દિલમાં દિલથી સમજાય છે ત્યારે એને છેંક નભ્રમાં નભ્ર થવાની ગરજપૂર્વકની સભાનતા જાગે છે. એવી ખરેખરી ઉત્કટ ગરજની સભાનતા જીવનવિકાસના શ્રેયાર્થને નભ્રમાં નભ્ર થવાની એના હૃદયમાં તાલાવેલી જગાડે છે, ચેતનાત્મક તત્પરતા પ્રગટાવે છે, અને તેવું નભ્રમાં નભ્ર થવા માટે તેના દિલની નર્તતી અને ચેતનાત્મક સભાનતા જે જ્ઞાનભક્તિપૂર્વક એનામાં જીવનત્પણે પ્રગટેલી છે, તે એના જીવનમાં જ્યારે રજનીયે રજ થાય છે ત્યારે એના જીવનમાં કોઈ દિવ્ય, રમ્ય અને ભવ્ય એક બલિહારી પ્રગટે છે. તેના જીવનમાંથી વ્યક્ત થયેલી બલિહારી અને તેવા જીવનના ઊર્ધ્વપ્રદેશના અનુભવમાંથી પ્રગટેલી જે સૌરભ તે એનાથી વ્યક્ત થયા વિના રહી શકતી નથી.

‘જીવનરસાયણ’ની પ્રસ્તાવનામાંથી

૩. શબ્દની શક્તિ

શબ્દનું મૂળ

સ્વજન : મોટા, શબ્દની ઉપાસના અથવા શબ્દ જે મૂળ થયેલો કે વિચારના મૂળરૂપે હતો? કે એમાંથી આખી સૂચિ થઈ?

શ્રીમોટા : આપણે મનુષ્ય છીએ એટલે મનુષ્યની રીતે જ વિચાર કરી શકીએ, કારણ કે આપણી બુદ્ધિ, આગળપાછળનું વાતાવરણ-આ છે તે છે-આગળપાછળ આપણે જે બધું જોઈએ છીએ, કરીએ છીએ અને એટલું સમજાએ છીએ. જેટલું લખાયું છે એટલું આપણી સમજમાં આવ્યું છે. આપણે સાંભળેલું છે તેટલા જ પ્રમાણમાં આપણે વિચાર કરી શકીએ. તેની બહાર તો આપણે વિચાર નહિ કરી શકીએ. એ શક્યતા નથી. એટલે આપણા લોકોએ વિચાર્યું કે જે જે બધું થાય છે એ શબ્દ દ્વારા થાય છે. એ બધું આપણે અનુભવમાં જોયું. ‘આ કર. તે કર. ફ્લાશું કર. ફીકશું કર.’ એ જે કંઈ કરાવવું હોય છે, જે કંઈ જન્માવવું હોય છે, સર્જવવું હોય છે, બ્યાપાર છે, પ્રગતિ છે, સંસારની પ્રગતિ છે કે બીજું કંઈ છે તે બધું જ માત્ર કહેવાથી-શબ્દથી-થાય છે. એ તો આપણે જોઈએ છીએ. એટલે પછી એ રીતે એ લોકોએ વિચાર્યું, આ બધું જ બ્રહ્માંડમાત્ર શબ્દથી જ થયું છે. પછી આપણે મૂળ ખોયું, પણ એ મૂળ ખોળવા પણ આપણે કેવી રીતે જઈએ છીએ? મનુષ્ય સ્વરૂપમાં પોતાની માનસિક પરિસ્થિતિ - જે કંઈ આપણી પ્રગતિ છે એ શબ્દની તાકાત છે. એ નિરાકાર છે. નિરાકાર એ કેવી રીતે? આપણે બોલીએ છીએ એ તો સાકાર છે. એમ સમજમાં આવ્યું એટલે સાકાર થયું, પણ જ્યારે શબ્દ હોય જ નહિ. આપણે બોલતા જ નથી. મૌન રહીએ છીએ ત્યારે એ નિરાકાર છે, પણ તેમ છતાં એનું સ્થાન છે.

આપણા સંસ્કારમાં, આપણાં મનાદિકરણમાં, આપણા મગજમાં એનું સ્થાન છે. એ આપણો ના નથી કહી શકતા. એટલે નિરાકારમાં હોવા છતાં એ અસ્તિત્વમાં છે. એ આપણો કબૂલ કરીએ છીએ કે, છે ભઈ ખરું ! શબ્દ બોલાતો ન હોય તો એ નિરાકાર હોવા છતાં એનું અસ્તિત્વ છે.

ટોચ ઉપરથી આ શબ્દથી બધું થયું અને આ થયું હોવા છતાં શબ્દ પાછો નિરાકાર છે, પણ નિરાકાર હોવા છતાં એનું અસ્તિત્વ છે. એ જ પ્રમાણે બ્રહ્મ વિશે, ભગવાન વિશે એ નિરાકાર હોવા છતાં એનું અસ્તિત્વ છે અને નિરાકારમાંથી જ એ સાકાર-શબ્દરૂપે થયો. એટલે આપણે સકળ જે કંઈ પ્રવૃત્તિ ઉપજાવીએ છીએ, જે કરવાનું બને છે અથવા તો જે થવાનું છે એ પણ શબ્દથી બને છે જ, એ આપણી સમજમાં આવે છે, કારણ કે એ જ રીતે આખું વાતાવરણ હોય, આપણી સમજ હોય, આપણું ગ્રાઉંડ (ભૂમિકા) હોય, આપણી જે કંઈ વિકાસ થયેલી શક્તિ હોય એ પ્રમાણે જ આપણે સમજવાના. બીજી કોઈ રીતે આપણે સમજ નહિ શકવાના. એટલે આપણા શાસ્ત્રકારોએ, અનુભવીઓએ આ શબ્દને આ રીતે સ્વીકાર્યો. શબ્દથી જ જે તે બધું થાય છે. એ અનુભવમાં પણ એમણે એમ જ જોયું.

પ્રત્યેક ભૂમિકા ઉપર શબ્દનું સ્વરૂપ જુદું જુદું. જેમ સંગીત છે. તે સંગીતના શરૂઆતમાં લય જુદી હોય. અમુક આરોહ અવરોહ થાય ત્યારે એનો લય જુદા પ્રકારનો. અને જ્યારે છેક ઊંચે લઈ જાય ત્યારે પણ જુદા પ્રકારનો. જેમ સંગીતમાં શબ્દના રાગ હોય તેમ રાગની ભૂમિકામાં એનું સ્વરૂપ જુદું જુદું હોય. એના સરગમ પણ એની ભૂમિકા પ્રમાણે જુદા થઈ જાય.

ચેતનનું અવતરણ જુદી જુદી ભૂમિકામાં થયું ત્યારે એ જુદાં જુદાં રૂપે થયું, કારણ કે ચેતનનો ગુણધર્મ જ્યાં મળે ત્યાં એકરૂપ

થઈ જવાનો છે. માટે, તે તે રૂપ થયું. જો ચેતનાનો ગુણવર્મ તાદાત્સ્ય થવાનો ન હોય તો તે તે રૂપે એ ન થયું હોત. જેમાં જેમાં ભળી જાય તે રૂપ થઈ જાય અને પાછું પોતે નોખો રહે. તેવી રીતે શબ્દ પણ જે જે ભૂમિકામાં વ્યક્ત થયો તે તે ભૂમિકાની અસર તેને તે રીતે વ્યક્ત થાય. એટલે કામકોધાહિ રીતે શબ્દ વ્યક્ત થયો તો તે જાતની ગતિમાં આપણાને જોવા મળે. જો લોભની ભૂમિકાથી વ્યક્ત થયો તો તૃષ્ણાની ભૂમિકામાં લઈ જાય. એ રીતે આધ્યાત્મિક ઊંચી ઊંચી કક્ષામાં જે શબ્દ વ્યક્ત થયો તે તેમાં જ તેને ગતિ કરાવશે. તે પ્રકારની સભાનતા તે પ્રકારનું જ્ઞાન તેને થશે એ આપણી સમજમાં આવે છે.

‘જન્મપુનર્જન્મ’, પ્રથમ આ.., પૃ. ૭૦ થી ૭૩

બધી ઉપાસનામાં શબ્દ

પ્રત્યેક ચેતનનિષ્ઠને ઉપાસના તો આવશ્યક. ઉપાસનામાં કોઈ ને કોઈ ગૂઢ રીતે શબ્દ તો આવી જાય. શબ્દની અનંત લીલા છે. પ્રકૃતિના ક્ષેત્રે પણ અનંત લીલા છે. કામકોધાહિમાં પણ તેની લીલા છે. ‘શબ્દ’ની સંગાથે રહીને ‘શબ્દ’ને વર્ણવવા જવું એટલે ગૂઢમાં ગૂઢ પ્રદેશમાં ઉત્તરવું. વ્યક્ત થયેલ દરેક શબ્દને અખંડ, નિરવયવ, અનિર્વાચ્ય એવા ‘શબ્દ’ સાથે સંબંધ છે. શબ્દને કુંડલિની જાગૃતિ સાથે પણ સંબંધ ખરો. અત્યારે એક રીતે બધાંની કુંડલિની જાગૃતિ છે જ, પરંતુ તેની નિભન ગતિ છે. તે પ્રકૃતિના વહેણમાં વહે છે. ઉધ્ર્વ મનનચિંતવન થાય તો તે પ્રમાણે વહેવા લાગે.

‘શબ્દ’ને લીધે પ્રાણ છે. પ્રાણને લીધે ‘શબ્દ’ નથી. શબ્દમાં એકાકાર, અખંડાકાર વૃત્તિ થઈ જાય ત્યારે જે શબ્દ થાય તે જુદો. ત્યારે તે બધે જ રમે છે. પ્રકૃતિમાં રમતો હોવા છતાં અખંડાકારે

રમતો હોય છે. ત્યારે જ તે સર્વત્ર છે. નિભન્માં નિભન્મ ગતિમાં ‘પોતે અખંડ છે’, ‘હું જ છું’, ‘ક્યાંય બિન્નતા નથી’ એવી પ્રતીતિ અને ત્યારે જ થાય છે.

શબ્દનાં મોજાં દ્વારા આધાર પરિપક્વ થતો જાય છે. ઝીં, કલીં - વગેરે એકાકશી બીજમંત્રો તંત્રમાં શોધાયા તેની પાછળ એવું દાણિબિંદુ હતું કે એવા કોઈ પણ શબ્દ શોધવા કે જેથી સ્વરૂપપ્રાપ્તિ વગેરેનો કાળ ટૂંકાવી શકાય. એમાં પણ બે ફાંટા છે. કૃષ્ણગતિ અને શુક્લગતિ. શબ્દના માત્ર ઉચ્ચારણથી જ્ઞાનતંત્તુના ભાવમાં પરિપક્વતા થાય તો પ્રકૃતિની સ્થિતિ હોવા છતાં સાક્ષીભાવે એકાકાર, અખંડાકાર રહી શકાય. એમાં શ્રદ્ધા-માનવું કે ન માનવું અને કોઈ સંબંધ નથી. તાત્પર્ય કે માત્ર ઉચ્ચારણથી કાર્યસિદ્ધિ થાય છે. શરીરમાં પણ વિરોધનાં તત્ત્વો વચ્ચે અખંડતા જન્મે ત્યારે ખરી અખંડતા કહેવાય.

‘શબ્દ’ની પણ જુદી જુદી ભૂમિકાઓ છે. અગિયારમી ભૂમિકા પછી ‘શબ્દ’નો નાદ સંભળાય છે. નાદ છેક સમાધિ સુધી લઈ જાય છે. કોઈ વાર પક્ષીના, કોઈ વાર વાછરાં ભાંભરે તેવા નાદ સંભળાય છે. નાદ એવો લાગે પણ ખરેખર એવો હોતો નથી. આ છે શબ્દની લીલા.

‘શ્રીસદ્ગુરુ’ની પ્રસ્તાવનામાંથી
(અનુષ્ઠાન)

આકાશમાંથી છે શબ્દ, સર્જયું શબ્દથી બધું,
શબ્દથી પ્રાણ તેથી તો છે સર્જયેલ જીવને.

નાભિનો શબ્દ શો પોતે જ્ઞાનાત્મક ન પૂર્ણ છે,
પાછો સાથે અને સાથે અજ્ઞાનાત્મક તે ન છે.

શબ્દનું એ પરિણામ નાદ પ્રત્યક્ષ જાણજે,
 નાદ એકાગ્રતા કેવી અંતરે પ્રગટાવશે.
 નાદ ને નાદમાં લીન મનાદિ મળન થાય છે,
 છતાં તે નાદ ના જ્ઞાન, નાદ ને જ્ઞાન ભિન્ન છે.
 પ્રત્યેક ભૂમિકાકેરા શબ્દનો નાદ શો જુદો !
 પ્રત્યેક નાદના પાછા ગુણ ને ભાવ છે જુદા.
 જુદી જુદી ભૂમિકાના શબ્દનાય પ્રકાર છે,
 તે તો શબ્દતણા નાદ પાછા ભિન્ન પ્રકાર છે.
 નાદનું મુગ્ધ સંગીત ભારે કળણ કેવું તે !
 રાખે દુબાડી તેમાં ને તેમાં તહ્વીન સાવ તે.

* * *

કેટલાય પ્રકારો છે ચેતનાનિષ્ઠમાં નર્ય !
 વર્તને શા જુદા જુદા ભાવમાં એક તે છતાં
 સ્વભાવે સાવ નોખા સૌ, છતાં શા એક તત્ત્વમાં !
 વ્યક્તત્વમાં જુદા જુદા, એક છે ચેતના છતાં.
 સાધના છો જુદી જુદી કરેલી તેમણે જ હો,
 કિંતુ ત્યાં પરિણામે તો થવાનું એક ઠામ છે.
 સ્વભાવે પોતપોતાના તે પ્રમાણેની સાધના,
 નોખી નોખી રહેવાની, તેમાં ના એકરૂપતા.
 કોઈક સાધના માગી તપશ્ચર્યા કઠિન લે,
 સહેલી સુતરી કોક જેમ નામજપાદિ તે.
 સૌ કરણોની શુદ્ધિને માગી લે કોક સાધના,
 નામની સાધના જ્યારે શકે સૌ કોઈ સાધી તે.

કોઈક સાધના એવી શકે ટૂંકાવી કાળને,
કિંતુ શુદ્ધિ અનિવાર્ય, ત્યાં ઘણી જ જરૂરી છે.
લેતાં લેતાં જ જ્યારે તો ‘નામ’ શુદ્ધિ થતી જતી,
જગતાં ત્યાં અનુરાગ લગની બઢતી જતી;
સહુ તે સાધનોમાં છે શ્રેષ્ઠ નામની સાધના,
અનુભવી જ ગાયું છે જીવને આચરી સદા.

‘શ્રીસદ્ગુરુ’, પ્રથમ આ., પૃ. ૨૦૨-૨૦૩

શબ્દરાચિત - વૈજ્ઞાનિક હકીકત

આજકાલ ઘણા બુદ્ધિવાળા લોકો કહે છે કે ભગવાનનાં નામ બોલવાથી શું થાય? બીજા વિજ્ઞાનની જેમ આ શુદ્ધ વૈજ્ઞાનિક હકીકત નથી, પણ અમે કહીએ છીએ કે આ વૈજ્ઞાનિક હકીકત છે. ભગવાનનાં નામથી ઘણું થઈ શકે છે.

આપણા બ્રહ્માંડમાં પાંચ તત્ત્વોએ : આકાશ, તેજ, વાયુ, જળ અને પૃથ્વી. કેટલાંકમાં માત્ર તેજનાં જ તત્ત્વ હોય છે. એવાં ઘણાં છે. વળી, થોડાં આકાશ, તેજ અને વાયુવાળાં છે. તેમ જ આકાશ, તેજ, વાયુ અને જળવાળાં થોડાં, પણ આપણી પૃથ્વી ઉપર પાંચ તત્ત્વો છે. એ પાંચે તત્ત્વોમાંથી જે Manifest (વ્યક્ત) થાય છે તે અહીં છે. એમાં આકાશનું વ્યક્તત્વ શબ્દ, તેજનું વ્યક્તત્વ રૂપ, વાયુનું વ્યક્તત્વ સ્પર્શ, જળનું વ્યક્તત્વ રસ અને પૃથ્વીનું વ્યક્તત્વ સુગંધ છે. જે શબ્દ છે એ ભાવનાવાચક છે. પહેલાં જે મૂળ શબ્દ હશે તે બહુ આકર્ષક છે. બાળક પહેલવહેલું ‘મા’ બોલે છે અને તે એને બહુ આકર્ષક હોય છે. એ નવ માસ સુધી માના પેટમાં રહેલું હોય છે એટલે તેનું આકર્ષણ મા સાથે ખૂબ હોય છે. તેમ જ જ્યારે માનવી પહેલાં જે હશે તેનું આકર્ષણ અજ્ઞાત રીતે ચેતન તરફ હતું,

કારણ કે એની વૃત્તિ બહિમુખ ન હતી. ભાષાનું સાધન હતું નહિ, ત્યારે બહુ સુધારાની દશામાં ન હતા. ત્યારે કદાચ કપડાં પણ પહેરતાં ના હોઈએ. એથી કરીને જેને સંસ્કૃતિ કે અંતર્મુખતા કહીએ તે, તે કાળમાં વિશેષ પ્રમાણમાં હશે.

પહેલાં જેમ અંધારું હોય અને પછી જેમ પ્રકાશ થાય. તેમ પહેલાં જે સ્થિતિ હતી તેમાંથી જે સંસ્કૃતિ જન્મી તેના પહેલાં એનો impact તો હોય છે. ૩૮૭વેદના તે કાળનું કોઈ અધ્યયન કરે તો કોઈને પણ લાગે કે આપણા કરતાં તેઓ વધારે સંસ્કૃત હતા. કદાચ સુધરેલા ન હોય, પણ વધારે સંસ્કૃત કે અંતર્મુખ તો હતા જ. દુનિયાની કોઈ પણ સંસ્કૃતિ કરતાં આપણો તે કાળમાં ઉચ્ચ સ્થાને હતા.

જ્યારે આપણે બોલી શકતા ન હતા, જે જુંગલી અવસ્થા હતી ત્યારે શબ્દનું વ્યક્તત્વ થયું. આજે પણ જો શબ્દ ન હોય તો ખૂબ ગુંચવાડો થઈ જાય.

શબ્દ આકાશમાંથી નીકળ્યો છે. એ બ્રહ્મવાચક, ચેતનવાચક અને ભાવનવાચક છે. એમાં જ્યારે નિરંતરતા-અખંડતા પ્રગટે ત્યારે આપણું જોડાણ આકાશતત્ત્વ સાથે થતું હોય છે. આપણા શરીરના પંચતત્ત્વોમાં એક આકાશતત્ત્વ છે. શબ્દનો સંબંધ આકાશ સાથે છે. એનો જન્મ આકાશમાંથી થાય છે. આકાશનો સંબંધ ગુણ સાથેય હોય છે. ગુણ ત્રણ છે : સત્ત્વ, રજસ અને તમસ. આકાશનો સંબંધ સત્ત્વ સાથે હોય છે. જ્યારે શબ્દમાં નિરંતરતા પ્રગટે ત્યારે આકાશતત્ત્વ ખીલે. ત્યારે એનો સંબંધ સત્ત્વ સાથે હોય એટલે સત્ત્વનો વિસ્તાર થવા માંડે. એમ થતાં આપણી જીવદશા મોળી પડે. એટલે કે કામ, કોધ, લોભ, તૃષ્ણા, મદ, મત્સર વગેરે મોળાં પડે. જો આપણે જીવદશાની વૃત્તિઓને એક પછી એક મોળી પાડવા માણીએ તો આખી જિંદગી વહી જાય તોપણ એને નિર્મળ ન કરી શકીએ.

એટલે ઋષિમુનિઓએ જોયું કે આ બધું માનવીથી ન થઈ શકે. એટલે એ લોકોએ વિચાર્યું કે માનવીને એવું કોઈ સાધન આપો કે જે બધાંય કરે. યોગ, તંત્ર, ધ્યાન વગેરે બધાં ન કરી શકે. એટલે આંધળાં, લૂલાં, રોગી, સ્ત્રી, પુરુષ કે વૃદ્ધ બધાં લઈ શકે એવું સાધન હોય તો ભગવાનનું નામ છે. જ્યારે ભગવાનનું સ્મરણ સહજ થયા કરે - આપમેળે જેમ શાસોશ્વાસ ચાલે છે, લોહી વહે છે તેમ effortless effortથી જાગૃતિપૂર્વક સ્મરણ થયા કરે તો આપણામાં શુદ્ધિ થવા માંડે. આપણે શાસ લઈએ છીએ અનું જાગૃતિપૂર્વકનું જ્ઞાન હોતું નથી, કારણ એ સહજકિયા છે. પણ અજપાજપની કિયામાં એવું નથી. આપણામાં જે પુરુષ સુખુપ્ત છે એ પુરુષ અજપાજપ થતાં જાગ્રત થતાં Consciousness-કોન્સ્યસ્નેસ પ્રગટે છે. આપણામાં જીવતોજાગતો વિવેક જાગી જાય છે. સામાન્ય જીવદશાનો વિવેક નહિ, પણ જીવતોજાગતો તાત્કાલિક નિર્ણય કરી શકે છે, અયોગ્યને નિવારી યોગ્યને સ્વીકારે છે. મતલબ કે શબ્દની સાધનાથી આ સ્થિતિને પામી શકાય છે. અને આ સંપૂર્ણ વૈજ્ઞાનિક છે. આ કંઈ ગામડિયાની વાતો નથી, પણ અનુભવની હકીકત છે.

આપણે પ્રકૃતિરૂપ છીએ પણ જો આપણે સાક્ષી થઈએ તો આપણને ભોગવવાપણું બંધનરૂપ ન નીવડે. પ્રકૃતિથી નોખા થવું હોય તો શું કરવું ? આપણે પ્રકૃતિમાં ગળાબૂડ છીએ તો એ શી રીતે આવે ? તો એનું સાધન શબ્દ છે. જ્યારે આપણું અનુસંધાન શબ્દમાં થાય છે ત્યારે એ શબ્દ આપણા ચિત્તમાં નોખાપણું પ્રગટાવે છે. ધીમે ધીમે નોખાપણું સતેજ થવાથી વિવેક જાગ્રત થાય છે અને તાત્કાલિક નિર્ણય કરે એવી શક્તિ જન્મે છે.

‘મૌનમંદિરમાં પ્રભુ’, પૃ. ૧૮ થી ૨૩ સંકલન.

૪. નામસ્મરણ

વૈજ્ઞાનિક અભિગમ અને પૃથક્કરણ

સમર્પણના પ્રયોગો

જેમ H_2O હકીકતને સર્વ કોઈ પ્રયોગસિદ્ધ હકીકત તરીકે સ્વીકારે છે, તેવી જ રીતે અનેક દેશના, અનેક સમાજના, અનેક ધર્મના, અનેક સંસ્કૃતિના જુદા જુદા માનવીઓએ પ્રયોગ કરી યાહોમની ભાવનાથી ઝંપલાવી, સર્વ રીતે અને સર્વ ભાવે સમર્પણમાં તદાકાર થઈ જઈ જે સત્યને અનુભવ્યું અને જીવનમાં વણી લીધું અને તેના શક્તિબળ વડે જીવ્યા. તે સમાજના ઈતરજનોને પણ તેવી તેમની અસરથી પ્રભાવિત કરી, જીવનનો નવો રાહ બતાવવામાં અને નવા રાહે ચલાવવામાં તેઓ પ્રત્યક્ષ કિયાશીલ, સર્જનશીલ બનેલા છે, તે પણ એક ઐતિહાસિક હકીકત છે. આવા મહાનુભાવોના જીવનના તે તે કાળે તેમના જીવનના તેવા પ્રેમભક્તિ જ્ઞાનપૂર્વકના સમર્પણના પ્રયોગો પણ સંપૂર્ણ વૈજ્ઞાનિક નથી શું? વિજ્ઞાને જે પ્રયોગો કરી કરી સિદ્ધ કરી જગતને પ્રત્યક્ષ તેવું તેવું સત્ય પુરવાર કરી આપ્યું છે, તેવી જ રીતે જીવનનું નવનીત તારવી તારવી એવા મહાનુભાવોએ પોતાના જીવનના તેવા પ્રત્યક્ષ સમર્પણના પ્રયોગો વડે કરીને જગતને અને સમાજને તેનાં પ્રત્યક્ષ અનુભવદર્શન કરાવેલાં છે. એવાં પ્રત્યક્ષ જ્ઞાનભક્તિભાવે પ્રગટેલાં જીવન એ શુંપ્રયોગો નથી?

એવા લોક પોતે તો જીવનમાં જીવનથી બદલાયા છે, એ તો પ્રત્યક્ષ હકીકત છે. એટલું જ નહિ પણ તેવા લોકના જીવનની

અસરથી બીજા લોકોના જીવનના બદલાવાપણાની અસર પણ તેમણે ઉપજાવી છે. અનેક નકારાત્મક વલણવાળા જીવનને પણ તેવા આત્માઓએ નવો પલટો પ્રગટાવવામાં અનેરો વેગ પ્રગટાવ્યો છે તે પણ ઐતિહાસિક છે.

પ્રભુનું સ્મરણ - વ્યાખ્યા અને પ્રક્રિયા

શ્રીપ્રભુનું સ્મરણ એટલે ભાવનાત્મક જ્યપ દ્વારા જીવનને પલટાવવાની એક પ્રકારની સૂક્ષ્મ પ્રક્રિયા. એમાં શ્રદ્ધાની જરૂર છે ખરી, પણ જેનામાં તે ન હોય તેનામાં પણ તે જન્માવી શકે છે. કોઈને તર્ક ઉઠે કે જ્યથી વળી કામકોધાદિ કેમ કરીને મોળા પાડી શકાય ? એનો જવાબ તો એ જ કે, કોઈ તેમાં યાહોમ કરીને ઝંપલાવે અને જ્યને પ્રેમભક્તિની નિષામાં જો જવંત પ્રગટાવી શકે તો તેવાને તેની ખબર પડી જ શકે, તેવી હકીકત કેટલીય વાર જણાવેલી છે.

પાંચ તત્ત્વ અને એની તન્માત્રા નીચે મુજબ છે :-

તત્ત્વ		તન્માત્રા
આકાશ	-	શબ્દ
વાયુ	-	સ્પર્શ
તેજ	-	રૂપ
જળ	-	રસ
પૃથ્વી	-	સુવાસ

આ પાંચેચ તત્ત્વોને ત્રણ ગુણ સાથે સંબંધ છે :-

સત્ત્વને સંબંધ આકાશ સાથે.

રજસને સંબંધ વાયુ અને તેજ સાથે.

તમસને સંબંધ જળ અને પૃથ્વી સાથે.

શબ્દ અને આકાશ સંપૂર્ણપણે પરસ્પર સંકળાયેલાં છે. તે પરસ્પર જુદાં હોવા છતાં એક છે. જેમ પ્રકાશ અને સૂર્ય, ગરમી અને અગ્નિ.

શબ્દ આદિઅનાદિથી છે. એવા ચેતનના પ્રતીક શબ્દમાં જ્યારે જીવંત નિરંતરતા, અખંડતા, સંણગતા પ્રગટે છે ત્યારે અંધારામાં આકાશતત્ત્વ ભીલે છે, મોખરે આવે છે. હવે, આકાશતત્ત્વને અને સત્ત્વને પરસ્પર સંબંધ હોવાથી, જ્યારે આકાશતત્ત્વ ભીલે છે અને મોખરે પ્રગટે છે ત્યારે આકાશના ભીલવા સાથે સત્ત્વગુણ પણ ભીલવા માંડે છે. અને સત્ત્વગુણ ભીલવા માંડતાં અને સત્ત્વગુણ મોખરે જીવતો થતાં રજસ-તમસ ગૌણ બનતા જાય છે. કામકોધાદિક વિષયો તો રજસ અને તમસ ગુણને આધારે હોય છે. એટલે જ્યારે રજસ-તમસ ગુણ મોળા પડે ત્યારે આપમેળે કામકોધાદિક મોળા પડે છે. આમ, ચેતનાત્મક ભાવવાચક શબ્દમાં જ્યારે જીવંત સહજ નિરંતરતા, અખંડતા અને સંણગતા પ્રગટે છે ત્યારે કામકોધાદિક રાગદ્રેષને મોળા પાડવાનું કે પડી જવાનું શ્રેયસાધકને કશું જાણું મુશ્કેલ પડતું નથી. એનું મૂળ કારણ તો એ છે કે એવા ચેતનવાચક શબ્દમાં જ્યારે જીવંત સહજ અખંડતા પ્રગટે છે ત્યારે સમગ્ર આધારમાં એક એવા પ્રકારની - A distinct kind of awareness - એક વિશિષ્ટ સહજ સભાનતા પ્રગટે છે. એના વડે કરી તેને પોતાના ધ્યેય પરત્વેનો વિવેક એટલો બધો સજીવ પ્રગટી જાય છે કે જેથી તે સત્તા-અસત્તનો પાકો નિર્ણય કરી શકે છે. એટલું જ નહિ, પરંતુ ધ્યેયથી વિરોધનું જે જે કંઈક હોય તેનાથી નોખા થતાં તેને વાર લાગતી નથી. તેવી વેળાનો તેનો વિવેક એ તો પૂરેપૂરો ધ્યેય પરત્વેનાં દસ્તિ, વૃત્તિ અને વલણવાળો, જીવંત, ગતિશીલ, કિયાશીલ અને સર્જનશીલ, અખંડપણે સભાનતાયુક્ત, સદાય ચેતનવંતો, પળેપળનો સહજ જગ્યાત રહ્યા કરે છે. એવો જીવંત, સહજ, કિયાશીલ, ગતિશીલ અને સર્જનશીલ વિવેક પ્રગટતાં શ્રેયસાધકનાં દસ્તિ, વૃત્તિ અને વલણ એકધારાં સહજપણે સદાય

પળેપળ ધ્યેય પરત્વે જ વર્તેલાં, પ્રગટેલાં થઈ જતાં હોય છે.

મંત્ર શબ્દમાં એવી જીવંત સહજ સભાનતા જાગ્રત થતાં એમાંથી એક એવા પ્રકારની ભાવપ્રેરક સંનિષ્ઠા જન્મે છે કે એવી સહજ જીવંત સંનિષ્ઠામાંથી અનંતગણા ગુણ અને શક્તિ પ્રગટ્યાં કરે છે. ત્યારે ગુણને કેળવવાની જરૂર હોતી નથી. એવી ઉપરોક્ત સંનિષ્ઠતાનું તો ગુણ અને શક્તિ પરિણામ હોય છે.

શ્રેયસાધકના આધારમાં એવી સંનિષ્ઠા જ્યાં સુધી પ્રગટેલી નથી ત્યાં સુધી તેવા સાધકે ગુણ અને શક્તિ કેળવવાની પણ તેટલી જ જરૂર હોય છે.

પ્રભુનું સ્મરણ થાય, પરંતુ જો રાગદ્વૈખાદિક મોળા ન પડી શક્યા હોય તો તેવા સ્મરણનો ઉઠાવ થઈ શકતો નથી. તે પણ એટલું જ સાચું છે. સામાન્ય જીવ અખંડ, જીવંત, સંંગપણે પ્રભુસ્મરણમાં લાગી જઈ શકે એવું તો બની શકવું શક્ય હોતું નથી. એ તો જીવને Volcanic Aspiration જાગે છે, એવી જે જ્વાળામુખીના જેવી ધ્યેય પરત્વેની ઉત્કટ તમન્ના જાગે છે તેવા જીવ જ શબ્દની નિરંતરતામાં પ્રગટી શકવાના છે. અને આવા જીવો તો અત્યંત લઘુતમ સર્જક લઘુમતીમાં જ (Microscopic Creative Minority) હોવાના. આમ, સામાન્ય જીવ માટે તો નામસ્મરણ કે જપ તેના જીવનવિકાસ માટે ઉત્તમમાં ઉત્તમ, સરળ, નિર્દોષ નિર્મળ સાધન હોવા છતાં એવા જપની સાથે સાથે એણો એમાં ચેતનપ્રાણ પ્રગટી શકે એ માટે રાગદ્વૈખાદિક મોળા પાડવા કાજે મથવાપણું રહેવાનું જ. તે તેમ કરી શકે તો જપમાં ઉઠાવ આવી શકે છે.

કોઈ પણ વિષયનું હાઈ પામવું હોય તો તેમાં તેણે યાહોમ કરીને સંપૂર્ણપણે જંપલાવવાનું રહે છે. સંપૂર્ણ રીતે, સંપૂર્ણ ભાવે તેના સમર્પણભાવમાં લીન થયા વિના તેનું હાઈ પામવું કદી શક્ય નથી.

જીવન શેને માટે? જીવનનો મૂળ અર્થ શો? આવા અંતર્ગત પ્રશ્ન જેના દિલમાં જ્યાં સુધી પ્રત્યક્ષ જીવંતપણે પ્રગટેલા નથી, એવા જીવોને જીપમાં ચેતનપ્રાણ પ્રગટી શકવાની શક્યતા બહુ ઓછી ગણાય.

શદ્જમાં જ્યારે ચેતનપ્રાણ અને ભાવપ્રેરક જીવંત સહજ સંનિષ્ઠ પ્રગટે છે ત્યારે તેનાં કરણો-મન, બુદ્ધિ, ચિત્ત, પ્રાણ, અહમૃ વિશેષ ને વિશેષ તેજસ્વી અને સૂક્ષ્મ બનતા જતાં હોય છે. તેમના તેમના વિહારનો પ્રદેશ ધ્યેય પ્રતિ લઈ જતો - કોઈ નિરાળો જ હોય છે. એવી સંનિષ્ઠમાંથી જે ચેતનપ્રેરક શક્તિ પ્રગટે છે, તેવી શક્તિ વડે પછી તો સાધક દૈવાસુર સંગ્રામને ખાંડાની ધારે પૂરેપૂરી સભાનતાથી અને મદનગીથી જેલી શકતો હોય છે. આવા પ્રકારનો શ્રેયસાધક પછીથી તો સંગ્રામવીર બને છે. એની ભાવના તો પછી પ્રચંડ શક્તિ બની ગયેલી હોય છે. એવી ભાવના જ્યારે આધારમાં પ્રગટે છે ત્યારે જીવંત સહજભાવનામાંથી ગુણ-શક્તિ તો પ્રગટ્યાં જ કરે, એટલું જ નહિ પરંતુ કળા, સૌંદર્ય, વ્યવસ્થિતિ વગેરે વગેરે જેવાં જીવનનાં પ્રધાન Aspects સ્વરૂપો પરત્વે પણ એની સભાનતા ખીલતી જતી હોય છે. અને આમ તે સત્યમૂ, શિવમૂ, સુંદરમૂ પરત્વેની દિશામાં અનુભવની ભૂમિકામાં પ્રગટી થઈ શકે છે.

પ્રભુસ્મરણમાં કે તેવા પ્રકારના જીપમાં જ્યારે સહજ નિરંતરતા અને સંણંગ સાતત્ય પ્રગટી ઉઠે છે ત્યાર પછીથી જ આધારના પ્રત્યેક કરણમાં ઊર્ધ્વકરણની એક સાહજિક સર્જનશીલ અને કિયાશીલ સતત જીવંત પ્રક્રિયાનો આરંભ થાય છે.

(A spontaneous creative dynamic and continuous process of sublimation begins)

ભાવના પ્રગટેલી હોય છે તેનાં પણ પ્રત્યક્ષ લક્ષણો છે. એ

પારખી પણ શકાય. ભાવના પ્રગટતાં હૈયાસૂઝ, પ્રત્યેક કર્મનું વિવેકજ્ઞાન વગેરે બધું એનામાં પ્રગટ્યા વિના રહી શકતું નથી. ભાવના એ તો સર્વ પરત્વે પ્રકાશ પાડનાર, તેના તેના સ્વરૂપને ઓળખાવનાર અને તેના તેના મર્મનું દર્શન કરાવનાર પ્રચંડ શક્તિ છે. એવી ભાવના જે સત્કારવાનું અને સ્વીકારવાનું કરતું હોય છે, તેને તેને પ્રેમથી સત્કારે અને સ્વીકારે છે. એવી ભાવના તો શ્રેયસાધકનાં જ્ઞાનનાં ચક્ષુ હોય છે. એવી જીવંત સહજ ભાવનામાં જ્ઞાન, કર્મ અને ભક્તિનો સમન્વય અને સુમેળ જન્મતો હોય છે. ભાવના જેમ ભક્તિપ્રેરક છે એમ જ્ઞાનપ્રેરક પણ છે અને કર્મથી જ્ઞાન અને ભક્તિને તે સાકાર પમાડે છે.

ભાવનાયુક્ત શબ્દની સાધનાથી હૃદયની સંપૂર્ણ એકાગ્રતા ઊગે છે. હૃદયની સંપૂર્ણ એકાગ્રતા પ્રાપ્ત થયા વિના ધ્યેયનું હાઈ પકડી શકતું નથી. એકાગ્રતા કેંદ્રિત થવાથી વસ્તુની સાથેનું હૃદયપૂર્વકનું તાદાત્મ્ય સાધી શકાય છે.

જ્યાની પદ્ધતિ :

જ્યાની Technique (પદ્ધતિ અને ગુણમાપ) -

જ્યા ટૂંકામાં ટૂંકો હોવો જોઈએ.

જ્યામાં અધોષ અક્ષરો ન હોવા જોઈએ. જે જ્યા બોલવામાં ઘણો ઘણો સરળ હોય તે ઉત્તમ.

શબ્દનાં ગ્રાણ સ્થળ : ૧. નાભિ ૨. કંઠ ૩. બ્રહ્મરંધ -એ ગ્રાણેને સ્પર્શો અને ભેદે એવા અક્ષરો જે જ્યાના શબ્દમાં હોય તે શ્રેષ્ઠ.

શાસોશ્વાસ સાથે અથવા નાડીના ધબકારા સાથે જ્યામંત્ર બોલવો જોઈએ.

જ્યાના મંત્રમાં ગંગાના પ્રવાહ જેવી સતત એકધારી જીવંત સહજ નિરંતરતા પ્રગટે ત્યારે જ અંત:કરણ અને આંતરિક

કરણોને યોગ્ય ધ્યેય પરત્વેના માર્ગ વાળવામાં તે સાચો મદદગાર થઈ પડે છે.

જ્યપમાં નિરંતરતા પ્રગટે તે અત્યંત જરૂરનું છે. તે પ્રગટે તો ચેતનધોતક ભાવ ઊગવાનો જ.

જ્યપ જેટલો ઉર્મિથી, લાગણીથી અને ભાવનાથી લેવાય તેટલું ઉત્તમ.

માનસિક જ્યપ ઉત્તમ એ વાત ખરી, પરંતુ શરૂઆતમાં સામાન્યતઃ કોઈ પણ મનમાં તો જ્યપ ન કરી શકે, કારણ કે મન તો સંકલ્પવિકલ્પ જ કરી શકે - હુંદું અને ગુણની ભૂમિકાવાળું મનનું Function - કાર્ય તો સંકલ્પવિકલ્પનું હોય. તે વિના તે બીજું ના કરી શકે. જ્યારે જ્યપ તો સતત દઢ અનુરાગભર્યો જીવતો ચેતનવંતો અભ્યાસ પ્રગટી જાય અને એમાંથી એકધારી સહજતા અને નિરંતરતા પ્રગટે ત્યારે જ મનમાં જ્યપની ધારણા ઊગે છે.

અનેક પ્રકારના આધાતપ્રત્યાઘાતને લીધે આપણા શરીરના જ્ઞાનતંતુઓમાં કંપ પેદા થાય છે. એવા કંપના પ્રકાર પણ જુદા જુદા હોય છે. જુદા જુદા પ્રકારના કંપથી શરીરમાં જુદું જુદું સંવેદન ઉદ્ભવતું હોય છે. કામ, કોષ, લોભ, મોહ, મદ, મત્સર, અહમું વગેરેના ઉત્કટપણાથી અમુક પ્રકારના આવેશ અને આવેગ પ્રગટે છે. તેના આધાત પ્રત્યાઘાતોથી જ્ઞાનતંતુમાં જુદા જુદા પ્રકારના કંપ પ્રગટે છે. તે આધારમાં એક પ્રકારની સમતાથી સમતોલપણું હોય છે, તેમાં આવા પ્રકારના કંપ ગેરવ્યવસ્થા પ્રગટાવે છે. અશાંતિ, અસમાનતા ઉપજાવે છે અને તેથી કરીને જ્ઞાનતંતુની સરળતાયુક્ત વ્યવસ્થિતિનો ભંગ થયા કરવાથી જ્ઞાનતંતુની કાર્યક્ષમતા ઘટતી જાય છે અને તેમની ધારણાશક્તિ ઘટતી જાય છે. સમત્વ તૂટી જાય છે, સમતોલપણું ઘટે છે અને તેથી કરીને રોગાદિ થાય છે. જ્યપ

કે મંત્ર એકધારો નિરંતરતાપૂર્વકનો હૃદયથી લેવાયા કરાતો હોય તો તેવા મંત્રની ધારણાથી જ્ઞાનતંતુઓ પ્રાણવાન (Tone-up) બને છે. તેનાથી જ્ઞાનતંતુમાં સમતા, શાંતિ, સમતોલપણું આદિ પ્રગટે છે. એવી શાંતિ, સમતોલપણું અને સમતા જ્ઞાનતંતુમાં પ્રગટીને એની ટોચ ઉપર પહોંચે છે ત્યારે શરીરના રોગ પણ તે નિવારી શકવાની શક્યતામાં પ્રગટી શકે છે. જ્યાં એટલા માટે ગંગાના પુનિત પ્રવાહના જેવી સતત એકધારી સણંગ નિરંતરતા પ્રગટવી એ ઘણી જરૂરની હકીકત છે. જ્યારે જ્યાં એવી ભાવનાત્મક નિરંતરતા ઊગે છે ત્યારે મન, બુદ્ધિ, ચિત્ત, પ્રાણ અને અહંનાં પ્રાકૃતિક વલણો અને ધ્યેયને યોગ્ય મઠારવામાં પ્રેરણાત્મક અને કાર્યસાધક બને છે. મનના સંકલ્પવિકલ્પો ઘટી જાય છે. ચિત્તનો સાત્ત્વિક પ્રકારનો સંસ્કાર જન્મે છે. પ્રાણની કામકોધાર્દિક વિષયોની સ્હુરણામાં આપોઆપ ઘણી મંદતા પ્રગટે એવી સ્વાભાવિક ભૂમિકા પ્રગટે છે. બુદ્ધિમાં સમત્વ પ્રગટીને તેની ધારણા તેને અખંડપણે રહે છે. અને અહું જે પહેલાં જીવદશામાં હ્યાદાર્દિક અને ગુણાર્દિક વિષયોમાં રોકાયેલું રહ્યા કરતું હોય છે તે હવે તેમાંથી અટકીને ચેતન પરત્વેના જ્ઞાનપ્રેરક અભ્યાસમાં ગતિ કરવાને પ્રેરાયેલું રહ્યા કરે છે.

જ્યાં શ્રદ્ધા જરૂરી ખરી. એમ તો પ્રત્યેક કંઈ કરું સાકાર કરવાને તે વિષયના કર્મને પરિપૂર્ણપણે પાર ઉતારવાને માટે તે કર્મ પરત્વેની શ્રદ્ધા અનિવાર્ય છે. તેવી શ્રદ્ધા વિના તેવું થઈ શકતું હોતું નથી.

જ્યાંમાંથી જન્મેલી શ્રદ્ધાના પ્રાણથી જે લાગ્યું તેને અક્ષરદેહમાં મૂક્યું છે. એ વાંચતાં વાંચતાં જ્ય પરત્વે કેટલો ઊંડો અભ્યાસ થયો છે તે સમજાય છે. આ જ્ય ઉપરનું લખાણ અભ્યાસપૂર્ણ અને જ્ઞાનયુક્ત પણ છે. જ્યાં બધાં પાસાંથી વિચારવાનું કર્યું છે. જો જ્યાંની ભાવનામાં પ્રવર્તેલો ન હોત તો એવું બધું કદાચ ન બની શક્યું હોત.

જ્ય એ અમોઘ દૈવી શક્તિ છે. એ તો એના પ્રયોગોમાં જેમણે યાહોમ કરીને જંપલાવ્યું હોય અને એમાં સર્વ રીતે સર્વ ભાવે સમર્પણ કરેલું છે એવા પ્રયોગવીરને પણ સમાજ ભાગ્યે જ સમજ શકે તો અનુભવી તો શકે જ કેમ ?

‘જીવનસ્મરણસાધના’ની પ્રસ્તાવનામાંથી.

‘ઉં’ વિશે

શબ્દથી બ્રહ્મનો અનુભવ કેવી રીતે થાય ? સંસારવહેવારમાં પ્રેમ, આણગમો, વેર વગેરે પ્રગટે છે. એ શબ્દથી પ્રગટે છે એ વાત દરેક કબૂલ કરશે. એનાથી પ્રેમ, સહાનુભૂતિ, સદ્ગ્રાવ પ્રગટે છે. એનાથી ભાવનાય પ્રગટે છે તે હકીકત છે. આમાં શબ્દ ગ્રણ પ્રકારના છે : ૧. સ્થૂળ ૨. સૂક્ષ્મ અને ૩. કારણ. એનું ગ્રણમાં વિભાજન થતાં ગ્રણ પ્રકાર ગણાયા. એનો એકમાં કેવી રીતે મેળ ખવડાવવો ?

હજારો વર્ષ પહેલાં જ્યારે ભાષાનો ઉદ્ય થયો ન હતો ત્યારે વાદળાં અને એના ગડગડાટ થાય તેને ભગવાનનો અવાજ ગણેલો. એની પ્રાર્થના વેદમાં છે. આવા અનંત પ્રકારના શબ્દો છે. તેમ જ પૃથ્વી ઉપર વનસ્પતિની મૂંગી સૂચિ છે, જેની અંદર એક રમત રમાઈ રહેલી છે. એને લીધે પૃથ્વી ઉપર જીવન રહેલું છે અને એમાંથી એ લોકોએ મૂળ શબ્દ શોધ્યો અને જે પ્રગટ્યો તેને ઊં કહ્યો.

શબ્દ ગ્રણ ઠેકાણેથી ઉદ્ભવે : નાભિ, કંઠ અને મૂર્ધન્ય. આ ગ્રણેય સ્થળમાંથી ઉઠે અને એ ગ્રણેયને ભેટે એવો શબ્દ ઊં. ઊંકારમાં અખંડ બ્રહ્માંડ સમાયેલું છે. એકલી પૃથ્વી નહિ પણ સમસ્ત નભોમંડળ પણ એમાં સમાયેલું છે એમ બધા અનુભવીઓએ કહ્યું છે. બુદ્ધિથી વિચારીએ તોપણ એ એમાં સમાઈ જાય છે. દા.ત., અહીંના (સુરતના) ભવાનીવડનો ઉલ્લેખ

કરીએ. તેની સાથે વડના વિસ્તાર ઉપરાંત બધી જગા આવી જાય. એવું જ ઊંનું છે, પણ એ અનુભવમાં પ્રગટી શકે ખરું? હા. પણ એને માટે સતત સાધના જોઈએ. એ અવિરતપણે -સળંગપણે પ્રગટે તો એનો અનુભવ થાય. એનાથી કામ, કોધ વગેરે મોળા પડે. મારા એક મિત્ર બેંગલોરમાં ઓરફોર્સમાં છે. એમણે મને હમણાં જ કહું કે ચાળીસ હજાર ફૂટ ઉંચે વિમાન ઉડે પછી એ ડાઈવ મારે ત્યારે એ અવાજથી એટલી ઇન્ટેન્સીટી ઉઠે કે એનાથી મકાન પણ ઉડી જાય અને વધુ અવાજ થાય તો વિમાન તૂટી જાય.

‘ઉં’ના ઉચ્ચારણમાંથી જે આંદોલનો પ્રગટે છે એ નાભિ, કંઠ અને મૂર્ધન્ય - એ ત્રાણમાંથી પ્રગટે છે. આપણા કરોડરજીની અંદર મેરુંડ છે અને બીજાં ચકો છે. અવાજનાં આ ત્રાણ સ્થાન કદ્યાં. એની બરાબર સાથે રહેલા જ્ઞાનતંતુને સંકળાઈને આ ચકો આવેલાં છે. હવે જ્યારે ઊંના અવાજનાં આંદોલનો ઉઠે ત્યારે એ બધાં ચકો ખીલવાં માંડે છે.

ચેતનમાં બે પાસાં છે : નિરાકાર અને સાકાર. એ જ રીતે ‘ઉં’કારમાં ત્રાણ અક્ષર અ, ઉ, મ હોવા છતાં નથી. ઊં બોલવાથી માત્ર આપણામાં ભાવના પ્રગટી નથી, પણ જે જીવ ભાવના પ્રગટાવવા માટે એક સાધન તરીકે ઉપયોગ કરે છે તેને એમાં એ મદદરૂપ થાય છે. ઘણો લાંબો સમય ‘ઉં’નો ઉચ્ચાર સતત રહ્યા કરે છે તો એવા ઉચ્ચારથી કરોડરજીમાં જે આંદોલનો ફેલાય છે તેથી ચકો ખીલે છે અને એનાથી સમતા પ્રગટે છે.

સાધુ લોકો કહે છે ગૃહસ્થીથી ઊંકારનો ઉચ્ચાર ન કરાય. એટલે મેં તો પ્રયોગ કરેલો કે એનાથી શું થાય? અમુક પુરશ્વરાણ કરવાં એમ મેં નક્કી કરેલું. એક પુરશ્વરાણ એટલે ચોવીસ લાખ જ્પ. એનાથી મને કશું નુકસાન થયું ન હતું. જ્પના દરેક

શબ્દની સાથે ઊં હોય તો તે મધુર થાય છે. સંન્યાસીઓ માટે જ ઊંનું રટણ છે એ વાત ખોટી છે. ઊંનું ઉચ્ચારણ સરળ છે.

ઉંના સતત ઉચ્ચારણથી સમતા પ્રગટે, રાગદ્વૈષ ઘટે તેમ જ દ્વંદ્વ અને ગુણની પકડ મોળી પડે. એમ દ્વંદ્વ અને ગુણ મોળા પડતાં આપમેળે કામકોધ વગેરે મોળા પડે. એ મોળા પડે એટલે પ્રકૃતિથી આપણે જે ધકેલાતા હતા તેને બદલે કોઈ બીજો ફોર્સ આપણી પાસે કામ કરાવે છે. - દ્વંદ્વ અને ગુણ આપણાને કર્મમાં ધકેલતાં નથી, પણ આપણામાં જે ચેતન છે એ આપણાને ધકેલે છે. પ્રકૃતિ મોળી પડતાં આપણામાં જે પુરુષ છે તે જાગ્રત થાય છે અને તેમ થતાં આપણે પ્રકૃતિથી દોરવાતા નથી. દ્વંદ્વ અને ગુણમાં પ્રકૃતિથી કામ લઈએ છીએ ત્યાં સુધી ચેતન અથવા પુરુષ સુષુપ્ત રહે છે, પણ પ્રકૃતિ ખસી જતાં ચેતનના બળથી આપણામાં કર્મો પ્રગટે છે.

ઉંમાં જે ત્રણ અક્ષરો છે - અ, ઉ, મ. એના ઉચ્ચાર ત્રણ છે. ત્યાં ત્રણ લોક વસેલા છે. કોઈને લાગે કે ગાય્યાં છે, પણ એ અનુભવથી ખબર પડે. ‘પિંડ તે બ્રહ્માંડે’ એવી કહેવત છે. જે ખેલ આખા બ્રહ્માંડમાં ખેલાઈ રહેલો છે તે જ આપણા શરીરમાં થઈ રહેલો છે. આ શરીરમાં અણુપરમાણુની રચના છે એમ બ્રહ્માંડ પણ છે. એ અણુપરમાણુ ફૂટે છે એનાથી શરીરની શક્તિ-ગરમી જળવાઈ રહે છે. આપણા શરીરમાં અમુક પ્રમાણમાં ગરમી રહેતો ખોરાક પણ પચે છે. આ ત્રણ સ્થળ એ ત્રણ લોકનાં પ્રતીક છે. In the begining there was a world. એ પોઝિટિવ સ્થિતિ છે. એ ભાવાત્મક છે. એમાંથી જ્યારે Menifestation સ્કોટ થયું ત્યારે શબ્દ થયો. બાળક જન્મે પછી રે નહિ તો ગભરાઈએ છીએ. એટલે મળત્યાગ ન કરે તો ગભરાઈએ છીએ. શબ્દ પહેલાંની સ્થિતિ શૂન્યાવસ્થા. મળરૂપ જે વૃત્તિઓ છે તેનો

ત્યાગ કરવો પડે. એટલે જીવવું હોય તો શબ્દની ઉપાસના કરવી અને કામ, કોધ, લોભ વગેરેનો ત્યાગ કરવો.

શબ્દ પહેલાંની સ્થિતિ શૂન્યાવસ્થા છે જે ભાવાત્મક છે. એ શૂન્યાવસ્થામાં ઊંનું અસ્તિત્વ છે પણ સૂક્ષ્મ સ્વરૂપે છે. જ્યારે શબ્દ પ્રગટે ત્યારે તે સાકારરૂપે પ્રગટે છે.

જીવનમાં ચેતનના અનુભવને માટે શબ્દની ઉપાસનાની જરૂર. આ બધું જાણતાં આનંદ થાય પણ એની આરાધના કરવી મુશ્કેલ. શબ્દનાં આમ તો ગ્રાણ મૂળ, પણ આગળ જતાં તે કોઈકને એક, બે કે ગ્રાણેયમાંથી પ્રગટે છે. એ ગ્રાણેય કરણનો આપણાને જ્યાલ નથી હોતો. નાભિમાંથી જાગે અને મૂર્ધન્યમાંથી જાગે તો એનો લાભ થાય છે. પ્રયોગને ખાતર શબ્દ નાભિમાંથી ઉઠાવો અને જુઓ કે તમારા માનસની સ્થિતિ કેવી થાય છે. એનો બુલંદ રણકાર તમારામાં ઉન્મૂલન કરી દેશે, એકાગ્ર કરી દેશે. પ્રયોગ કરી જુઓ. ગમે તેવી મુંજુવણામાં આવો જ અવાજ ખૂબ મદદરૂપ છે. એમ જ કંઠ અને મૂર્ધન્યમાંથી ઉઠતા અવાજની પણ અસર હોય છે. કરી જુઓ તો ખબર પડે !

‘મૌનમંદિરમાં પ્રભુ’, પૃ. ૩૮ થી ૪૮ સંકલન
ઊંનું ઉચ્ચારણ

ઊંનું ઉચ્ચારણ એવી રીતે થાય કે એ નાભિમાંથી, કંઠમાંથી નીકળી અને બ્રહ્માંધને સ્પર્શે. એમાં રહેલા અ, ઉ અને મ ગ્રાણ પ્રકારના સ્થાનને સ્પર્શે છે. ઊં પ્રતીકાત્મક છે. એને આપણે આવી રીતે સમજવા જોઈએ. હવે તે બોલતી વખતે દરેકને આ જ્યાલ આવી ના જાય. એક વખત બરોબર સમજણરૂપે એને સમજ લીધું એટલે પછી વારંવાર કંઈ યાદ કરવાની જરૂર નથી. એ ગ્રાણ સ્થળે થાય અને શાસ જેટલો દીર્ઘ રહે એ સારું, પણ પછી શું થાય છે કે આપણું મન પેલા શાસમાં રહે. મને એવું જ થતું હતું કે પહેલાં

શાસોશાસ સાથે જપ કરવો. પછી એમ જાણ્યું કે એના કરતાં હદ્યના ધબકારાની સાથે જપ કરીએ તો વધારે પ્રાણવાળો બને, પણ મન શાસોશાસની સાથે રહ્યા કરે. મેં કહ્યું કે ‘આ બરોબર નથી. કાઢી નાખો. મારે આ બધું કશું નથી જોઈતું. જપ જ કર્યા કરો. પછી જે સ્થિતિ પ્રગટવાની હશે તે પ્રગટશે.’

સવાલ સાચો છે કે જપ શાસોશાસની સાથે લેવાવો જોઈએ. હદ્યના ધબકારાની સાથે લેવાય તો ઉત્તમ, પણ એ પ્રમાણે કરવા જતાં શરૂઆતના ગાળામાં આપણું મન છે તે પેલામાં જતું રહે છે. એટલે આપણે એક જ એને લીધા જ કરવાનું રાખો. આ ત્રણે સ્થળે સ્પર્શ છે કે નહિ તે જોવા હમણાં ન બેસવું. પછી જ્યારે એની નિરંતરતા પ્રગટશે, તે કાળે આપમેળે યથાયોગ્યપણું પ્રગટવાનું જ છે, કારણ કે નિરંતરતા થઈ, તે નિરંતરતામાં ચેતન જ રહેલું છે. બીજી કોઈ પણ વસ્તુમાં નિરંતરતા પ્રગટી શકે જ નહિ. કોઈ કાળે બ્રેક આવી જશે.

એના કરતાં એક ધ્યેય રાખો કે આ નિરંતર કેમ થાય ? નિરંતર થયું યથાયોગ્યપણે થવાવાનું જ છે એ પણ નિશ્ચિત છે, કારણ કે નિરંતરતામાં ચેતન રહેલું છે. તમે મકાન લો તોપણ અમુક વર્ષ-સો વર્ષ, બસો વર્ષ, ગ્રાણસો વર્ષ - કેટલાં વર્ષ ? ગમે તે કંઈ કશું લો તોપણ એમાં બ્રેક આવ્યા સિવાય રહેશે નહિ. આવું સમજીને મેં તો દીધે જ રાખેલું. ‘હરિ:ॐ, હરિ:ॐ’ ચાલ્યા જ કરે. એ જ કર્યા કરો. એટલે આપણે ધ્યેય આ રાખવો કે આ આપણે કરવા જેવું છે. બાકી, ઉચ્ચારનો ફાયદો છે એ બધી વાત સાચી છે, પણ એમાં જો ધ્યાન ચાલ્યું ગયું તો જપ નહિ થાય.

‘અગ્રતા - એકાઅગ્રતા’, પૃ. ૧૨૦-૧૨૧

નામ અને નામી

હરિ કરતાંય હરિનું નામ ચિહ્નિયાતું છે. નામથી કરીને નામીનો પરિચય થાય છે. પહેલાં કંઈ નામ લેવાથી પરિચય થતો નથી.

નામસ્મરણ : વૈજ્ઞાનિક અભિગમ અને પૃથક્કરણ • ૫૮

नाम जेम वधारे ने वधारे धूटाय पछी रस प्रगटो अनुभवाय. मुसलमान, प्रिस्ती बधामां आ नाम प्रयत्नित थयेलुं छे. आपणे 'राम' के 'कृष्ण' बोलीअे छीअे त्यारे आपणने 'राम' एटले दशरथनो पुत्र अभिप्रेत नथी, पण चैतन्यनी ऐवी आईउन्टीटी छे. जे शब्दथी व्यक्त थनार चैतन्य छे. ए 'राम'. जेना वडे करीने आपणे आकर्षणीय छीअे ए कृष्ण. नहि के यशोदा अने नंदनो छोकरो. आपणे 'राम' 'कृष्ण' बोलीअे छीअे ऐने एज्स्ट्रेक्ट तरीके लहीअे छीअे.

जेने दशरथनो पुत्र 'राम' के यशोदानंदनो छोकरो 'कृष्ण' ऐवुं उिगतुं होय तो बराबर नथी. तेवी रीते 'अल्ला'. प्रिस्ती लोको शुं बोले छे ऐनी मने खबर नथी. पारसीओ पण माणा राखे छे. एटले कशुंक बोलता तो हरे ४.

मूळ नाभी छे. ए तो एज्स्ट्रेक्ट छे. नाम ४ धूटावुं जोઈअ-ऐवुं कंठ नथी हो. सामान्य माणसने आशरो लेवा माटे नाम छे, पण नामनो भाव प्रगट्यो. ए भाव जागे तो ए भाव सातत्य वडे करीने ए नाभीनो परियय आपणने थाय छे. माटे, नामने भोटुं कहेलुं.

विशेष करीने आयुर्वेदिक दवा धूंटवाथी जेम ऐनी शक्तिमता वधे छे, तेवी रीते भगवाननुं नाम वधारे ने वधारे धूटाये जाय छे त्यारे एमांथी फलित थती शक्ति-उत्साह वधे छे. मारो अनुभव छे के भगवाननुं नाम लेतां लेतां बेचार क्लाक थाय एटले उत्साह आवे. साहस, हिंमत जेवा गुणोनो उदय थतो अनुभवेलो. शरुआतमां तो मने समज्ञा न पडे. आटलो अधो उत्साह केम रहे छे ? बहु दिवस पछी खबर पडी. सहनशक्ति वधे छे. साहस पण वधे छे, कारण के एमां तदन अज्ञाण्या रस्ते ४ दोट मूकवानी छे. माटे, साहस अनिवार्य.

આવા ગુણો આપણામાં છે જ, પણ એ વ્યક્ત થાય છે, છતા થાય છે. આ અનુભવ વહેલો થાય છે. આ પ્રતીતિ થાય છે ત્યારે આમાં શક્તિ છે એમ સમજાય છે.

સંસારવહેવારમાં - સુખમાં - કંઈ ભગવાન એકદમ યાદ ન આવે, પણ કોક દુઃખના પ્રસંગમાં ‘હે હરિ, હે પ્રભુ, હે ભગવાન’ એમ જેના તરફ વિશેષ લક્ષ ગયું હોય અથવા સંસ્કારે કરીને જે હોય તે નામ આપણને યાદ આવે છે. કેટલાકને યાદ નથી આવતું, કેમ કે એ લોકોને એવી અભિરુચિ નથી હોતી, પણ કેટલાક ચોરલૂંટારાને પણ ભગવાનનું નામ લેતાં સાંભળેલા છે. ભગવાનનું નામ લેતાં ભગવાનના ભક્ત થયેલા છે. સુરદાસ જીવદશામાં હતો ત્યારે વેશ્યાને ત્યાં જતો હતો. એ માટે કેવાં સાહસ કરતો હતો.

જેમ નામથી પૂછતાં પૂછતાં જવાય છે. જેમ કે ‘ભાઈ, ફ્લાણાનું ઘર ક્યાં આવ્યું ?’ તેને જાણનાર બતાવે છે. નામથી જડી આવે છે. ભગવાનનું ઠેકાણું પણ એના નામથી જડી આવે છે. એ નામ કલાકેક લીધે પત્તો નહિ ખાય. ખરેખરી રીતે નિરંતર થવું જોઈએ. નામનો ભાવ હોય તોય ચાલે, પણ ભાવ જાગે છે ખરો, પણ નિરંતરતામાં આવી શકતો નથી, પણ નામ નિરંતર થઈ શકે છે. આથી જે ભાવ થાય છે એ ટકેલો રહે છે. શરૂઆતના ગાળામાં એ વત્તાઓછા પ્રમાણમાં થાય છે ખરો. અનુભવી થયા પછી ભાવમાં ન્યૂનતા આવતી નથી.

‘અગ્રતા - એકાઅગ્રતા’, પૃ. ૬૧-૬૩

૫. નામસમરણનો હેતુ

સાધનનો ઉપયોગ

નામસમરણનો હેતુ જ્ઞાનપૂર્વક હૃદયમાં હૃદયથી જીવતો રહ્યા કરે તો જ તેનો અર્થ સરી શકે. બાકી, ખાલી નામ લીધા કર્યે અને ભજનકીર્તન ગાયા કર્યે કશો દહાડો ન વળે. મનમાં મનથી તો આપણે સંસારમાં રમ્યા કરતા હોઈએ અને સંસારના વિચારોમાં રસ પ્રગટાવતાં રહીએ તો તે નહિ ચાલી શકે. તેવી તેવી વેળાએ ચેતીને તેમાંથી અળગા થવાનો પ્રભુકૃપાથી આપણે જીવતોજીગતો પ્રયત્ન કર્યા કરવાનો છે. કાં તો સંસારને ભજો, કાં તો પ્રભુને ભજો. દૂધ અને દહીમાં-બંનેમાં પગ રાખી નહિ શકીએ. જે રાખવા જશે તે પછિડાશે, કારણ કે હજુ આપણે જીવદશામાં છીએ. ભગવાનનો પૂર્ણ ભક્ત બંનેમાં સમભાવે એકરસ રહી શકે છે. આપણે જો જીવનમાં જીવનવિકાસની ભાવનાને અને સમજણને તેની સંપૂર્ણ યથાર્થતામાં પ્રગટાવીને, તેની પ્રેરણાનુસાર જીવવાને ખરેખરી રીતે ઈચ્છતા હોઈએ તો જીવનમાં જેમાં ને તેમાં જીવનના તેવા હેતુને અને તેવા હેતુની સમજણને પ્રથમ મહત્વ આપણે આપ્યા કરવાનું રહે છે. આપણે પ્રથમ શેને મહત્વ આપીએ છીએ, તેના ઉપરથી આપણી મનાદિની વૃત્તિ સમજાઈ જતી હોય છે.

નદી પાર તરવા કાજે નાવડું હોય છે. નાવડું લીધું ખરું, પણ જો તે ત્યાંનું ત્યાં જ ભય્યા કરતું હોય અને ડગલું પણ આગળ લઈ જતું ન હોય તો તેમાં નાવડાનો કશો દોષ નથી. નદીના વહેતા પાણીમાં આમથી તેમ યોગ્ય ઠેકાણો નાવડાને લઈ જવાને કાજેની યોગ્ય ઉપયોગ કરવાની કળા આપણને આવડતી

હોવી ઘટે. માટે, સંસારમાં તરતાં રહી શકીએ તો જ સંસારમાં શાંતિ મળી શકે. તરતાં રહેવા કાજે તો પ્રભુની પાસે જીવનની ભાવનાથી રમ્યા કરીએ તો તેમ બની શકે. બાકી, સંસારમાં તો જીવો બધાં નર્યા ખદબદ્યાં કરે છે.

‘જીવનપોકાર’, પ્રથમ આ., પૃ. ૪૨૪-૨૫

સ્મરણથી સભાનતા

મૂળમાં તો આ માર્ગ પરતેની જિજ્ઞાસા થવી જોઈએ. પછી જિજ્ઞાસા વધારે ને વધારે ચેતનાત્મક જીવતી કેવી રીતે થાય એ પ્રકારના અભ્યાસમાં રહ્યા કરીએ. હવે અભ્યાસ એટલે શું ? તો કે’ જેના વડે કરીને - જે સાધન વડે કરીને, જે આપણે થવા ધાર્યું છે એ સાકાર થાય. એવી જે પ્રવૃત્તિ અને સક્રિય પ્રવૃત્તિ. પાછી એવી સક્રિય પ્રવૃત્તિ કે જેના વડે કરીને પેલું જે આપણે થવા ધાર્યું છે એ સાકાર થઈ શકે. એ સાધનનો અભ્યાસ કરીએ. આ અભ્યાસ છે તે મન, બુદ્ધિ, ચિત્ત, ગ્રાણને પણ સ્પર્શ કરે, પણ એ સ્પર્શ ક્યારે થાય કે જેથી એની પ્રત્યક્ષ પકડ આપણને આવતી થાય ? ત્યારે પકડ શાથી આવતી થાય ? એવું શરીરથી પણ કર્મ કરતાં રહેવું પડશે. એવો જે અભ્યાસ થાય પછી મનાદિકરણને આપમેળે સ્પર્શ છે. એકલું મનાદિમાં જ તમે રાખશો તો હવામાં ને હવામાં જ રહેશો. એ સાકાર નહિ થયું હોય. એટલે શરીર આદિથી પણ એવું કંઈ સાધન આપણે કર્યા કરવું પડશે. દા.ત., જપ કરવો હોય તો જીભથી કરવો. કોઈ કહે કે ‘મનમાં કરું દું.’ તો એ વાત ખોટી. ગણ્યાં તમારાં. મનનો ગ્રાફ્ટિક ગુણધર્મ સંકલ્પવિકલ્પ કરવાનો છે. તો સંકલ્પવિકલ્પ એની મેળે નહિ ટળી શકે. મનમાં જપ એની મેળે નહિ થઈ શકે. અશક્ય છે. જ્યારે તમને નિરંતરનો અભ્યાસ થઈ જાય ત્યારે તમને મનમાં

ધારણા રહે. શાસોશ્વાસની આપણાને ધારણા નહિ રહે, સભાનતા નહિ રહે, પણ પેલા જપની સભાનતા રહેશે અને સભાનતા રહેવાથી કંઈ કશામાં આપણે ભળી જતા નથી. મને ધણાંએ પૂછ્યું હતું કે ‘તમે આ ભગવાનનું સ્મરણ કરો એમાંથી આ સભાનતા કેવી રીતે જન્મે?’ ‘તું ભઈ, કરી જો ત્યારે તને ખબર પડે. હું ભણેલો છું. એમ ને એમ કંઈ મેં માન્યું નથી, પણ જ્યારે વધારે ને વધારે કાળ એમાં આચ્ચા કરીએ ત્યારે એની ધારણા રહે. એની જે અવેરનેસ હોવાથી બીજા કશામાં તમે પરોવાઈ જતા નથી. મધમાં માખી દૂબી જાય એવી રીતે તમે દૂબી જતા નથી, એ તો મારો અનુભવ છે.

‘શેષ-વિશેષ’, પૃ. ૮૪-૮૫

સ્મરણ સાથે પ્રાર્થના

જીવનવિકાસ જો આપણે કરવાનું ખરેખરું દિલ થયેલું હોય તો સાધકે પોતાના ધ્યેયને માર્ગ વિકાસને ઝુંધનારું જે જે કંઈ આવે તેનો ત્યાગ કરવાનું આત્મિક બળ પ્રગટાવવાનું રહે છે. જે જે કંઈ માર્ગમાં વિકાસ પરત્વે આડખીલીરૂપ નીવડતું હોય, એનું સ્પષ્ટ દર્શન સાધકને થઈ જવું જોઈશે.

ત્યાગ કરતા રહેવાની જાગૃતિ તેણે સાધવાની રહે છે. આમ હોવા છતાં તેણે એટલે સાધકે વધારે મહત્વ તો તે કાજેનાં કૃપા બળ-મદદ મેળવવા કાજેની પ્રાર્થના, ભક્તિ, પ્રેમ અને સમર્પણ આદિની હૃદયમાંની તેવી તેવી સાધનાઓને આપવાનું રહે છે, જેમ પગમાં કાંટો વાગ્યો હોય છે, તેનું ભાન થતાં તેને કાઢવાના ઉપાયમાં માનવી વધારે મહત્વ આચ્ચા કરે છે તેમ. એવી જ રીતે નામસ્મરણભાવના ધારણાપૂર્વક થયા કરે, તેના ઉપર તેનું મહત્વ રહ્યા કરવું જોઈએ. જેની મદદથી સાધકે ચઢવું છે, એના

હદ્યમાં પોતાના હદ્યને એકમેળ, એકાગ્ર અને પૂરેપૂરું કેંદ્રિત અને તે પણ પ્રેમભક્તિજ્ઞાનભાવે કરીને કરવાનું રહે છે. એની મદ્દ લીધા કરવાની છે. કંઈ થતાં એનામાં મન-દિલ પરોવી દેવાનાં રહે છે.

‘જીવનસોપાન’, ગ્રીજ આ., પૃ. ૧૯૧

ભાવનાનું સાતત્ય

જ્યુનો હેતુ શ્રીભગવાનની ભાવનાનું સાતત્ય જીવતું એકધારું રહ્યા કરે તે કાજેનો છે. જ્યુ એ સાધનમાત્ર છે. સાધન એ તો ધ્યેયનો મેળાપ કરાવનાર હોવાથી તે દાખિએ સાધનની તેટલી મહત્ત્વા છે. માત્ર, સાધનને જ ખાલી ખાલી પકડી રાખનાર કદ્દી ધ્યેય પામી શકતો નથી. કિંતુ ધ્યેયને જ ઘ્યાલમાં રાખી રાખીને જે પોતાનું સાધન જાળવ્યા કરે છે, તે જ ધ્યેયને પામી શકવાનો છે, પણ જે જીવ કોઈ પણ પ્રકારનું સાધન લેવાનું જ કરતો નથી અથવા જે જીવને સાધનાની ભાવનાની ધારણા કોઈ ને કોઈ પ્રકારે જીવતી રહી શકતી નથી, એ જીવને ધ્યેયને પામવાની અવધિ લાગશે નહિ. એકધારી દાખિ, વૃત્તિ અને વલશથી જ્યુ ભલે ન થઈ શકે, પણ જે કારણ હેતુથી તે લેવાતો હોય તે કારણનો હેતુ દિવસના સંગંગ વહેવારમાં એટલે કે તેના અંતર્ગતપણામાં જણવાઈ રહે તો એનું નામ જ્યુ જ છે. જ્યુ તો સ્થૂળ છે, પરંતુ એનાથી ઉત્પન્ન થતી ભાવના જ મહત્વની છે.

‘જીવનપ્રવેશ’, પ્રથમ આ., પૃ. ૧૪૭-૧૪૮

એક પળ પણ નકામી જાય તો હદ્યમાં ઘણી વેદના થાય એવું અનુભવાય તો તેવો જીવ નામસ્મરણમાં રહી શકે. માટે, કૃપા કરીને હવે તો તેમાં મન જીવ પરોવી શકવાનું કરે તો કંઈક

ગમે. ખાલી ખાલી સાધનાનું નામ લીધેથી તો કશું જ ન વળે. હિંમત ધારીને એનું નામ લીધા કરો. એમાં કોઈ કોઈને અટકાવી શકે એમ નથી.

‘જવનસોપાન’, પ્રથમ આ., પૃ. ૧૫૮

સ્મરણની સાથે

આપણે જવનવિકાસના પંથે છીએ તેનું જ્ઞાનભાન આપણને થયા કરવા કાજે કોઈ એક સાધનની સતત જરૂર રહે છે. આપણે જો તેવી રીતે સાધનાના ભાવમાં પૂરેપૂરા લાગી ગયેલા હોઈએ છીએ એવી નિશ્ચિત ભાવના જવનમાં જો આપણે પ્રગટાવી નહિ શક્યાં તો આપણે પોતે આપણને બેવજા નીવડીશું. આગળ-પાછળનાં પછી આપણને દંભી ગણે તેમાં તેઓનો દોષ નહિ ગણાય. તેવી સ્થિતિ થાય એના કરતાં તો મૃત્યુ ઉત્તમ. ભગવાનનું નામસ્મરણ કરવામાં કંઈ કશું વચ્ચે આવી શકતું નથી. નામસ્મરણ તો ચાલુ થયા જ કરવું જોઈએ. મનનાં વલણોને સાથ ન આપવો, સંમતિ ન આપવી અને તેનાથી અળગા થવું, તેવો જ્ઞાનપૂર્વકનો જાગૃતિયુક્ત અભ્યાસ પણ એટલો જ જરૂરનો છે. એ પ્રકારની કિયાવિધિ આંતરિક છે. જપ એ જેટલો બહારનો પ્રકાર છે તે સાથે સાથે પણ તે આંતરિક પ્રકારનો પણ છે. જપયજ્ઞની ભાવનાથી અને તેમાં ચાલુ એકધારાપણું પ્રગટતાં આંતરિક બળ પ્રગટતું અનુભવી શકાય છે. જપયજ્ઞ ચાલુ રહ્યા કરતો હશે તો તો મનના જુદા જુદા પ્રકારોનો ઈન્કાર કરવાનું, તેનો સમજણપૂર્વક સામનો કરવાનું વગેરે બધું સૂઝલા કરવાનું. માટે, નામસ્મરણ તો ગમે તે ઉપાયે લીધા જ કરવું. નહિતર ખાલી ખાલી અમણામાં કુટાઈ મરીશ. આપણે જાણે મોટી સાધના કરીએ છીએ, પણ કરતા હોઈશું મીંકું, અને એમ નકામી નકામી જિંદગી વહી જવાની

અને સમય જતાં એવી તો ધોર નિરાશા સાંપડશે કે જેમાંથી ઉઠવા વારો નહિ આવે. માટે, આપણને કે કોઈને દોષ દેવા વારો ન પ્રગટે તે કાજે સાધન તો અવશ્ય કરવું રહ્યું. સાધના ન થઈ શકે તો સાધનાનું નામ મૂકી દેવું એ ઉત્તમ છે.

‘જીવનપ્રવેશ’, પ્રથમ આ., પૃ. ૫૧-૫૨

સ્મરણની અનિવાર્યતા

નામસ્મરણ જ્યારે જ્ઞાનભક્તિપૂર્વકની જાગૃતિથી થયા કરે છે ત્યારે જ તેમાંથી હૃદયમાં સાચી જાગૃતિ પ્રગટી શકે છે. નામસ્મરણમાં જ્ઞાનભક્તિપૂર્વકની ભાવના પ્રગટેલી હોય છે તો જ હૃદયમાં એકાગ્રતા અને એકરતતાની ભાવના જામી શકે છે. હૃદયનો જીવતો સંબંધ તો જ શ્રીપ્રભુ સાથે બંધાઈ શકતો હોય છે. જો તેમ નથી બની શકતું તો તેનું કારણ પણ આપણા પોતાના જીવસ્વભાવના અને જીવની પ્રકૃતિના મૂળમાં રહેલું છે. જીવનનાં પ્રાકૃતિક વલણો, વૃત્તિઓ, વિચારો, લાગણીઓ, કામનાઓ, ઈચ્છાઓ, આશાઓ, માગણીઓ, ગમાઅણગમા, અમુક પ્રકારની સમજણની મડાગાંઠો અને તે પ્રમાણેના ચોકઠામાં જ સમજવાનાં વર્તુળોની પરંપરા અને એવી બીજી અનેક પ્રકારની ટેવો આદિ, જેમ જેમ તે આપણામાં પ્રગટતાં હોય છે, તે વેળા તેમાં તેમાં આપણે લપેટાઈ જતા હોઈએ છીએ. તેમાં શાંતિ, પ્રસન્નતા, તત્સ્થતા, વિવેક આદિ ગુણો કેળવવાનું જ્ઞાનભાન તો રાખી શકતાં નથી. તો પછી નામસ્મરણમાં જ્ઞાનભક્તિપૂર્વકની ભાવના પ્રગટે કેવી રીતે? આપણે તો જે પ્રકારની રમત માંડવી છે, તેનો ખરેખરો સાચો આરંભ કરવાનું તો કરતાં જ નથી. નામસ્મરણ, પ્રભુભાવના આદિ થતાં રહેતાં સકળ કર્મમાં જીવતાં રખાવવાને કંઈ કશો પાંસરો પ્રયત્ન જ આપણાથી ન થઈ શકતો

હોય, અથવા તેમ કરવાને મનહૃદયથી મંડ્યા કરવાને પણ ન બની શકતું હોય તો જે જીવને ગુરુ કર્યો, તો તેની ભાવના હૃદયમાં જીવતી કરીને તેને સકળ કંઈ કરતાં કરતાં હૃદયમાં પ્રગટાવવાનું અને તેની કૃપામદદ મેળવવાનું પણ જો જ્ઞાનભાન ન પ્રગટી શકતું હોય તો પછી આપણે શેની અને કેવી સાધના કરીએ છીએ તે જીવે પોતે વિચારવું રહ્યું.

‘જીવનસોપાન’, પ્રથમ આ., પૃ. ૨૯૪

સાધના હાંસી ખેલ નથી

સાધના કરનાર જીવે ગંભીરતાપૂર્વક વિચારવાનું રહે છે કે તેણે જીવનની સાધના કરવી છે કે ખાલી રમત રમવી છે? સાધના જો કરવી હોય તો જીવનની સાથે ખાલી ખેલ માંડવામાં તો સાર પણ નથી. જે જીવ સાધના કરવાને પ્રેરાય છે, તેનો પ્રાણ જો સાધનાના કારણભાવમાં ન પરોવાઈ શકતો હોય તો હજ એને સાધના કરવાનું દિલ જાગેલું નથી એમ સમજવું. તો પછી એવા જીવે શ્રીપ્રભુકૃપામદદથી પોતે વધારે જાગી જાગીને પોતાનાથી જે કંઈ બને તેવી જાગૃતિથી તેવા પ્રકારના પ્રયત્નમાં લગાતાર મંડ્યા કરવાનું રહે છે. એવો પ્રયત્ન કરતાં કરતાં જ ભાવનાનું એકધારું વહેવાનું બની શકવાનું છે. જે મથશે અને તે પણ જ્ઞાનભક્તિપૂર્વક મથ્યા કરશે, તે જ જાગી શકવાનો છે.

‘જીવનસોપાન’, પ્રથમ આ., પૃ. ૨૯૫

સતત પ્રયાસ

જેમ બાળક અથડાતાંકુટાતાં અનેકવાર તેને પડી જવાનું થતાં છતાં અને અનેકવાર લથડવાનું બનતાં છતાં તે પોતાનો ચાલવાનો પ્રયત્ન મૂકી દેતું નથી અથવા ચાલવાની અપેક્ષાએ

નકારાત્મક દેખાતી કિયાને લક્ષમાં જ લેતું હોતું નથી, તેવું આપણું થવું ઘટે છે. તો જ આપણો પ્રભુકૃપાથી ફાવી શકીએ. માટે, સતત એ માર્ગ પરત્વેનો આપણો જીવતોજાગતો પ્રયાસ જો એકધારો ચાલુ રહી શકે અને શ્રીભગવાનના નામસ્મરણમાં આપણું દિલ રહ્યા કરે અને અસરુણ થતાં કે નકારાત્મક વલણ જાગતાં શ્રીભગવાનની પ્રાર્થના દ્વારા કૃપામદદ માગવાનું બન્યા કરે તો આપણે જરૂર જીવી શકીએ.

‘જીવનમંડાળા’, બીજી આ., પૃ. ૩૪

પ્રભુને બધું સોંપવું

ભગવાનના નામસ્મરણની ધૂન પ્રગટાવી, એ ધૂનની મસ્તીમાં શ્રીપ્રભુપ્રીત્યર્થે સકળ કર્મ યજનભાવે કર્યા કરી તેને પાછાં જ્ઞાનભક્તિપૂર્વક સમર્પણ કર્યા કરવાં. જો ભગવાનના પંથે જવું છે તો આવું કર્યા વિના આરો નથી. અમારી સોબત પણ પ્રેમભક્તિ-જ્ઞાનપૂર્વકની પળેપળ જીવતી રહે તો જ ચાલી શકે. ભગવાન હજાર હાથવાળો છે, તેને જે તે બધું સોંખ્યા કરવાનું જ્ઞાનયુક્ત ભાન રાખે તો તે બધું સંભાળે તેવો છે. સોંપવાનો અર્થ એવો છે કે તે સોંખ્યા પછી તે અંગેનો કશો પણ આપણને વિચાર ના થાય. સાવ નિરાંતપણું આપણે અનુભવી શકીએ. સંસારવહેવારનાં કર્મમાં પણ આપણે એને જ રાજુ રાખવાને જે તે બધું કરીએ અને એમ એની ભાવનામાં નિશદ્ધિન તરબોળ રહ્યા કરીએ તો જ શ્રીપ્રભુની લગની લાગવાની છે તે વિના નહિ.

‘જીવનમંડાળા’, બીજી આ., પૃ. ૩૫

અભ્યાસથી શુદ્ધિ

શ્રીભગવાનને માર્ગ જનાર જીવે પોતાની પ્રકૃતિને પૂરેપૂરી

જાણવી જોઈએ. માંહેલા શત્રુના ધમપદ્ધાડા જ માત્ર નહિ, પણ એવી જાતના સ્થૂળ કે સૂક્ષ્મ હુમલાઓને તે જ પળે તેણે જાણવા જોઈએ. તે તે પળે તેણે જગ્રત રહીને કે થઈને શ્રીભગવાનની પ્રાર્થના કરી તે તે બધું એને પ્રેમભક્તિભાવે જ્ઞાનપૂર્વક સમર્પણ કર્યા કરવું પડશે. કામ, કોધ, મદ, મોહ, મત્સર, નાના પ્રકારની અહંતા અને નાના પ્રકારનાં મમત્વ - એ બધામાંથી મનનું વેગળું થાંબું એ તો ધારો કે જીવનું કામ ભલે ન હોય અને જીવનું એવું બધું હોવા છતાં જે જીવનો શ્રીભગવાનનાં ચરણકમળે જ માત્ર પડી રહેવાનો નિરધાર થયેલો છે એવા જીવના તેવા નિરધારની કસોટી કેટલીય વાર થતી રહેતી હોય છે. તેવો પોતે અનેકવાર પડતો તો હોય છે અને છોલાતો પણ હોય છે, પરંતુ તેની સતત એકધારી મીટ તો જીવનવિકાસ પરત્વે જ રહ્યા કરે છે અને એના ધ્યેયમાંથી તો તે કદ્દી પણ હઠતો નથી. તે પડે છે કરે છે એની એને ઝાજી પડી હોતી નથી, કિંતુ એના ધ્યેયમાંથી એની જરાક પણ નજરચૂક થતાં એને હજારો વીંધીના ઉંખથી પણ વધારે વેદના પ્રગટે છે.

બેસી ન રહો

આ માત્ર કલ્પનાથી લખેલું નથી, પણ અનુભવનું કથન છે. એટલે જો આપણા જીવનનું ધ્યેય શ્રીભગવાનનાં ચરણકમળનો રૂડો અલભ્ય લાભ એ જ એકમાત્ર હોય તો આપણી નજર ત્યાંની ત્યાં જ રહ્યા કરે તેમ આપણે મથ્યા કરવાનું છે. એવા પ્રામાણિક અને સાચા મથવામાંથી કોઈક દહાડો સાચો પ્રાણ પ્રગટી જવાનો છે એ નક્કી માનશોજી. જે જીવ પંથ ઉપર ડગલાં ભરતો રહે છે તેવો જ જીવ પંથને એક દિવસ કાપી શકવા અથવા વટાવી શકવા ભાગ્યાશાળી થવાનો છે, તેવું જે જીવ માનતો નથી તેવો

જીવ તો માત્ર ઠેરનો ઠેર રહેવાનો છે. એટલે જેને પહોંચવું છે તેને તો પળવાર પણ બેસી રહેવું પોસાય તેમ નથી. માટે, ફૂપા કરીને બેસી રહેશો નહિ.

‘જીવનમંડાણ’, બીજુ આ., પૃ. ૭૮

સ્મરણ શા માટે

બુદ્ધિ અને પ્રાણ એ આપણા આધારનાં કરણો શાંત પડ્યા વિના, પૂરેપૂરાં શુદ્ધ થયા વિના, શ્રીભગવાનનાં ચરણકમળમાં આસક્તિ પામવી એ લગભગ અશક્ય હકીકત છે. સૌથી વધારે તો પ્રાણ જીવને જીવપણામાં રાખનાર છે. બુદ્ધિમાં સાત્ત્વિકતા, તેજ, સૂક્ષ્મતા અને આરપાર વેધી શકે તેવી વેધકતા શ્રીભગવાનમાં શ્રદ્ધાવિશ્વાસ પ્રગટ્યા વિના, જીવતાં થયા વિના, કદી પણ જન્મી શકતાં નથી. બુદ્ધિ આપણને હચમચાવે, ડગમગાવે અને સગડગ પણ કરાવે અને જીવનવિકાસના ધ્યેયથી દૂર પણ ફગાવે છે. જો આપણી નજર સતત એકધારી જીવનવિકાસના ધ્યેય પરત્વે જીવતીજીગતી રહ્યા કરતી હોય તો આપણને સફાળા જગાડીને ચેતાવનાર પણ તે જ હોય છે. તેથી, મથનારને તે શત્રુ-મિત્ર જેવાં હોય છે. જે ખોળે છે તેને તે જડે છે. મથે છે તે મેળવવાને માર્ગ છે. બાકીના તો મોં વકાસતા રહે છે. આપણે તો એને જ સંભાર્યા કરવાનો છે, પરંતુ તે શેને કાજે, તેનો પૂરેપૂરો જગ્રત્તિપૂર્વકનો ઘ્યાલ રાખવાનો છે અને એમાં જ માલ છે. નાસીપાસ થવાનું કારણ ના હોય.

મારા જેવાને તો મહામુસીબતો હતી. ખાવાનાં સાંસાં ના કહેવાય, પણ ગરીબાઈ તો પૂરી, પાકી હતી. છતાં એનું નામ લીધા કરવાનો અભ્યાસ ચાલુ જ રાખ્યા કરેલો. પોણાચાર વર્ષે અને તે પણ અભ્યાસ જેવો તેવો નહિ, પણ સતત અને એકધારો

થતાં પાકયો. ભુલાય તો કેવું થતું તે જણાવ્યું છે. માટે, અભ્યાસ વિના આરો નથી. અભ્યાસ વધતાં વધતાં જ વૈરાગ્ય જાગવાનો છે. જેને વૈરાગ્ય જાગી જાય છે એવા જીવને અભ્યાસ સહજ અને સરળ થતો જાય છે.

‘જીવનમંડપાણ’, બીજ આ., પૃ. ૮-૯

જ્ઞાનભાવ સાથે સ્મરણ

જ્ઞાનભાવે વડીલોની મર્યાદા પાળશો અને ઘરમાં આપણાથી બને તેટલો સુમેળ પ્રવર્તે અને ઘરનું વાતાવરણ જેટલું શાંતિવાળું અને પ્રસન્નતાવાળું રાખી શકવામાં જેટલો ભાગ ભજવી શકાય તેટલો હૃદયના ઉમળકાથી ભજવવો. તેવું થવા દેવા કાજે ઘસાવું કે સહેવું પડે તો, તે તો એક પ્રકારનો યજ્ઞ છે એમ હૃદયમાં સમજવું.

બને તેટલું નામસ્મરણ કરતા રહેશોજી. જીવનમાં વિવેકયુક્ત નમૃતા કેળવશો. જો વિવેક ન પ્રગટે તો તે સાધના નથી. વિવેકની ભૂમિકા તો સમતા, તટસ્થતા આદિ ભાવોની સાથે રહેલી છે. સર્વ સાથે સુમેળ ભાવે જીવવાનું છે. સર્વ કોઈમાં શ્રીપ્રભુની કૃપાલીલાનો જ વિસ્તાર છે એમ સમજીને સર્વ પરત્વે એવો ભાવ મનહૃદયથી રાખવાનું આપણે શીખવાનું છે. આપણા અંતરમાં જે ભગવાન બિરાજેલો છે, એ જ આપણો તારણહાર છે અને એનું જ સગપણ સાચું છે. તે જ્ઞાન જીવનમાં ઉતારવા કાજે મળેલામાં તેવો ભાવ જગાડવાનો છે. સંસારમાં રહીને તેવો ભાવ રહી શકવો દુર્લભ છે એમ ઘણાં કહે છે, પરંતુ જો શ્રીપ્રભુનાં ચરણકમળમાં પ્રેમભક્તિ પ્રગટી જાય તો સર્વ શક્ય છે. માટે, એની જ્ઞાનભક્તિમાં મસ્ત બનજો. સ્મરણમાં તલ્લીનતા અનુભવશો.

‘જીવનમંડાળ’, બીજી આ., પૃ. ૪-૫

પ્રભુસ્મરણ એ જ ખરું

સંસારવહેવારના સંબંધોમાં, સંસારવહેવારની રીતે આપણે વર્તવાનું નથી અને સંબંધોની રીતે મન પણ રાખવાનું નથી કે પરોવવાનું નથી. પ્રભુની ભક્તિ વ્યક્ત અને અવ્યક્ત બંને છે. જે જે વખતે જે જે કંઈ કામ મળે તે તે કામમાં શ્રીપ્રભુની સ્મરણભાવના અને ધારણા જીવતી રાખ્યા કરીને તે તે જીવના સંબંધને આપણે ગૌણ ગણ્યા કરવાનો છે.

પ્રતિજ્ઞા એવી હોવી જોઈએ કે જેથી કરીને જીવનનો વિકાસ વધે અને તે પરત્વેની સૂક્ષ્મ સમજાળ પણ પ્રગટે. જે જે સંબંધ છે તે કોઈને ત્યજવાનો પણ નથી, મૂકી દેવાનો પણ નથી અને સામો વધારવા જવાનો પણ નથી, પરંતુ જેમ જેમ જ્યાં જ્યાં હોઈએ તેમ તેમ જે થયા કરે તેમાં જ્ઞાનપૂર્વકનું પ્રેમભક્તિનું જીવતું સ્મરણ રહ્યા કરે એટલું લક્ષમાં રાખવાનું છે. બને તેટલું ઓછામાં ઓછું બોલવું અને પ્રભુનું સ્મરણ કરતાં કરતાં જે જે કર્મ મળે તે કર્મ કરતાં કરતાં પ્રભુની ભાવનાને દઢતર બનાવવી.

‘જીવનમંડાળ’, બીજી આ., પૃ. ૪૧-૪૨

મોટેથી સ્મરણ

ભગવાનનું નામસ્મરણ સતત એકધારું બન્યા કરે એની તું ખૂબ ખૂબ કાળજી રાખજે અને હૃદયમાં ખૂબ ભક્તિ પ્રગટાવી પ્રગટાવીને એકાગ્રભાવે એનું નામ મોટેથી લીધા કરજે. એથી કોઈને સારું લાગે કે ખોટું લાગે તેનો ઝાઝો વિચાર કરવાપણું નથી. કોઈ પૂછે તો કહેવું કે મન વિચાર કરતું અટકે તેને માટે આમ કરું છું.

‘જીવનમંડાણ’, બીજી આ., પૃ. ૧૧૬

નામસ્મરણ ભલે શુષ્કતાથી થતું લાગે તોપણ લીધા કરવું.
સંતોષકારક ન થતું લાગે ત્યારે આપણું મન બીજી કોઈ બાબતમાં
ભેરવાઈ પડેલું છે એમ સમજવું.

‘જીવનમંડાણ’, બીજી આ., પૃ. ૧૪૮

મન અને સ્મરણ

ભગવાનનું નામસ્મરણ મનને એના ચીલામાંથી હઠાવવાને
કાજે ઉત્તમ સાધનરૂપ છે. મન જે જે વિચારે છે, તેના પરિણામને
તેવી રીતે થતું અટકાવવા નામસ્મરણનું તે તે પળે તેની તેની સાથે
ભેળવવું મનહદ્યથી બન્યા કરશે તો મનના તેવા તેવા તે તે
પળોના વિચારોનું જોશ, એની છાયા અને એના સંસ્કાર મોળાં
પડતાં જવાનાં છે તે વાત નક્કી છે. જેમ કે ઝેર હોય, પરંતુ તેની
સાથે તેની વિરુદ્ધનું બીજું કશું ભેળવ્યું હોય તો તેની માત્રા ઘટે
અને ઝેરનું જોશ પણ ઘટે અને જે જાતનું પરિણામ તેનાથી આવવાનું
હોય તે રીતે તે પરિણામ ન નીપજવાનો સંભવ રહે છે. એવી
રીતે જો મનની મનથી થતી સકળ પ્રવૃત્તિમાં સમજણ સાથેનું
ભાવનાપૂર્વકનું ભગવાનનું નામસ્મરણ જીવતું ચાલુ રહ્યા કરે તો
આપણે સંસારના સંકાળમાંથી મુક્ત થઈ શકીએ. જ્યાં સુધી મનનો
સ્વભાવ પલટાતો નથી ત્યાં સુધી માનવીને કશામાંથી મુક્તિ મળી
શકતી નથી. એટલે જ બધા ધર્મોએ મનની કેળવણી ઉપર મહત્વ
આપેલું છે.

જીવનની સમજણ અને જીવનને આપણે કયે માર્ગ લઈ
જવાનું છે એ બંનેની જીવતી ધારણા મનને કેળવવાને કાજે મુખ્ય
સાધન છે. સંસારની પ્રવૃત્તિમાંથી જીવને કદી પણ નિરાંત વળી
શકવાની નથી એ તો નક્કર હકીકતની વાત છે. સંસારને છોડ્યો

ઇઓડી શકતો નથી. સંસાર આપણાને વળગેલો નથી, કિંતુ આપણે સંસારને વળગેલા છીએ. અને તેથી કરીને આપણે મનની સ્થિતિને ત્યાં જ માત્ર પલટાવવાની રહે છે. મન એની મેળે પલટી જઈ શકતું નથી. એટલા કાજે જ સાધનાની જરૂર છે. એટલે મારી તમને હૃદયની પ્રાર્થના છે કે મનને પલટાવવા કાજે પ્રભુના નામનું પ્રેમભક્તિજ્ઞાનપૂર્વકનું (૧) સતત એકધારું સ્મરણ - એ એક મુખ્ય સાધન (૨) બીજું સાધન તે રોજબરોજનાં થતાં સકળ કર્મોમાં શ્રીભગવાનની ભાવના અને ધારણા જીવતી રહે તે કાજેનો દઢતાભર્યો અભ્યાસ અને (૩) ગ્રીજું સાધન તે જીવનમાં મળતા સર્વ પ્રસંગોમાં સમતા, શાંતિ, ધીરજ, તત્સ્થતા, બીજાંઓ પરત્વેની સહાનુભૂતિ વગેરે ગુણો આપણે કેળવતા રહેવાનું છે. જો જીવનની ભાવના કેળવવાની આપણાને સાચે સાચી ભાવના જીવતી થઈ ગયેલી હોય છે તો જે કંઈ થતું રહે છે તે આપણા વિકાસ માટે જ છે, એવી અનુભવની સમજજ્ઞા તેમાં તેમાંથી જાગતી જ રહે છે. આમ હોવાથી મનની સકળ જાતની પકડમાંથી મોકળા થવાને કાજે પ્રત્યેક સાધકે એટલું તો જરૂર કરવું જ પડશે.

જે ચાલતો છે તેને કશી ગૂંચ નડતી નથી. ચાલનારો તો ગૂંચ, મુશ્કેલી, અથડામણ, મૂંજવણ, અકળામણ, સંતાપ, ત્રાસ, દુઃખ - એ બધાંને યોગ્ય રીતે ઉકેલીને આગળ જવાનું જ સમજે છે. ચાલવાનો જ જેણે દઢ નિશ્ચય કરેલો છે, તેને જગતમાં કોઈ પણ અટકાવી શકે એમ નથી, એવી એની ખૂબી છે.

‘જીવનપ્રેરણા’, ગ્રીજ આ., પૃ. ૬૭-૬૮

જપયજ્ઞ

જપને યજ્ઞમાં ગણેલો છે. જપ એ પણ એક મોટામાં મોટું સહજ અને સરળ સાધન છે. સામાન્ય રીતે જપ ટૂંકામાં ટૂંકો હોવો

જોઈએ. એ બોલવામાં ક્રિલાટ નહિ પણ સરળ હોવો જોઈએ. ઇસ્વ હોય તો ઉત્તમ. અને શબ્દનાં ત્રણ સ્થળ છે :- ૧. નાભિ, ૨. કંઠ અને ૩. બ્રહ્મરંધ. જપ એવો હોવો ઘટે કે એ ત્રણને સ્પર્શી શકે અને એકેક સ્થળ ઉપરથી જપના અમુક અમુક અક્ષરનું ભાવપૂર્વકનું હેતુની ધારણા સાથે ઉચ્ચારણ થાય અને તેવા જપની ધારણામાં સળંગતા પ્રગટે તો તે સાધના અતિ ઉત્તમ છે. જપને યજ્ઞ એટલા માટે કહ્યો છે કે જપ કરતાં કરતાં ભગવાનને માટે એટલે કે આપણા ધ્યેયવિકાસની ભાવનાને મળવાને કાજે આપણને હોમાઈ જવાની થનગનાટી, દિલ્લગી પ્રગટવી જોઈશે. યજ્ઞમાં જે તે બધું હોમવાનું હોય છે. એટલે આપણે પણ જે જે કંઈ મનાદિકરણમાં ઊભજે તે તે બધું તે યજ્ઞમાં જ્ઞાનભક્તિપૂર્વક હોમ્યા કરવાનું છે અને તે તે સાથે પ્રાર્થના કર્યા કરવાની હોય છે. યજ્ઞ એટલે હોમતાં હોમતાં, હોમાતાં હોમાતાં ધ્યેયને પામીએ અથવા તો ધ્યેય પમાય તે. તે ત્યારે થઈ શકે કે જ્યારે એને અનુકૂળ પરિભૂમિકા, વાતાવરણ ઊભું કરી શકીએ. જ્યારે જપની સાથે ધારણામાં હૃદયનો ભાવ પ્રગટે છે અને એ ભાવનું સાતત્ય પ્રગટે છે ત્યારે તે ભાવ દ્વારા જે પ્રકારનો રસ નીતરે છે, એ રસના પ્રભાવથી કરીને ધ્યાનમાં લગાતાર, મશગૂલ, મગ્ન થઈ જવાય છે અને એમ કરતાં કરતાં ધ્યાનની પરાકાણાએ પહોંચાતું જવાય છે અને અંતે તો સત્યનાં જુદાં જુદાં પાસાંનાં દર્શન થતાં રહે છે.

આ યજ્ઞનું હુતદ્રવ્ય

જો આપણે ભગવાનને રસ્તે જવું હોય તો જીવમ્કારની સકળ પ્રવૃત્તિઓ જે સદાય અહંપ્રેરિત હોય છે તે બધીને અને મનાદિકરણના બધાય ગ્રાહૃતિક ધર્મોને સમજી સમજીને ત્યજવાના રહે છે. આ કંઈ એકદમ બની જતું નથી. જો આપણને જીવનના

ધ્યેય પરત્વે ગતિ કરવાનું સાચેસાચું દિલ પ્રગટ્યું હશે તો આપણાને તે પરત્વેની ગતિ પ્રગટીને તેને માટેનું કંઈક ને કંઈક કરવાનું સૂજ્યા કરશે. જ્યારે જ્યારે ખરેખરું કંઈક કશામાં દિલ પ્રગટે છે ત્યારે ત્યારે આપણું દિલ તેને માટે જરૂર કંઈક ને કંઈક વિચારતું બની જાય છે અને તેનો ઉપાય પણ સૂજે છે અને દિલ પ્રગટેલું હોવાથી હૈયાઉકલત અને સૂજ પણ પ્રગટે છે. આ માર્ગ જવું હોય તો જીવપ્રકારની સકળ કામનાઓ, આશાઓ, ઈચ્છાઓ, તૃષ્ણાઓ, લોલુપતા, કામ, કોધ, લોભ, મોહ, મદ, મત્સર વગેરે વગેરે ઉમળકાભેર જીવનવિકાસના યજ્ઞમાં હોમ્યા કરવાની તૈયારી આપણી પ્રગટવી જોઈશે. જો એ નહિ બની શકતું હોય તો એક તસુ પણ આપણાથી આગળ વધી શકાશે નહિ તે નિશ્ચિત હકીકત છે.

‘જીવનસંશોધન’, પ્રથમ આ., પૃ. ૩૨૦-૩૧

૬. નામસ્મરણસાધના

નિરાશાની પળે

જીવનમાં કેટલીયે એવી ભયંકર નિરાશાની પળો પ્રગટેલી, ત્યારે ક્યાંયે કોઈ મદદગાર મળે જ નહિ, કે કોઈનોયે સાથ ન હતો કે ન હતી કોઈની લગ્નીર જેટલીયે સહાનુભૂતિ, ન હતો એવો કોઈ હૃદયનો ખરો સાથી, ન હતું ખરી હૂંફ દેનારું, કોઈ કરતાં કોઈ પણ નજરે પડતું ન હતું કે જેના ઈશારાથી કંઈક પણ જરા આસ્તાએશ મળે ! જીવનમાં બસ બધું જ સૂભૂતામ હતું. તેવી વેળાએ પણ એના નામના મધુરા પ્રિય સ્મરણનો એક સથવારો

હદ્યમાં હતો કે જેની ઓથે ભયંકરમાં ભયંકર અંધારાને એની કૃપાથી વટાવવાનું બની શક્યું છે.

એવી અપાર મુશ્કેલીના ગાળામાં, હદ્યમાં એનું નામ લીધા કરી, એના ઉપર જે તે બધું સોંઘા કરી, એની ઓથની બાંધ પકડી, બસ હોય તેટલું બળ કરી, હિમત, સાહસ, ધીરજ અને દૃઢતા ધારણા કરી, તે વેળાએ એની કૃપાથી બસ જો ઝુકાવ્યે રાખવાનું બની શક્યું તો જ આજે એની કૃપાથી ઊભું રહી શકવાનું બની શકેલું છે. ખરી મર્દનગી દાખવવાનો અવસર જ જીવનમાં એવો કાળ હોય છે. એવી કારમી પળોમાં જે ટકીને ઊભો રહી શકે છે, તે જ મરદ છે. આ માર્ગમાં કાચાપોચાનું કામ નથી. મરણાંતે પણ જેનો સાથ ન ધૂટી શકે એવી હદ્યમાં જેને અદ્ભુત પ્રેરણા પ્રગટેલી હોય, એકમાત્ર તેવાનું જ આ માર્ગમાં કામ છે. તેવા પ્રકારના જીવો જ આ માર્ગમાં ટકી શકે છે.

‘જીવનપોકાર’, પ્રથમ આ., પૃ. ૩૩૬-૩૩૭

સ્મરણાનું પરિણામ

આપણે આપણું કામ રસ, ઉત્સાહ, ઉમંગથી કર્યા કરવાનું છે. જરીકે આળસ, ઉદાસીનતા કે કંટાળો ન આવવો જોઈએ. ભગવાનના નામસ્મરણમાંથી જો એટલું ઊપજી શકતું ન હોય તો આપણે ક્યાંક આડફંટે રસ્તો અથડાઈએ છીએ એમ સમજવાનું છે. નામસ્મરણમાં જે જીવ હોવો જોઈએ તે જીવ હજી આપણામાં આવ્યો નથી એવો એનો અર્થ છે. આપણે હંમેશાં નામસ્મરણની ભૂમિકા ઉપર મહેલ ચણવાના છે. આપણું એ એક મોટામાં મોટું સાધન છે. બીજાં બધાં સાધનો તો એમાં એકાગ્રપણું વધારવા

માટેનાં છે. અને નામસ્મરણ ભલે મુખ્ય હોય પણ પછીથી એનાથી કરી જે શક્તિ આપણામાં જાગે છે, અને જ આપણે આપણી જત પછીથી સોંપી દેવાની છે. નામસ્મરણ મુખ્યત્વે તો એ હાલમાં સુખુપ્તિમાં પડેલી શક્તિને જાગૃત કરવા માટે તથા રસ જગાડવા માટે જરૂરનું છે. એ શક્તિ જાગ્યા પછીથી જ ખરું યુદ્ધ તો ચાલે છે અને ત્યારે આપણને બધી જતની સમજણ ચોખી રીતે પડવા માંડે છે.

‘જીવનપગરણ’, બીજ આ., પૃ. ૨૧૨-૧૩

ફરી ફરીને જાગો

આપણી આંખ જરાક પણ ઉઘડેલી હોય છે ત્યારે તે દણ્ઠિએ જોતાં ભગવાને આપણને ચેતવ્યાના કેટલાય દાખલા મળી રહે છે, પણ એ આંખ પાછી બંધ થાય છે, એ આપણી ખાટલે ખોડ છે. ઘડીભર તમને ચિનગારી લાગશે, પણ વળી પાછા આપણે તો ‘એ ભગવાન એના એ !’ એટલે ફરી ફરીને આપણે જાગ્રત થવાનું છે અને બેઠા થવાનું છે. એમ થતાં થતાં અને એવો અભ્યાસ પડતાં જાગ્રતિ પણ એકધારી સતત પ્રગટવા માંડશે.

નામસ્મરણથી આમૂલાગ્ર પરિવર્તન

મન આવા પ્રકારના ભાવમાં લગાતાર રહ્યા કરે અને તે માટેની જાગ્રતિ ટકી રહે તે માટેનું એક સર્વશ્રેષ્ઠ, સરળ અને સહજ સાધન નામજ્યપ છે. નામસ્મરણનો પ્રભાવ અપરંપાર છે. દિવસના સમયનો વધારેમાં વધારે સમય જો એમાં આપી શકીએ, આપણી બધી શક્તિના સરવાળાનો મોટો ભાગ એમાં ખર્ચાએ તો ભાવનાની સંંગતા પણ પ્રગટી શકે. નામસ્મરણની ભાવના જીવનમાં જ્યારે પ્રગટે છે ત્યારે એનામાં સત્ત-અસત્તનો વિવેક

પણ પ્રગટે છે. સદ્ભાવનાની અસર પ્રગટ્યા વિના રહી શકતી નથી. જેમ કોઈ અમુક જ રોગને માટે દવા લેવામાં આવી હોય અને તે રોગ દવાથી મટે એટલું જ નહિ પણ એને પરિણામે આખું શરીર તંદુરસ્ત થાય, તેવી રીતે જીવનમાં જ્યારે સદ્ભાવના પ્રગટે છે ત્યારે જ્ઞાનભક્તિપૂર્વકની તેવી સદ્ભાવના સારાયે જીવન ઉપર પોતાની અસર પાડે છે અને સદ્ભાવનાથી થતા રહેતા એકધારા વર્તનથી ગુણ અને શક્તિ પણ પ્રગટે છે. નામસ્મરણની ભાવના જેને દિલમાં ઊગે છે અને તે પ્રમાણે જાગ્રત બની બનીને એમાં દિલ પરોવી પરોવીને કંઈક થોડીધણી પણ ઊર્મિ પ્રગટીને જો તે તરફ વળવાનું સાચેસાચું દિલ થાય છે તો તેને તે માર્ગ પરત્યે વળી શકવાની પૂરેપૂરી શક્યતા છે. એવો જીવંત અભ્યાસ પ્રગટતાં પ્રગટતાં એના બળવાન વહેણમાં બધું ધસડાઈ જવાનું છે અને એ વહેણનો પ્રચંડ ધસારો પ્રગટતાં વચ્ચે મોટા પથ્થર કે ખડક આવશે તોયે એમને કોરીને કે બાજુએ રાખીને એ પ્રવાહ ક્યાંયે આગળ દોડ્યો જશે, પરંતુ આમાં એક તર્કદોષ છે. ભગવાનની એવી ભાવના જાગતાં જાગતાં આપણે પ્રકૃતિને કંઈ કોરે મૂકી દેવાની નથી. પ્રકૃતિ એટલે એનો બધો જ સરવાળો -આગહો, માન્યતાઓ, ટેવો, મડાગાંઠો, સ્વભાવ, મનાદિકરણો અને શરીર વગેરે વગેરે. એ બધું જો પલટાઈ શકતું ન હોય તો પછી આપણને તેવી સાધનાનો જીવનમાં જાઝો ખપ નથી અને ઉપયોગ પણ નથી. જેવા છીએ તેમના તેમ રહીને આત્માનું દર્શન થાય છે એમ જો કોઈ કહેતું હોય કે માનતું હોય તો તે મિથ્યા છે, બ્રમ છે. એટલે આપણી સાધનાના જીવંત આદર્શની સાથે સાથે આપણે દિલમાં સતત એકધારું લક્ષ રાખવાની જરૂર છે કે આ સાધનાના જ્ઞાનભક્તિપૂર્વકના અનુશીલન પરિશીલનની સાથે સાથે આપણાં

સ્વભાવ અને પ્રકૃતિમાં પણ ફેર પડતો જાય અને તે પરતેનું સાચું દષ્ટિબિંદુ કેળવાતું જાય તે પણ ધણું ધણું જરૂરનું છે.

‘જીવનસંશોધન’, પ્રથમ આ., પૃ. ૨૪૪-૨૪૬

નબળાઈથી મુક્તિ

જે જીવને જાગ્રત્તિ રહેતી ન હોય, તેણે ત્યાં સુધી તેનું બધું કાચું સમજવું, કારણ કે તે ગમે ત્યારે બેસાવધ બની જ જવાનો, અને ગમે તેમ તણાઈને ફંટાઈ પણ જવાનો. એ પોતાને રોકી શકવા જેટલું આંતરિક બળ તો પેદા કરી શકેલ નથી. તેથી, તેવા જીવે નામસ્મરણ કરી કરી, પોતાની નબળાઈઓથી મુક્ત બનવાને, એની અસરથી જીવનમાં લેવાઈ ન જવા કાજે, તેવી વેળા શ્રીભગવાનની કૃપામદદ માટે પ્રાર્થના કરી કરી પોતે ઉત્કટપણે સજાગ થવાનો પ્રામાણિક પ્રયત્ન કરવાનો રહે છે. જે જીવ એવો હૃદયથી પ્રામાણિક પ્રયત્ન નેક દાનતથી કર્યા કરતો હોય છે, તેવા જીવને નાહિંમત થવાપણું ક્યાંયે રહેતું નથી. તે તો પડે, પડે અને પાછો ઊઠે, એમ અનેકવાર જીવનમાં બન્યા કરતું હોય છે. એવી ચઢુટિતરમાંથી જીવને સાચા જીવનની જાંખી સાંપે છે. એવો જીવ પોતાના જીવનસંગ્રામના મરણિયા પ્રયત્નોમાંથી ઊભો અને ટકાર થયા કરવાનું પ્રભુકૃપાથી શીખે છે. માટે, પ્રયત્ન કરતા રહેવામાંથી જ જીવનની ઊખા પ્રગટવાની છે તે નિશ્ચય કરીને જાણજે.

‘જીવનપોકાર’, પ્રથમ આ., પૃ. ૧૫

હરિ:ઝની ધૂન

જ્યારે મનનું હળવાપણું ન લાગે ત્યારે વધારે ખુલ્લાપણે હરિ:ઝના નામસ્મરણની ઉત્સાહથી અને પ્રેમથી ધૂન ચલાવવી

જોઈએ. મનનો આવેગ અને આવેશ કંઈ કરશી વિક્ષેપને કારણે આડફિંટાયો હશે તેની આપણને સમજ નહિ પડી હોય એવું બને ત્યારે નામસ્મરણ કરતાં કરતાં તટસ્થતાપૂર્વક આપણું પૂરેપૂરું પૃથક્કરણ કરવું ઘટે અને મૂળ કારણને પકડી પાડવું જોઈએ. સાધકને માટે આ બધું ઘણું જરૂરનું છે. કંઈ કશું એમ ને એમ સરકી જવા દેવાપણું ન બનવું જોઈએ. ખરી રીતે જોતાં તો સહજપણે તેવું થતાં સાધકને સમજાઈ જવું ઘટે. તેવું સમજવાનો પ્રયત્ન ન કરવો પડે તો તે ઠીક ગણાય. તેવી સ્થિતિ સહજ થઈ જવી ઘટે, પરંતુ તેવી સ્થિતિ પ્રયત્ન કરતાં કરતાં જ પ્રગટવાની છે, તે નિશ્ચે જાણજો. જ્યારે આપણે સમતા - તટસ્થતાપૂર્વક પૃથક્કરણ કરતા હોઈએ, તે વેળાએ હૃદયનું મહત્ત્વ તો નામસ્મરણમાં પ્રગટ્યા કરે અને પૃથક્કરણ કરવામાંથી આડે ફિંટાયાનું મૂળ કારણ સમજ જવાય અને તેનું નિરાકરણ થાય એવી રીતનું ધોરણ જીવનમાં પ્રગટવું ઘટે.

‘જીવનમંથન’, પ્રથમ આ., પૃ, ૩૫૨-૫૩

સ્મરણમાં અંતરાયો

શ્રીભગવાનમાં સંપૂર્ણ લગની કે પ્રેમભક્તિ પ્રગટ્યા વિના એનું સ્મરણ એકધારું રહી શકવું તે હુર્દાભ છે, પરંતુ પૂરેપૂરી લગની કે એવી ઉત્કટ પ્રેમભક્તિ કંઈ એમ ને એમ જન્મી જતી હોતી નથી. એ તો માર્ગ તરફનો ધીરો ને ધીરો વેગીલો પુરુષાર્થ થતાં થતાં થતી જવાની.

પ્રભુનું નામ પ્રભુકૃપાથી લેવા માંડ્યું કે બસ તે લેવાતું જ જવાનું એવું કશું નથી. પ્રભુને ચરણકમળે રહેવા વાંછનાર જીવ પહેલવહેલું ડગલું ભરે એટલે પછીથી તે એક પછી એક ઉંચે ને

ઉંચે ઉગલાં ભરતો જ જવાનો એવું પણ કશું નથી. એ તો કેટલીયે વાર ચઢે અને પડે છે. એમાં જે જીવ પોતાના ધ્યેય તરફ મીટ માંડતો રહ્યા કરે છે તેવો જીવ તેવી ચકરડીભરડીમાંથી, એવા પ્રકૃતિના વમળમાંથી નીકળી શકવાને પ્રભુકૃપાથી ભાગ્યશાળી થઈ શકે છે. બાકીના તો એ જ પ્રકૃતિમાયાના ખોળિયામાં રગદોળાયેલા ત્યાંના ત્યાં અટવાયા કરે છે. જે જીવ જાગ્રત રહે છે તે પડતો છતાં ઉભો થવાનો જ છે. નામસ્મરણ પાછળ જો ખરા હૃદયનો જ્ઞાનભક્તિપૂર્વકનો પૂરેપૂરો પુરુષાર્થ થયા જતો હશે તો તો નામસ્મરણ સતત એકધારું લેવાશે જ. શ્રીભગવાન આપણને સતત પળેપળ પ્રેમ કરતો હોય છે, પળેપળ આપણું અનેક રીતે પોષણ કરતો હોય છે, પળેપળ રસનું સિંચન કરતો હોય છે, અનેક રીતે બહારનું અને અંદરનું શરીરનું ધારણપોષણ પણ તે જ કરતો હોય છે. એના ચેતન વિના કશું જ હાલીચાલી શકતું નથી. એને મુકાબલે આપણો એને યાદ જ કરતા હોતા નથી. એ આપણું જેટલું કરતો હોય છે અને એ આપણો જેટલો હોય છે, તેના પ્રમાણમાં આપણો તો એને નેવે મૂકીને જ વર્તતાં હોઈએ છીએ. એનો અફસોસ પણ જીવને થતો હોતો નથી. શ્રીભગવાનનું નામ ભુલાતાં આપણને અસહ્ય વેદના પ્રગટવી ઘટે. એવું થતાં એનું નામ લેવાતું જશે.

‘જીવનમંડાણ’, બીજી આ., પૃ. ૬-૭

દુર્લભ - નામસ્મરણ

આપણો જે બાજુએ જવાનું છે તે બાજુએ જવામાં જે જે કંઈ નડતરરૂપ બન્યા કરતું હોય તેના વિશે ઊંડો વિચાર કરીએ અને આપણું નિર્દ્દય રીતે પૃથક્કરણ આપણો કર્યા કરીએ. સાધકે મન,

બુદ્ધિ, ચિત્ત, પ્રાણ, અહંકાર - એ પાંચ તત્ત્વોના વળાંકોને પૂરેપૂરા સમજ લેવા ઘટે. એને સમજ્યા વિના પણ એકલું ભગવાનનું નામ લીધે તે ઠેકાણે આવી શકે છે ખરાં પણ આપણે તે જ્ઞાનસહિત બુદ્ધિની મદદ લઈને તે તે બધું કર્યા કરવાનું છે.

ગઈકાલે પૂજ્યની સાથે કથામાંથી પાછા ફરતાં તેમણે પૂછ્યું કે આ સંત-મહાત્માએ ભગવાનનું નામ લેવા બાબતમાં જે સમજાયું તે તો બધું ખાલી બુદ્ધિનું અનુમાન છે. અને ઘરેડ પ્રમાણે જો નામનું સ્મરણ થયા કરે તો શો ફાયદો થાય ? મેં તેમને કહ્યું કે નામનું સતત સ્મરણ થવું તે સહેલી વાત નથી. તમે આટલા દિવસથી મનને ટકોરી ટકોરીને નામનું સ્મરણ કરવાનું રાખો છો તોપણ તે ભૂલી જવાય છે તો કોઈ માણસ ભગવાનનું નામ એમ ને એમ લઈ શકતો હોતો નથી. સતત ભગવાનનું નામ રહેવું એ હાંસીખેલની વાત નથી. જો આટલી બધી ચેતનતા રાખ્યા છતાં અને જાગૃતિ રાખવા છતાં નામ રહેતું નથી તો ઘરેડ પ્રમાણે રહે જ કેમ ? અને ધારો કે ઘરેડ પ્રમાણે રહે તોપણ એનું પરિણામ નકામું જતું નથી, પરંતુ જેમ કોઈ ખેડૂત બી વાવતાં પહેલાં પોતાના જેતરને ખાતર નાખી ખેડીને જમીન પોચી પોચી બનાવે છે અને પછી બી નાખે અને ભગવાનની કૃપારૂપી વરસાદ વરસે તો તેમાંથી પરિણામ નીપજ્યા વિના રહેતું નથી, પરંતુ કોઈ આપસુ ખેડૂત બરાબર ખેડખાતર ન કરે અને બી વાવી દે તોયે થોડુંઘણું ઊગ્યા વિના રહેતું નથી. કંઈ નહિ તો ઢોરને ખાવાના રાંધાંય પાકે. એટલે ભગવાનનું નામસ્મરણ જો ખાતર અને ખેડ નાખીને એટલે કે આપણાં મન, બુદ્ધિ, ચિત્ત, પ્રાણ અને અહંકાર તે તે બધાને નામસ્મરણને ઊગી નીકળવાની ભૂમિકાને યોગ્ય કેળવ્યા કરવાનું

આખીને નામસ્મરણ લીધાં કરીએ તો તેવો માનવી પ્રત્યક્ષ પરિણામ પોતાના જીવનમાં અનુભવ્યા વિના રહેતો નથી. આને માટે અત્યંત અપાર ધીરજ અને ભારે પુરુષાર્થની જરૂર હોય છે.

‘જીવનપાથેય’, શ્રીજ આ., પૃ. ૧૮૧-૧૮૨

સ્મરણથી સભાનતા

સ્વજન : ઉધ્વર્માં જવા માટે ‘હરિઓ’ બોલીએ પછી તે એક હેબિટ (ટેવ) ન ગણાય ?

શ્રીમોટા : ના, એવું છેને કે આ હેબિટ થઈ, પણ જે હેબિટમાંથી કોન્શ્યસ્સનેસ જાગે છે, આપણાને જે સભાનતા જાગે છે તે સભાનતા આપણાને ઉધ્વર્માર્ગ બેંચી જાય છે. પછી ભલેને મિકેનિકલી કરીએ. ધારો કે મિકેનિકલી કર્યા કર્યું, પણ રોજના ચોવીસ કલાકમાં જ્યારે વધારેમાં વધારે ચૌદંડર કલાક થાય ત્યારે એ મિકેનિકલી નહિ રહે. પછી ઓટોમેટિક થઈ જતાં તેની સભાનતા જાગે છે.

‘અગ્રતા - એકાગ્રતા’, પૃ. ૧૩૨

જપની સાથે સાથે

કામમાં મન રહેવાથી આમ તો જાપ તૂટે, પણ તે ન તૂટે એવું પ્રેરકબળ આપણે કેળવવાનું છે. આપણા શરીરના કોઈ પણ એક અંગના હલનચલન સાથે જાપનું સંધાન કરી દેવાનું છે. જેમ કે આપણે કામ કરતા હોઈએ ત્યારે પણ આપણા પગના અંગૂઠાને એવી ટેવ પાડીએ કે તે સભાન હાલ્યા કરે અને તેની સાથે મનમાં જાપ જપાતો જાય. હાથની કોઈ આંગળી કે પગની આંગળી પણ એવા ઉપયોગમાં લઈ શકાય. અને જાપ આખરે

તો એક ભાવ જ છેને ? એ ભાવને એવી રીતે મૂર્ત સ્વરૂપ આપી શકાય છે. વારેવારે મનને ટકોરતા રહેશો. જાપ ચાલુ રહે તો મનને સંકોરવાનું કામ સહેલું થઈ પડે છે.

જો જાપ હદ્દયના ધબકારા સાથે આપણે બરાબર કર્યા કરીએ તો ધ્યાન તો આપોઆપ આપણું ત્યાં જ રહેવાનું. મા ગમે ત્યાં હશે પણ બાળક જ્યાં સુધી પૂરું ચાલતાં શીખી ગયું નથી ત્યાં સુધી એ જ્યાં જ્યાં ફરતું હશે ત્યાં ત્યાં માનું ચિત્ત ફર્યા કરવાનું જ. એવી રીતે જાપનું ઉદ્ભવસ્થાન હદ્દય છે. એટલે જો હદ્દયના ધબકારા સાથે જાપ થવા લાગ્યા અને એ અભ્યાસ સ્થિર થયો તો તો એ ત્યાંથી જ ઉઠશે, અને જો એમાં ભાવ ઉમેરાયો તો ધારણા તો આપોઆપ એની મેળે જ રહ્યા કરશે. જેમ નદી, પર્વતમાંથી નીકળી આપોઆપ સમુદ્રને મળે છે તેમ આપણા પ્રયત્નથી હદ્દયના ધબકારા સાથે જાપને પ્રેમોર્ભિથી - ભાવથી-કરવાની ટેવ આપણને પડી તો ગણો - જાપ, ધ્યાન અને ધારણા બરાબર થશે.

‘જીવનપગરણ’, બીજી આ., પૃ. ૪૫-૪૬

જપને ભાવયુક્ત કેમ રખાય ?

જપમાં હંમેશાં જીવતોજાગતો ભાવ પ્રગટતો રહે તે ધણું જરૂરનું છે. તેમાં એવી ભીનાશ પ્રગટે, ઊર્ભિ પ્રગટે એટલા માટે થોડી થોડી વારે જે કોઈ ભજનની આપણને ઘણી અભિરુચિ હોય અને જે પ્રાર્થનાના પ્રકારનું હોય તેવું ભજન આપણે ભાવનામાં આર્દ્રતા પ્રગટાવીને ગાવું. એ ભજન બેત્રાણ વાર ગાઈશું એટલે એક પ્રકારની ઊર્ભિ પ્રગટશે અને એવી ઊર્ભિનો ઉપયોગ આપણે નામસ્મરણમાં કરવાનો છે. વળી, કોઈ વાર આપણા વહાલામાં વહાલા આપ્તજનનું પણ ભાવથી સ્મરણ કરવાથી ઊર્ભિ પ્રગટે છે

અને એવી પ્રગટેલી ઊર્મિની મદદ લઈને નામસ્મરણને ભીનું ને ભીનું રાખવાનું છે. કોઈક વાર મોટેથી, ઉત્સાહથી થોડીક વાર બૂમો પાડીને દિલમાં હળવા થઈ જઈને વળી પાછું આપણે નામસ્મરણમાં લાગી જવું જોઈએ છે. કોઈક એવો પ્રસંગ બને અને ઊર્મિ પ્રગટે, વાતચીતમાંથી પણ કોઈક એવી આનંદની ઊર્મિ થઈ આવે ત્યારે ત્યારે જાગ્રત રહીને એ પ્રવાહને નામસ્મરણમાં વાળ્યા કરવાનો છે. નામસ્મરણ ભાવથી જેટલું થશે તેટલું તેમાં જીવંતપણું પ્રગટવાનું છે.

‘જીવનસંશોધન’, બીજી આ., પૃ. ૩૬૮-૭૦

ઊર્મિનો ઉપયોગ

પ્રાર્થના પછી જે ભાવ ઊછળે કે ઊભરાય, એવા ઊછળતા ભાવને આપણે વહી જવા ન દેવો જોઈએ. એટલે કે Emotions (લાગણી, ઊર્મિ વગેરે)ના પ્રવાહમાં એ ભાવને વહી જવા ન દેવો જોઈએ, પરંતુ સાધનના ભાવની નહેરમાં વહેવરાવવો જોઈએ. અનું જ નામ વિવેક. જે લાગણી જે કારણે ઊઠે તે કારણમાં અને તે લાગણીના તાનમાં એટલે જેને અંગે એ લાગણીનો પ્રવાહ શરૂ થયો હોય અના જ એકમાત્ર મનનચિંતવનમાં ન પડી જવું અને એવું કદાચ તેમાં તદાકાર થઈ જવાય કે તણાઈ જવાય ત્યારે એકદમ સફાળા જાગ્રત થઈ જઈને અથવા સતત જાગ્રત રહીને જે કારણથી એ લાગણી જાગી હોય, તે કારણને છોડી દેવું અને લાગણીને પકડી લેવી અને સાધનના અભ્યાસમાં તે લાગણીના જોશને ઉપયોગમાં લેવું. તેવા સમયે નામસ્મરણમાં તેનો ઉપયોગ કરવો. લાગણીના આવેશનો નામસ્મરણમાં સમજી સમજીને ઉપયોગ કરવાથી સ્મરણમાં વિશેષ ભાવના પ્રગટે છે.

‘જીવનદર્શન’, ચોથી આ., પૃ. ૬૮-૭૦

કવિ ભવભૂતિના સંસ્કૃત નાટક ‘ઉત્તરરામચરિત’માં બીજા રસો ભળેલા હોવા છતાં પ્રધાનતઃ તો એક જ રસ - કરુણા - છે. તેવી રીતે ભલે ગમે તે ભાવના ધારી હોય પણ એના ઉંડાણમાં તો જ્પ હોય જ. એ તો જેમ આપણો શાસોશાસ ચાલ્યા કરે છે તેમ થઈ જવું જોઈએ. ભાવ અને જ્પ બંને એક સાથે રાખી શકાય, રાખવા યોગ્ય પણ છે.

‘જીવનપગરણ’, બીજી આ., પૃ. ૧૫૨

* * *

જ્પ તો પ્રત્યેક હૃદયના ધબકારા સાથે એકાકાર થઈ જવો ઘટે અને હૃદયના ધબકારામાં સમાઈ જવો ઘટે. જેમ જેમ એ સ્થિર થતો જશે અને એમાં પૂરતો ભાવ આવતો જશે તેમ તેમ એ હૃદયના ધબકારા સાથે ભળી જતો લાગ્યા કરશે.

‘જીવનપગરણ’, બીજી આ., પૃ. ૧૫૩

જ્પ સુંદર અને સાત્ત્વિક તો અંદરથી ચાલ્યા કરતો હોય તે જ સારો, પણ જેમ આદર્શને એકદમ પહોંચી શકાતું નથી અને પગલે પગલે, ડગલે ડગલે જવાય છે તેમ પહેલાં થોડો સમય જે રસ્તે ત્યાં પહોંચવાની શક્યતા લાગતી હોય તે રસ્તે જવાનું રાખવું. હાલને તબક્કે જીભ હલાવવાનું રાખશો તો વાંધો નથી, પણ એ એના ધ્યેયને કદી ભૂલ્યા વિના. યાંત્રિક, જડ ટેવ ત્યારે જ પડે છે કે જ્યારે એના મૂળ હેતુને વિસારે મૂક્યો હોય છે.

‘જીવનપગરણ’, બીજી આ., પૃ. ૧૫૪-૫૫

જ્યપ માટે પ્રયત્ન

તાવ આવતો હોય ત્યારે એક પ્રકારનો તાવનો જુસ્સો હોય છે અને થોડીધણી ખુમારી પણ રહે છે. તેવે વખતે ભગવાનનું નામસ્મરણ કરવાથી તાવના વેગનો ઉપયોગ થઈ શકે છે. કોઈ પણ લાગણી કે ઉર્ભિનો ઉભરો આવ્યો હોય ત્યારે નામસ્મરણ કરવાનું આપણે કદ્દી પણ ચૂકવું નહિ.

‘જીવનપગથી’, બીજી આ., પૃ. ૧૬૭

જ્યપનું સાતત્ય જીળવવા માટે એક વાત લક્ષમાં રાખવાની છે. એના ઉપર પ્રેમ અને રસ - એ બે ભાવનાની માત્રા જેમ વધતી જશે તેમ જ્યપના સાતત્યમાં સુધારો થતો જશે. એ બે ભાવનાની માત્રા ક્યારે વધે? જ્યારે આપણે આપણા જીવનમાં આપણા આ કામને જ સર્વોપરી ગણીશું અને એને જ વધારેમાં વધારે મહત્ત્વ આપતા રહીશું ત્યારે. એ વિના માત્રા વધવી શક્ય નથી. જે વસ્તુની આપણને જરૂર પડે છે એને માટે મહેનત કરીને આપણે તે મેળવીએ છીએ. એ તો આપણા નિત્યના જીવનનો અનુભવ છે. એવું જ આમાં છે.

‘જીવનપગથી’, બીજી આ., પૃ. ૫૨

આપણું ખરું કામ

તમારે બીજું ઘણું કામ ભલે હોય, પણ કૃપા કરીને ખૂબ ખૂબ મહેનત લઈને નામસ્મરણ સતત ચાલુ રાખવાની મહેનત કરજો. એ એ જ આપણું ખરું કામ છે. એને જ મહત્ત્વ આપવાનું રાખશો. કોઈ પણ ઉપાયે એની યાદ રહ્યા કરે એટલું તો કરશો જ. કામ તો થયા જ કરશો, પણ ખરી મહેનત તો આ કામમાં લીધા કરશો. અને કંઈ ને કંઈ નુસખા ખોળી કાઢી એ યાદ આવે એમ કરશો.

ખરા દિલનો પ્રેમ

હદ્યકુંજમાં ત્યાંના કામના સમયે પૂજ્ય ગાંધીજી અંગેના કાગળો વાંચતાં વાંચતાં કે તેનો સાર લખતાં લખતાં સ્મરણભાવની ધારણા કેળવવાનો જીવતોજાગતો અભ્યાસ ચાલુ રાખ્યા કરજો. એમાં જ્યારે અખંડતા પ્રગટે ત્યારે હજી તો તેની સાચી શરૂઆત થાય છે. અજપાજપ સુધી જવાય ત્યારે તો હજી શુદ્ધિ થવા માંડે છે અને શરણાગતિની સ્થિતિનો માત્ર આરંભ થાય છે. એટલે હજી તો આપણું કામ કશું થયું નથી. તમને ખબર પણ ન પડી શકે એવી રીતે ઘણી ઘણી વાર તે યજ્ઞમાં ભંગ પડ્યા કરે છે. વળી, પગનો અંગૂઠો તો હાલતો રહે, પરંતુ તેની સાથે જે સ્મરણભાવની ભાવનાનો જ્ઞાનપૂર્વક લય (Rhythem) ચાલુ રહેવો ઘટે તે તો જતો રહેછે અને અંગૂઠો યંત્રવત્ત (Mechanically) ચાલુ રહ્યા કરે, એવું પણ બન્યા કરેછે. માટે, માત્ર યાંત્રિક રીતે અંગૂઠો હાલ્યા ન કરે, પરંતુ સ્મરણભાવની જીવતી ભાવના પ્રગટ્યા કરે તે લક્ષમાં રાખશો તો મને ઘણો આનંદ થશે.

‘જીવનસંશોધન’, પ્રથમ આ., પૃ. ૬૭

સ્મરણથી પ્રસન્નતા

આપણી ભાવના સમજણથી વધુ ને વધુ વ્યાપક બને, એટલું જ નહિ પણ તે ભાવના ઉંડી ઉતરે અને તે પ્રમાણે દિલમાં ફોરમ છૂટતી રહે તો જ ઠીક પડે. સદાય પ્રસન્નચિત્ત વધારે ને વધારે રહેવાય તો સરળતા આપોઆપ રહે છે, એ તો આપણને સમજાય એવું છે. એવી સ્થિતિ નામસ્મરણ ચાલુ રહે તો થાય છે

અને એમાં સહજભાવ અને ઊર્ભિ પણ પ્રગટે છે. કશું પણ મન ઉપર લટકતું ન રહેવું જોઈએ કે જેથી મનને એમાં પરોવાયેલા રહેવાની તક મળે. માટે, નામસ્મરણ સતત ચાલુ રહે એવી કંઈ ને કંઈ તરકીબો ખોલ્યા કરશો.

‘જીવનપગથી’, બીજી આ., પૃ. ૮૮

ભાવના દૃઢાવવા સ્મરણ

ભાવનાને ટકાવી રાખવાને માટે, તેને વધુ તેજસ્વિત અને શક્તિશાળી બનાવવા માટે, વધારે એકાગ્ર અને કેંદ્રિત કરવાને માટે, નામસ્મરણ એ જબરજસ્ત સાધન છે. તેથી, પ્રભુના નામમાં તું મસ્ત રહેજો. ભગવાનનું નામ મોટેથી લીધા કરજો. એમાં હવે મીનમેખ ફરક ન પડે તે કૂપા કરીને લક્ષમાં રાખજો. જેના સંગથી કરીને આપણી જીવવૃત્તિ વધારે જીવપણામાં પ્રગટે, એના સંગનો મક્કમપણાથી જ્ઞાનપૂર્વક ઈન્કાર કર્યા કરવામાં જ્યારે ઘણો આનંદ પ્રગટે ત્યારે આપણી સ્થિતિ તે દશામાં પાકતી જતી બને છે, એમ સમજવું અને માનવું. બધુ જ ઓછામાં ઓછું બોલવું અને શ્રીભગવાનનું નામ મોટેથી લીધા કરવું.

‘જીવનપોકાર’, પ્રથમ આ., પૃ. ૮૮

સદ્ગુરુનું ભાવસ્મરણ

હદ્યમાં ભાવના પ્રગટાવતા રહીએ અને તેવી ભાવનાની ભૂમિકામાં નામસ્મરણ કર્યા કરીએ. નામસ્મરણ તો એકધારું, સતત, ‘તૈલધારાવત્ત’ કર્યા કરીએ. ભાવનાથી કોરાં થયેલાં લાગીએ તો, શું સદ્ગુરુ મૂઓ પડેલો છે ? તો પછી આપણે સદ્ગુરુ કર્યો શેને કાજે ? એનું હદ્યમાં હદ્યથી ભાવસ્મરણ પ્રગટતાં હદ્યમાં

જો ભાવ ન પ્રગટી શક્યો તો આપણું દિલ સદ્ગુરુનામાં લાગેલું નથી તે નક્કી પ્રમાણવું. આ જીવ એના સદ્ગુરુનું પુણ્યસ્મરણ પ્રગટાવી પ્રગટાવીને હૃદયમાં ભાવનાનો ઓઘ જન્માવીને તેના વડે કરીને જીવનની સાધનાનું કામ એની કૃપાથી કર્યા કરતો હતો. મનાદિકરણોને જરા પણ શુષ્ણ તો થવા દેવાં જ નહિ. ભાવનાથી તે જ્યારે તરબોળ રહ્યા કરે છે ત્યારે બીજી કોઈ જાતના વિચારો પણ પ્રવેશી શકતા પણ નથી અને ઉઠી પણ શકતા નથી. તેવી દશામાં નામસ્મરણ આદિ સાધન ભાવની એકતાનતાથી, એકાગ્રતાથી સારી રીતે થયા કરે છે એવો આ જીવનો અનુભવ છે.

‘જીવનપોકાર’, પ્રથમ આ., પૃ. ૨૫-૨૬

સ્મરણનો અભ્યાસ

શ્રીભગવાનનું નામ જેટલું ભક્તિભાવથી લીધા કરાય અને એનું સતત એકધારાપણું જેટલું જીવતું થયા કરે તો જીવને ઉગરવા વારો છે. માટે, કૃપા કરીને એમાં જ લક્ષ પરોવવાનું એકમાત્ર આપણું કર્તવ્ય છે તેમ જાણશોજી.

વેપાર-વણજ, સંસારવહેવાર, બીજી સંબંધો એ બધામાં પણ વહાલા ભગવાનનું નામસ્મરણ જ મહત્વપણે પ્રગટ્યા કરે ત્યારે જ એની કેવી ખૂબી અને રહસ્ય છે તે સમજાય. તે વિના તો શું સમજાય ?

અમુક અમુક પ્રકારનાં અને અમુક અમુક પ્રમાણનાં તત્ત્વ ભેગાં થવાથી જ પાણી બની શકે છે. બાકી, બીજું તો ઘણુંય ભેગું કર્યું હોય, પાણી બનાવવાનાં જે જે તત્ત્વ હોય તે પણ હોય, પણ જો સપ્રમાણ ન હોય તો પાણી ન બને. તેવું આમાં

પણ છે. નામસ્મરણનો અભ્યાસ પળેપળે એકધારો સતત ગંગાના પ્રવાહની જેમ મન, બુદ્ધિ, ચિત્ત, પ્રાણ, અહમ્ અને હૃદયમાં જીવતો ના બની રહે ત્યાં સુધી તેના વિશેનું કશું પૂરેપૂરું ઊગવાપણું હોતું નથી.

‘જીવનપ્રેરણા’, બીજી આ., પૃ. ૧૦૩-૧૦૪

માનવીમાં કાળે કાળે અને અવારનવાર જુદા જુદા પ્રકારના moods (માનસિક દશા) પ્રગટ્યા કરે છે. તેથી કોઈ વાર આપણને ન રુચે એવી કોઈની માનસિક દશા આપણા પરત્વેની હોય તો તેથી હાલી ન જવું, છંછેડાઈ ન જવું અને લાગણીથી ઉશ્કેરાઈ ન જવું. તેવી વેળા તે જીવના જે ઉત્તમ પ્રકારના ગુણો છે અને તેના જીવનનું જે ઉત્તમ પાસું છે, તેને યાદ કર્યા કરવું અથવા તો સમૂહણું નામસ્મરણમાં એકદમ લાગી જવું. મનને તેવા કોઈના આડાતેડા વલણથી કશું સ્પર્શવા ન હેવું, અને એવી જ્ઞાનપૂર્વકની તે વેળા જાગૃતિ રાખ્યા કરવી. કોઈ જીવના મનના આડાઅવળા વલણનો આપણા મનને જો સ્પર્શ થઈ જાય તો તે આભડછેટ છે અને તેની શુદ્ધિ કર્યા કરવી એ સાચું છે. આંતરિક શુદ્ધિ થયા કરે કે રહ્યા કરે તે કાજે જો સાધક જીવતો રહ્યા ન કરે તો તે બની ન શકે. તે કાજે પ્રભુની એણે હૃદયમાં પ્રાર્થના કર્યા કરવી.

‘જીવનપ્રવેશ’, પ્રથમ આ., પૃ. ૪૮

નામસ્મરણથી મનશુદ્ધિ

મનની અંદર જાગેલા સારા કે નરસાની પ્રેરણાથી જ આપણે બધાં કામ કરતાં હોઈએ છીએ. એવાં થયેલાં કર્મ તો દ્વંદ્વ જ જન્માવ્યાં કરવાનાં. એટલે આપણે તો મનની અંદર શ્રીહરિની ભક્તિ અને એનું પ્રેમમાધુર્યયુક્ત સ્મરણ એટલું જ માગ

જીવતુંજાગતું ગજર્યો કરે અને એવા મનની દશામાં જે તે કંઈ કર્મ મળ્યા કરે તો તેવાં કર્મ દ્વંદ્વ ઉપજાવી શકનાર નથી. રાગાદિને તેથી મોળા પડી જવા પૂરતો સંભવ રહે છે. માટે, જેમાં ને તેમાં, જ્યાં ને ત્યાં એના મધુરા મધુરા નામને હદ્યસ્થ રાખ્યા જ કરવું. આપણા જીવરોગને મટાડનારું એ જ સાચું તાવીજ છે.

‘જીવનપોકાર’, પ્રથમ આ., પૃ. ૪૩-૪૪

સાંભળો, પણ ન સાંભળો

સંસારી વાતચીતોમાં સંસારની રીતે કદી પણ ભાગ લેવાનું ન બની જાય, તેની તો પૂરેપૂરી સંભાળ રાખવાની છે. સામાં જીવની વાતોથી અળગા થવાનું ધારો કે એકદમ ન થઈ શકે એવું હોય, સામો જીવ વડીલ હોય અને પોતે એવી વાતો કરતો હોય, તેવી વેળા શું કરવું એવો પ્રશ્ન ઉઠે ખરો અને એવા પણ પ્રસંગ સંસારમાં બને છે. તેવી વેળા આપણો જો પૂરેપૂરાં જાગેલાં અને ચેતેલાં, સાવધાન, સાવચેતીવાળાં રહી શકેલાં હોઈએ તો તો તે વાત સાંભળવા છતાં સાંભળવાનું ન બને. તે એવી રીતે કે મનને તો સ્મરણધારણામાં બુડાડી દેવાનું પ્રભુકૃપાથી થયા કરતું હોય અને પોતે તેમની સાથેની વાતોમાં કોઈ પણ પ્રકારનો રસ લીધા કરવાનું ન કરતો હોય, તેમ જ તેમાં આમની કે તેમની ટાપસી પણ ન પૂરતો હોય. વડીલની તેવી સાંસારિક વાતોમાં પોતે સહાનુભૂતિ દેતો હોય એવું તેને તે લાગવા દેતો નથી. એવી વાતોને તો ભૂલેચૂકે પણ ઉત્તેજન ન અપાઈ જાય તેની સોએ સો ટકા કાળજી પ્રભુકૃપાથી રાખી શકતો હોય છે. જીવ વડીલ ભલેને હોય, એને આપણા રોજિંદા વર્તનવ્યવહારથી ખબર તો પડી જવી ઘટે કે હવે તેને સંસારની આવી આડિતેડી વાતોમાં કશો રસ

નથી. આપણી એવા પ્રકારની છાપ, અસર, આપણા ચાલતા રહેતા સતત નામસ્મરણના યજથી તેમના તેમનામાં જન્માવવાની છે તે જાણજે. કદાચ કોઈ એવા વડીલ જીવો બેચાર મહેષાં સંભળાવી હે તો તે પ્રેમભક્તિભાવે સાંભળી લેવું. સંસારની એવી વાતોમાં આપણે જો રસ લેવાનું સમજશપૂર્વક મૂકી દેવાનું કરીશું, અને એની પૂરેપૂરી ખાતરી આપણી આગળપાછળના જીવોને જો થઈ ગઈ તો તો કોઈ પણ આપણી આગળ એવી વાત કરવાને પ્રેરાશે નહિ. સહુ કોઈના મનમાં એમ જ થયા કરવાનું કે ‘જવા દોને એને ! એ તો હવે ભગત થઈ ગઈ છે !’ એમ કહી તે લોક આપણો કક્કો જ કાઢી નાખશે. સંસારવહેવારમાં જીવનવિકાસની ભાવનાની રીતે યોગ્યપણે મથનાર અને જીવનાર જીવને સંસાર વલોવી તો જરૂર નાખશે, પરંતુ આપણે તો એમાંથી માખણને અનુભવવું છે.

એટલે સંસારી વાતોની લપછપમાંથી ઉત્તમ રીતે ટળી જવાનો સાચો ઉપાય તો શ્રીભગવાનનું નામસ્મરણ છે. એને સતત એકધારું ચલાવ્યા જ કરવું. એની અસર આપોઆપ જેની તેની ઉપર પ્રગટવાની હશે તો પ્રગટશે. આપણે કંઈ થોડું જ બીજાંની ઉપર અસર ઉપજાવવાને નામ લેતાં હોઈએ છીએ ! જેમ ધૂની માનવીની સાથે કોઈ લાપ્યનિષ્પન કરતું હોતું નથી, જે તે કોઈ એને જોઈ કહેતું હોય છે કે ‘જવા દોને ભાઈ ! એ તો ધૂની છે !’ એમ આપણે નામસ્મરણમાં જ્ઞાનભક્તિપૂર્વક ધૂની થઈ જવાનું છે, બની જવાનું છે. સંસારના જીવો ભલે આપણો કાંકરો કાઢી નાખે, પણ આપણે તો કોઈનો કાંકરો કાઢી નાખવાનો નથી. આપણે તો પ્રસંગ પડતા જેનું તેનું કામ પ્રભુસેવાભાવે કરવાનું છે. કામથી કંઈ ઘસાઈ જવાના નથી. આપણે તો સર્વેને

હૃદયથી ઘણાં ઘણાં ચાહવાનાં છે, પણ તે શ્રીભગવાનની ભાવનાના સ્વરૂપે જ.

વળીવળીને આપણે તો જેમાં ને તેમાં એવો જ ભાવ જ્ઞાનભક્તિપૂર્વક પ્રગટાવવાનો રહે છે. એ જ આપણું દૈવત અને જીવન. એનું જ નામ છે સાચી સાધના. આવા સતત એકધારા જ્ઞાનભક્તિપૂર્વકના અભ્યાસની અસર આપણામાં અને બહાર પડ્યા વિના રહી શકતી નથી. આપણે તો બધાં જ ઉપર સદ્ગ્રાવ રાખ્યા કરવાનો હોવાથી અને એવી રીતે એ ભાવે બીજાં સાથે વર્તતાં હોવાથી, બીજા જીવોને આપણે બેપરવાવાળાં લાગી શકવાના નથી. આપણાથી કોઈ કનિષ્ઠ પ્રકારનું છે એમ તો કદી સમજવાનું નથી. જેમ જે કોઈ હોય તે તેને તેને સ્થાને ભલે હોય, એમાં આપણે શું? આપણે તો આપણામાં રમ્યા કરવાનું છે. સંસાર તો મળેલો છે, જીવનું જીવપણું ટાળવાને કાજે. જેમ કાંટાથી કાંટો નીકળી શકે છે, જેમ જેર જેરની માત્રાથી ટળી શકે છે, તેમ જીવનું સંસારીપણું જીવનવિકાસની ભાવનાને સંસારમાં તેની પથાર્થતાવડે કરીને જીવવાથી ટળી શકે છે, તે નક્કી જાણવું.

આપણે તો જે તે બધું શ્રીહરિની સાથે છે. સંસાર પણ એની સાથે છે. એને જ જેમાં ને તેમાં સંઘરવાનો છે. જેમાં ને તેમાં એ જ સર્વથી મોખરે હોય. આદિ, મધ્ય અને અંતમાં તે જ હોય. તેની પછવાડે ભલેને બીજા અનંત હોય તેની પરવા નથી.

‘જીવનપોકાર’, બીજુ આ., પૃ. ૮૪-૮૬

સો વાતની એક વાત

આપણે તો હાલમાં જ્યાં ત્યાંથી પ્રભુના નામસ્મરણથી

સાધનાના ભાવને પ્રેમભક્તિભાવે મજબૂત પકડી પકડીને એના ભાવમાં અને એના ભાવથી, સકળ કર્મ કર્યા કરીએ અને જીવની દ્વંદ્વાદિ પ્રવૃત્તિમાં ઘમસાણથી આમથી તેમ ફેંકાવાની કિયામાંથી બચી જવાનું જ્ઞાનભાન અની ફૂપાથી રાખ્યા કરીએ. એટલું હાલની કક્ષામાં આપણો કાજે બસ છે. માટે, કર્મર કસીને બસ માંડવા જ માંડવાનું છે. પ્રભુફૂપાથી કહું છે કે બસ જાગો, જાગો ને જાગો જ. જાખ્યા વિનાનું કંઈ પણ કશું કરવાપણું બધું નકામું છે. પૂરેપૂરું અંતરથી જાગી ગયા કેઢે ગોઈ તો ઉંઘવું હોય તો ઉંઘો પણ પહેલાં તો બધાં જાગો એટલી પ્રાર્થના છે.

‘જીવનપોકાર’, બીજી આ., પૃ. ૧૦૧

સ્મરણ અને સંસાર

જે જીવનું મન સંસારની ઉપાધિઓમાંથી વળ્યું હોય અને જીવનનું મહત્ત્વ જેને સમજાતું જતું હોય અને જેનું મન ભગવાનનાં ચરણકર્મળમાં લાગવાનું બન્યા કરતું હોય તેવો જીવ કોઈને પણ તે બાબતમાં પૂછુવાગાછવા રહેતો હોતો નથી. તે તો જુકાવ્યે જ રાખે છે. કિંતુ એવા પ્રકારના જીવો કંઈ બધા હોઈ શકતા નથી. જેને જીવનનું એકમાત્ર ધ્યેય જીવનના રહસ્યને ઉકેલવાનો, સમજવાનો અને અનુભવવાનો જીવતો આદર્શ અને ધગધગતી તમજ્ઞા હૃદયથી હૃદયમાં લાગ્યા હોય, તેવો જીવ તો તે જ દિશામાં વળ્યા કરવાનો છે. તેવા જીવને સંસાર કે સંસારની પ્રવૃત્તિઓ, ઉપાધિઓ, મુશ્કેલીઓ, ગુંચો, પ્રશ્નો, અનેક જાતની હાડમારીઓ વગેરે જીવનના ધ્યેયની પ્રવૃત્તિમાં પ્રવેશતાં અટકાવી શકાવાનાં નથી, પરંતુ તેવું ન થયું હોય છતાં જે જીવનું મન જરાતરા પણ ભગવાનના ભાવ તરફ થતું જતું હોય, તેવા જીવથી સંસારની

પ્રવૃત્તિ એકદમ છોડી શકતી નથી - એ ઈચ્છે તોપણ. એટલે તેવા મથતા જીવે તો સંસારની પ્રવૃત્તિ કરતાં કરતાં પણ એના જીવનનો સકળ જોક યેતનના ભાવ પરત્વે ફળતો રહે તે જોવાનું તેનું એક મહત્વનું કર્મ છે.

અલબજ્ઞ, લક્ષ્મી ઉપાર્જનની પ્રવૃત્તિ કરતાં કરતાં એને અનેક પ્રકારનાં કર્મબંધન થવાનાં જ છે. અને નવા કર્મનું ઉપાર્જન તેવો જીવ કરતો જ રહેવાનો છે. અનેક પ્રકારના રાગમોહાદિ આવરણમાં પણ તે જીવ સંડોવાયા કરવાનો જ. અને તેવાં કર્મનું પરિણામ પણ એને ભોગવવું પડવાનું જ, એ વાત પણ નક્કી છે, પરંતુ સાથે સાથે જો તેવો જીવ ભગવાનના ભાવ તરફની પોતાની પ્રવૃત્તિ કર્યા જ કરતો રહેશે તો તેવી પ્રવૃત્તિના સંસ્કાર પણ તેને પડતા રહેવાના જ. અને તેનું પરિણામ પણ તેને આવવાનું જ. બધું જ પૂરેપૂરું ના થઈ શકે તો થોડું પણ કરતા રહેવું એ જીવને કાજે ઉત્તમ વાત છે. અને એમ કરતાં કરતાં શ્રીભગવાનના ભાવ પરત્વેની પ્રવૃત્તિનું Momentum - વેગનું જેમ જેમ ધીરે ધીરે બઢતો જશે અને જેમ જેમ તેવો વેગ અખંડતાની મર્યાદા સુધી થતો જતાં - તેવા જીવની અંતર્દૃષ્ટિ પણ વળ્યા વિના રહી શકવાની નથી જ. પ્રભુકૃપાથી જે જીવનું ભગવાનના નામનું રટણ ભલેને ઘરેડની પેઠે થાય અને એવા રટણની અખંડધારા સતત એકધારી-ગંગધારાવત્ત જે પ્રભુકૃપાથી બની શકી તો એવી પ્રવૃત્તિમાં પણ યેતન પ્રગટ્યા વિના રહી શકવાનું નથી. બધાય જીવ સંસારની પ્રવૃત્તિ અને એવી ઈતર પ્રવૃત્તિ એકદમ મૂકી શકતા નથી. અને તેવું શક્ય પણ નથી. વળી, તે બધું મૂક્યા વિના ભગવાનના ભાવમાં પ્રવેશવાનું થઈ ના શકે એવું તો કશું નથી. ધારો કે કોઈ જીવ એકદમ તેવી હુંદ્રાદિ પ્રવૃત્તિ મૂકી દે તોપણ એનું મન અને

એના મનમાં રહેલાં દ્વંદ્વ અને તેની પ્રકૃતિ તથા એના સંસ્કાર એ કંઈ થોડાં જ જીવથી મુકાઈ શકાવાનાં છે ? એ તો સતત એકધારી સાધના થયા વિના અને તે પરત્વેના એકધારા જીવતા લક્ષ વિના તેમ થવું કદ્દી પણ શક્ય નથી. જીવ તેવું બધું એકદમ કરી શકતો હોતો નથી. આમ, જેમ જેમ સંસાર પરત્વેનાં મોહ, કામ, રાગ, ભમતા આદિ છૂટતાં જતાં લાગે, તેમ તેમ આપણે ભાવભક્તિમાં તલ્લીન થતાં જતાં આપણને અનુભવી શકીશું.

‘હસવું અને લોટ ફાકવો’ એ બે કામ કંઈ સાથે થઈ શકવાં શક્ય નથી લાગતાં, પરંતુ જો બારીકાઈથી જોવા જઈએ અને તપાસીએ તો જણાશે કે લોટ ફાકીએ અને હસીએ - અને તે પણ ખડ્ખડાટ - તો લોટ ઊરી જાય તો ખરો, તેમ છતાં મોંમાં લોટ થૂંકથી થોડોઘણો પણ પલળે અને એમ લોટ થોડોઘણો તો પેટમાં જાય જ. તેવી રીતે સંસારની પ્રવૃત્તિ જે જીવ ન છોડી શકતો હોય તેવા જીવનું મન પણ જરાતરા ભગવાનના ભાવ પરત્વેનું થતું હોય તો તેના પરત્વે વધારે સભાન રહીને એને એકધારું અખંડાકાર બને એવું કરવામાં જો તે ધ્યાન લગાવે તો તેટલા કાળ સુધીમાં બનેલાં સારાં નરસાં બધાં કર્માનું પરિણામ એને ભોગવવું તો પડવાનું જ.

પણ જો પેલી ભગવાનના ભાવની પ્રવૃત્તિ એકધારી જીવતી એનામાં બની શકી તો પછી પેલાં થઈ ગયેલાં જીવદશાયુક્ત કર્માના સંસ્કારોનો જ્યારે ઉદ્ય થશે, તે વેળા તે જીવની ભૂમિકા કંઈ આપણા જેવા જીવના જેવી દ્વંદ્વયુક્ત નહિ હોય. એટલે જૂનાં થઈ ગયેલાં કર્મનાં પરિણામ ભોગવાતી વેળાનાં જે કર્મ થવાનાં તે એવા જીવને રાગદ્વેષાદિ દ્વંદ્વાદિકની ભૂમિકામાં લઈ જઈ નહિ શકે

એ વાત નક્કી છે. જે જીવને શ્રીભગવાનના ભાવની ભૂમિકા એકધારી અખંડાકાર બને તે વેળા તેનાં મન, ચિત્ત, પ્રાણ, મતિ અને અહમું પણ તેવી ભાવનામાં જ રમ્યા કરવાનાં. જેમ કોઈ ભારે કુશળ અઠંગ તરવૈયો હોય તો તે જાણો તરતો જ ના હોય એમ પડ્યો પડ્યો પણ તર્યા જ કરતો હોય છે. અરે ! કેટલાક અઠંગ તરવૈયા તો હાથપગ બંધાવીને પણ પાણીમાં તર્યા કરતા હોવાના દાખલા આજે પણ મોજૂદ છે. તેમ અખંડાકાર વૃત્તિ થતાં જતાં જૂનાં કર્મનો પાશ તેવાં તેવાં કર્મો તે તે પળે ભોગવાતાં હોવા છતાં-એવા જીવને લાગવાનો નથી, પરંતુ એ તો આપણાં બધાંની દષ્ટિમર્યાદાની બહારનો વિષય ભલે હોય, પરંતુ આપણા બધાંનું જીવનનું દષ્ટિબિંદુ તો તે જ છે. આપણે આજે નહિ તો કાલે ત્યાં જવું જ છે તે વાત પણ નક્કી છે. એટલે જે જીવ લક્ષ્મીની પ્રવૃત્તિ મૂકી ન શકે, એટલી તાલાવેલી જ્યાં સુધી જીવને લાગી ગયેલી નથી ત્યાં સુધી તેવો જીવ શ્રીભગવાનના ભાવ પરત્વે જે કંઈ અને જેટલી કંઈક પ્રવૃત્તિ કરી શકતો હોય તે એવા જીવ કાજે શ્રેયસ્કર છે જ.

બાળક ચાલવાનું હજુ પૂરું શીખ્યો નથી હોતો. જરાતરા એ બાજુના પ્રયત્નની દિશા હજુ તો માત્ર શરૂ થવા માંડે અને એ જરાતરા ઊભા રહેતા શીખે છે, ત્યાં માબાપ બે હાથ પહોળા કરી એને આંગળી આપે છે, અને જરાક આગળ ચલાવવાને લલચાવ્યા કરે છે. તેમ જીવને પણ શ્રીભગવાનના ભાવની પ્રવૃત્તિમાં લલચાવવાની જરૂર રહે છે જ. સંસારમાં રહ્યે રહ્યે અને સંસારની પ્રવૃત્તિમાં રચ્યાપચ્યા રહ્યે, અને એવી સ્થિતિમાં પણ નામસ્મરણ, પ્રાર્થના કે ધ્યાન આદિ સાધન કર્યા કરવાથી

ધારી અસર તત્કાળ તો થતી નથી હોતી અને યોગ્ય પરિણામ નિપજીવી શકાતું નથી તે હકીકત પણ સો ટકા સાચી છે. એવું હોવા છતાં પણ કોઈના કહેવાથી સંસાર કે સંસારની પ્રવૃત્તિ કોઈ જીવ મૂકી શકવાનો નથી, મૂકી શકતો પણ નથી. તેથી, તેવા જીવને ‘ના મામા કરતાં કહેણાં મામા પણ શા ખોટા?’ એ ન્યાયે જીવના મનને કોઈ કાળે તો પલળવાના સંજોગ ઊભા થાય છે. વળી, જીવનમાં સારાં કર્મનાં પણ તેવાં અને નરસાંનાં પણ તેવાં પરિણામ એ પણ નક્કી છે. જે જીવ પોપટિયા રીતે, પણ સંકલ્પથી નામ થોડુંઘણું લીધા કરશે, એવા જીવનું મન કૂણું થવાની શક્યતામાં આવે છે. એનામાં ભાવના જાગવાની છે. કશું પણ જે ના કરતો હોય તેના કરતાં જે જીવ કંઈક આવી બાજુનું કરવા મથતો હોય તે ઈષ્ટ છે.

**‘જીવનપ્રેરણા’, બીજી આ., પૃ. ૧૧૨ થી ૧૨૩
જપ કરતાં વૃત્તિઓ શાથી સાકાર થતી હશે ?**

જ્યારે જપ કરવા માંડીએ અને જપ જેમ જેમ વધારે વખત કરાતો જાય - જપ માટેનો એ શર્ષદ આકાશની સાથે સંકળાયેલો છે એથી એ જ્યારે અખંડ થાય ત્યારે આ બધી વૃત્તિઓ છે - મન, બુદ્ધિ, ચિત્ત, પ્રાણ અને અહમુ - આ બધામાં પોતાની સ્વતંત્ર - એકની એક જ પ્રકારની નહિ, દરેકની જુદી જુદી હોય છે. ત્યારે એને સંપૂર્ણ ક્ષેત્ર મળે છે. અત્યારે આપણે જીવદશામાં હોઈએ ત્યારે જુદી જુદી અનેક પ્રવૃત્તિઓમાં રોકાયેલા હોઈએ છીએ, પણ અહીં આપણે સજાગ હોવાથી આમ થાય છે. ભલે તેને રોકી ન શકતા હોઈએ, પણ તે મોળી તો પડે જ છે.

જ્યારે શબ્દ સંપૂર્ણ સાકાર થાય છે ત્યારે શું થાય છે ? મનાદિ ઉપર તેનો કાબૂ હોતો નથી. જેમ થતું હોય તેમ થવા દે છે. એવી સ્થિતિ થઈ જાય છે. એટલે આ બધાંય છુંઠાં ઢોર થઈ જાય છે. ત્યારે આ બધી વૃત્તિઓ ખીલવા માંડે છે, પણ તે વખતે સતત જપમાં રહેલા હોવાથી આપણામાં જે સાક્ષીપણું છે, તે સાક્ષીપણું વર્તાવા માંડે છે.

* * *

શરૂઆતમાં કામકોધાદિના હુમલાઓ થયા કરેછે ખરા. સાધક જાણો કે સાલું આ બધું થાય છે. એ હુકમ કરીને દાબી દેતો નથી, કારણ એ સમજે છે કે જો એને દાબી દઈએ તો ફરીવાર ઉબલ જોરથી આવવાનો છે. માટે, ધીરે ધીરે એની પાસેથી કામ લો. માટે, સમજાવી સમજાવીને એની સાથે કામ લે છે.

દા.ત., આપણને કામ થયો. એ કામ સાધનામાં કેવી રીતે વાળી દેવો ? એમ આપણને પ્રશ્ન થાય, પણ એમાં જે જોશ છે, વાઈટાલીટી છે એને આની સાથે જોડી દે એવી કળા આવી જાય છે. સામાન્ય માણસ નહિ કરી શકે, પણ એનામાં એવી કળા આવી જાય છે. ઘણી વખત એણે અભ્યાસ કરેલો. આવા પ્રયોગ કરેલા હોય છે. એટલે એવી કળા એનામાં આવી જાય છે. એટલે એને કોઈ પણ કામ, કોધ, લોભ, મોહ - આ કંઈ પણ થયું તો એની વાઈટાલીટી પોતે પોતાની સાધનામાં વાપરી લે છે. શરૂઆતમાં એ પાંચ, દસ, પંદર વાર વાપરે છે. એ ફાવી શકતો નથી. તેમ છતાં એ છોડી દેતો નથી. એ પોતાના કામમાં, વાપરવાની કળામાં તૈયાર જ હોય છે. પ્રયત્નમાં તે આખરે ફાવે છે. એવી રીતે કામ, કોધ, લોભ, મોહ, મદ, મત્સર, અહમ્

આદિ બળો જીવનમાં ઉધ્વર્ગામી પણ થઈ શકે છે.

આ કળા તો મને સદ્ગુરુએ શિખવાડી હતી. એ ગમે તે કરી શકે. અમુક જ કરી શકે એવું છે નહિ. માત્ર, એનો સિદ્ધાંત સમજ લેવો જોઈએ. તો એને વાપરી શકાય અને એમાં વાપરવાથી પછી એવી એક જાતની સણંગ મસ્તી પ્રગટે છે. કામ, કોધ, લોભ, મોહ, મદ, મત્સર બધાં ભારે બળ છે. એ આપણા શરીરમાં અમસ્તાં નથી રહેલાં. આપણી સાધનામાં આવે છે ત્યારે આપણને ઓર બળ મળે છે. ખરેખરા મર્દ બની જઈએ છીએ. ગમે તેવા અંતરાયો સામે આવે, આપણને નચાવે તોપણ આપણે નમી જતા નથી.

‘તદ્વ્ય - સર્વરૂપ’, પૃ. ૨૮-૨૯

કોઈ અજ્ઞાની માણસ પોતાની કર્મજીળમાં ગુંથાતો જશે અને તેમાં ફસાતો જશે અને એને એમ સમજણ કે જ્યાલ પણ નહિ રહે, પરંતુ એવા પ્રકારનો બીજો અજ્ઞાની માણસ ભગવાનનું સ્મરણ સતત કાયમ રાખવા જંખતો હશે અને તેથી તેવો તેનો અભ્યાસ થતો જતો હશે તો એનાં અજ્ઞાનઅંધકારથી કે સંસ્કારવશાત્તુ કે પોતાની બહિર્ગામી ટેવોથી કે મનનાં બળવાન વલણોને રોકી શકવાની એની અશક્તિને લીધે અથવા તો ઈદ્રિયોના નદીના પૂર જેવા વેગને લીધે કે બીજાં કારણો અને સંજોગોને લીધે પોતાના અન્યથા ભાવી કર્મમાં રસ લીધા કરતો હશે તોપણ તેના પ્રભુસ્મરણના પ્રભાવથી પેલા પહેલા પ્રકારના અજ્ઞાની માનવીના કરતાં આ બીજા પ્રકારના અજ્ઞાની માનવીની ભ્રમણા જલદી ભાંગી જવાની પૂરેપૂરી શક્યતા છે. નામસ્મરણના હૃદયપૂર્વકના સેવનથી એવાનું હૃદય કૂણું બને છે. એવાની ભ્રમણા ભાંગશે ત્યારે એના

அத்யார் சு஧ினா அப்யாசனே லிஷே ஜே பஶ்சாத்தாபனோ அஜின் ஭ஜூகி இடஶே தே பஶ்சாத்தாபனா அஜினமாங் அனுஞ் ஜவபஷுங் ஹமாઈநே வளினே ஜாப் ரெட் ஜஶே. அனோ ஜவனஸா஧னானோ வெங் த்யாரே அத்யார் வ஧ி ஗யேலோ ஹஶே. நாமஸ்மரணாநி ஜாவனா பிராடே ஛ே த்யாரே வ஧ுங் ஜூலி ஜவாய் ஛ே.

சா஧ாரண விஷயனிடி ஧ூனநா ஆவெங் அனே ஆவேஶனே லிஷே பாஷ மானவி பிஜுங் வ஧ுங் ஜூலி ஜதோ ஹோய் ஛ே. ஆ அனுபவனிடி ஹ்கிக்கத் தே. தோ ஜே ஜாவனாநா நாமஸ்மரணாநி ஧ூன் பிராடே தோ அனீ தோ ஜரி போல்஬ாலா ஛ே. மாடே, அனுஞ் நாம் லேவாய் தெடலுங் லோ. ஜூப் ஜாவதி லோ. ஹடயனிடி செதனாதி லோ. ஸமஞ் ஆ஧ாரதி லோ. அனே டில்஥ி ஜாதா ரஹினே அனீ சுங்க ஜாவமாணை சுர்ஜவினே ஏ மாணா அனாங் படக்மணமாங் ஹரங்மேஶ சுந்தரி டீஏ, ஏ ஜவதி பரங்பராமாங் ஜ, பஸ் ஆநாங்மாங் ஜ மஸ்த ரஹ்யா கரிஅே தோ ஜானனோ அனுபவ தோ ஜதோ ஜ ஛ே.

‘ஜவனஸஂஶோஷன்’, பிரதம ஆ.., பு. 328

நாமஸ்மரணா பிரதாப

ஜாவனாநே ஆபஷே நக்கர ஸ்வருபே ஜோவா ஈஷ்டிஅே ஛ிஅே ஜரா, அனே ஏ வ஧ுங் ஶி ரிதே ஶக்கு ஥ாய் அமே பாஷ லா஗ே. வளி, ஜே ஜாவனாநே தோ ஜாதமாங் ஆ வ஧ாங் ஹு:ப், அஂ஧ாங்கூ, திராஸ், அந்யாய வ஗ேரே வ஧ுங் கேம் ஹஶே அமே கேட்லாக் லோகோ பூஷே ஛ே. தெம் ஏ ஹஶே கே நாலி ஏ பாஷ அக் மோடோ பிரஶ்நே ஛ே. அவுங் பாஷ ஘ணா லோகோ மானே ஛ே. அனே ஘ணாங்மாங் ஹடயமாங் அவுங் புஷாயா கராய் ஛ே. ஜேஅா ஜஃ ஛ே, தெனா கரதாங் தோ ஆ லோகோ சாரா ஛ே, கேம் கே அடலி பாஷ

મથામણ એમને થાય છે, પરંતુ આ મથામણ કેટલી વાર ઉપરછલ્લી પણ હોય છે. એવી ઉપરછલ્લી મથામણવાળાની કે Society talk જેવી વાત - સત્ય ગણાતા લોકોની માન્યતા કે વાતચીત - જે લોકો કહેતા હોય તેવા લોકો તો જડ કરતાં પણ નપાવટ છે, પરંતુ જેને ખરા દિલથી એ બાબતની મથામણની ચાનક લાગેલી છે, એવા લોકોને જરૂર એક દિવસ સમજણ પડવાની છે. જગત ઉપરના મનુષ્યોના ઘણા મોટા ભાગના હદ્યમાં - પછી - ભલેને એમાંના ઘણા જંગલી હોય - કોઈ ને કોઈ પ્રકારના ભગવાન કે દેવ વિશેની ભાવના રહેલી જ છે. એટલે એમ કહી શકાય કે એ ભાવના સુખુપ્તપણે આખા જગતમાં પડેલી છે. આ હકીકત જો આપણે ગળે પૂરેપૂરી ઊતરી હોય તો આપણા જીવનના ધ્યેયને સતત વધારે ને વધારે તમન્નાવાળું બનાવીએ અને તે વારેવારે લક્ષમાં રાખીએ. એને માટે નામસ્મરણ એ મોટામાં મોટું સાધન છે. નામસ્મરણના પ્રતાપ અનેકવિધ છે.

‘જીવનપગથી’, પ્રથમ આ., પૃ. ૮૧-૮૨

વિસ્મરણ સામે સાવધાન

ભગવાનને ન ભૂલવાનો સતત અત્યાસ રહેવો જોઈશે. ભગવાનને ભૂલાવી ઢે એવા પ્રસંગો હવે બહુ આવશે, કારણ કે આજે (૧૯૪૨) પ્રલય ચાલી રહેલો છે. આ પ્રલયની પાછલી દુનિયા કેવી થવાની છે, એની આપણાને કશી કલ્પના નથી. બધા લોકો કહે છે કે New order નવો યુગ થવાનો છે, પણ લડાઈ દરમિયાન અને લડાઈ પછીથી એકબીજા પ્રત્યે પ્રજાઓના માનસની અંદર એટલાં બધાં ઝેર રેડાય છે કે તે એનું પરિણામ

લાવ્યા વિના રહેવાના જ નથી. લડાઈ પછીથી વધારે વર્ણસંકરતા આવવાની છે. એટલે કે દિલની ઉદારતામાં વધારે સંકુચિતપણું આવવાનું છે અને લોકોમાં જે ઉદાત્ત ભાવના છે તે ઉદાત્ત ભાવના ક્યાંય સરકી જવાની છે. આવા આ સમયમાં પણ જેઓ પોતાના ધ્યેયને ચુસ્તપણે શ્રદ્ધા અને વિશ્વાસથી વળગી રહ્યા હશે તેમ જ ગમે તે થવા છતાં પણ, અને જીવનની આકરી કસોટીમાં પણ, એ જ ખરું તત્ત્વ છે એમ સમજુને જેઓ વર્તતા હશે તેમને ઘણો લાભ થવાનો છે. ભગવાનનો અવતાર એવા લોકોને તારવા માટે જ થતો હોય છે. દુનિયામાં એવી ગૂંગળામણાનો સમય નજીક આવતો જાય છે. મોટા મોટા સંતપુરુષો પણ શું કરવું અને શું થશે તે વિચારી શકશે નહિ એવી સ્થિતિ પેદા થવાની છે.

આવા જીવનઅંધારના વખતમાં આપણું, ડૂબતાનું તરણું, તો એકલું ભગવાનનું નામ જ છે. કેટલાક લોકો એમ કહે છે કે કર્મનો બદલો તો ભોગવ્યા સિવાય ધૂટકો જ નથી તો પછી નામ લઈએ કે ના લઈએ એ બધું સરખું જ છેને ? મારે હિસાબે તો તે સરખું નથી. કર્મનો બદલો જરૂર ભોગવવો પડશે, પરંતુ ‘શૂળીનું વિધન કાંટે ગયું’ એના જેવું થશે. કર્મના પરિણામની Intensity-તીવ્રતા જલદમાત્રા ઘટીને ઘણી જ નાની - બિલકુલ સૂક્ષ્મ સ્વરૂપે - નામસ્મરણથી થઈ જશે. આ હકીકત અનેક સંત ભક્તોએ અનુભવેલી છે અને એ અનુભવના આધારે મને ભગવાનના નામસ્મરણમાં વિશ્વાસ અને શ્રદ્ધા વખતોવખત જીમતાં ગયાં છે. એટલે કર્મ જ સર્વોપરી છે એવું કર્શું નથી.

‘જીવનપગરણ’, બીજી આ., પૃ. ૮૦-૮૧

સ્મરણની સાથે સાથે

એને સંભાર્યા વિનાની એક પળ પણ આપણાથી પસાર કરાતાં એ આપણને ઘણું ઘણું ઉંખવું અને સાલવું ઘટે. જો તેમ થતું અનુભવાય તો નિશ્ચે જાણવું કે કોઈક દિવસ પણ જરૂર એને પામી શકવાનાં છીએ. આપણે આશા રાખવી પણ છે ઊંચામાં ઊંચી અને વર્તન તેવા પ્રકારનું કરવાનું લેશમાત્ર જો દિલ નથી થતું તો જાણવું અને માનવું કે આપણે હજુ Fools, paradiseમાં (કલ્યાનાના સ્વર્ગમાં) વસી રહેલા છીએ. આપણે આદર્શ સેવીએ, તે આદર્શ અને તેની ભાવના રોકિંદા વહેવાર વર્તનમાં જાગ્યાં કરતાં ન રહે તો નિશ્ચે જાણવું કે હજુ આપણને જીવનના આદર્શની કશી પડી નથી. આદર્શને અનુભવવાનું સાચું પ્રગટ સ્વરૂપ હજુ જીવનમાં પ્રગટેલું નથી. જે જીવને પોતાના જીવનનો આદર્શ સિદ્ધ કરવો છે, તેણે પોતાને સ્પષ્ટપણે નિશ્ચયાત્મકપણે સમજ લેવાની ઘણી ઘણી જરૂર છે. પોતાની પ્રકૃતિની દશા ગમે તેવી કક્ષાની હોય તેનો વાંધો નથી, પણ તેવી દશામાં ને દશામાં પડ્યા રહ્યા કરી, આપણે ભગવાનને ભજવાની વાતો કરવી, એ તો પોતે પોતાને છેતરવાની હકીકત છે, તે માટે નમ્રભાવે, પ્રાર્થનાભાવે બધાં સ્વજનોનાં અંતરમાંના તેમના વલણને ચેતાવવાને, ચોખ્યું જણાવી દેવું ઘટે છે. જો ઊઈવું છે તો તેવા પ્રકારનાં વહેવાર વર્તન પ્રગટવા ધો. સામસામેનાં વલણો જીવનમાં પ્રગટે તે વેળા જગ્રત્પૂર્વકનો જબરજસ્ત સામનો કર્યા કરો. તે વેળા હૃદયથી એને પ્રાર્થના કરી કરી પોકાર પાડ્યા કરો, એને ચરણકમળે હૃદયની ધા નાખો. ગમે તેમ કરીને

પણ સંસાર આદિના ક્ષેત્રનાં વલણમાંના કળણમાં હૃદ્યા ન કરો.
 તેવા કળણમાં આપણે બધાં ગરકી જઈએ છીએ, અનું પ્રત્યક્ષ
 જ્ઞાનભાન તો પ્રભુ અવારનવાર આપણને એની કૃપાથી કરાવતો
 રહ્યો છે. જીવનમાં એવું પ્રત્યક્ષ બનતું હોવાનો એ આપણને
 અનુભવ કરાવે છે, પરંતુ તેવા અનુભવને તે રીતે અને તેના
 હેત્વર્થને ભાવે આપણે તેને સ્વીકારી પણ શકતાં નથી. સ્વીકારી
 ન શકીએ એનો પણ વાંધો ન હોય, પરંતુ ઊલટાં તેવી વેળાએ
 આપણે તેના ઉપર કોધ કરીને એને નકારીએ છીએ, એવા જીવનું
 તો શું થાય ? આમ થતાં સજ્જાણ જાગવાનું પણ જો બની શકે
 અને જરાતરા સળવળાટ થાય અને તે પ્રમાણે જીવતુંજાગતું
 વર્તવાનું બને તો ઉત્તમ, પણ પાછા તેવા સળવળાટથી હતા તેવા
 ને તેવા ઠેરના ઠેર રહેવાનું હોય તો તેવા સળવળાટનો પણ
 કશો અર્થ નથી.

‘જીવનપોકાર’, પ્રથમ આ., પૃ. ૪૨૮-૨૯

॥ હરિઃॐ ॥

॥ હરિઃઽં ॥

પૂજ્ય શ્રીમોટાના જીવનની મહત્વની તવારીખ

જન્મ : તા. ૪-૬-૧૮૮૮, ભાડરવા વદ ચોથ, સંવત ૧૮૫૪

સ્થળ : સાવલી, જિ. વડોદરા, નામ : ચૂનીલાલ,

માતા : સૂરજભા, પિતા : આશારામ, અટક : ભાવસાર.

૧૮૧૬ : પિતાનું અવસાન.

૧૮૦૫ થી ૧૮૧૮ : તૂટક અભ્યાસ-સાથે આકરી મજૂરી.

૧૮૧૯ : મેટ્રિક પાસ.

૧૮૧૯-૨૦ : વડોદરા કોલેજમાં.

તા. ૬-૪-૧૮૨૧ : કોલેજ ત્યાગ.

૧૮૨૧ : ગુજરાત વિદ્યાપીઠ.

૧૮૨૧ : વિદ્યાપીઠનો ત્યાગ. હરિજન સેવાનો આરંભ.

૧૮૨૨ : ફેફદુના રોગથી કંટાળીને ગરુડેશ્વરની ભેખડ ઉપરથી આત્મહત્યાનો પ્રયાસ, દેવી બચાવ, ‘હરિઃઽં’ જપથી રોગ મટાડવાનો સફળ પ્રયોગ.

૧૮૨૩ : ‘તુજ ચરણે’ તથા ‘મનને’ની રચના.

૧૮૨૩ : વસ્તંતરંગભીમે પૂ. શ્રીબાળયોગીજી દ્વારા દીક્ષા. શ્રીકેશવાનાંદ ધૂણીવાળા દાદાનાં દર્શને - સાંઈબેડા ગયા. રાત્રે સ્મશાનમાં સાધના અને દિવસભર પ્રભુપ્રીત્યર્થ હરિજન સેવા.

૧૮૨૬ : લગ્ન-હસ્તમેળાપ વખતે સમાધિનો અનુભવ.

૧૮૨૭ : હરિજન આશ્રમ, બોદાલમાં સર્પદંશ-પરિણામે ‘હરિઃઽં’ જપ અખંડ થયો.

૧૮૨૮ : ‘તુજ ચરણે’ ની પ્રથમ આવૃત્તિનું પ્રકાશન.

૧૮૨૮ : પહેલી હિમાલય યાત્રા.

૧૮૨૮ : સાકોરીના પૂ. શ્રીઉપાસનીબાબાનું નિયાદમાં આગમન, એમના આદેશ મુજબ સાકોરી જવું-ત્યાં મળમૂત્રની પથારીમાં સાત દિવસ.

૧૮૩૦ : મનની નીરવતાનો સાક્ષાત્કાર.

૧૮૩૦ થી ’તર દરમિયાન સાબરમતી, વીસાપુર, નાસિક અને યરવડા જેલમાં. હેતુ-દેશસેવાનો નહિ, સાધનાનો. સખત પરિશ્રમ અને લાઠીમાર દરમિયાન પ્રભુસ્મરણ-મૌન. વિદ્યાર્થીઓને સમજાવવા વીસાપુર જેલમાં સરળ ભાષામાં શ્રીમદ્ ભગવદ્ગીતાનું વિવરણ લખ્યું-‘જીવનગીતા’

૧૮૩૪ : સગુજા બ્રહ્મનો સાક્ષાત્કાર.

૧૯૭૪થી ૧૯૭૮ દરમિયાન હિમાલયમાં અધોરી બાવા પાસે જવાનું બન્યું,
ધૂંવાધારના ધોધની પાછળની ગુફામાં સાધના. ચૈત્ર માસમાં ૨૧ છાણાંની
૨૧ ધૂણી ધ્યાવી નર્મદાકિનારે ખુલ્લામાં શિલા ઉપર નજી બેસીને સાધના,
શીરીના સાંઈબાબાનું પ્રત્યક્ષ દર્શન-આદેશ-સાધનાના અંતિમ તબક્કાનું
માર્ગદર્શન.

૧૯૭૯ : તા. ૨૮-૩-૧૯૭૮ : રામનવમી, સંવત : ૧૯૭૯ કાશીમાં નિર્ગુણ
બ્રહ્મનો સાક્ષાત્કાર. હરિજન સેવક સંઘમાંથી રાજીનામું. ‘મનને’ની પ્રથમ
આવૃત્તિનું પ્રકાશન.

૧૯૮૦ : (તા. ૮-૮-૧૯૮૦) વિમાનમાર્ગ અમદાવાદથી કરાંચી જવાનો ગૂઠ
હુકમ.

૧૯૮૧ : માતાનું અવસાન.

૧૯૮૨ : હરિજન સેવક સંઘમાંથી છૂટા થયેલા, છતાં હરિજન કન્યાશાત્રાલય માટે
મુંબઈમાં ફાળો ઉધરાવ્યો. બે વખત સખત પોલીસમાર-દેહાતીત અવસ્થાના
પુરાવા.

૧૯૮૩ : ૨૪, ફેબ્રુઆરીમાં ગાંધીજીના પેશાબના ઝેરી જંતુઓનું પોતાના પેશાબમાં
દર્શન. નૈમિત્તિક તાદાત્યનો અનુભવ.

૧૯૮૪ : હિમાલયની યાત્રા-અદ્રભુત અનુભવો.

૧૯૮૬ : હરિજન આશ્રમ, અમદાવાદ મીરાંકુટિરમાં મૌનઅંકાંતનો આરંભ.

૧૯૮૦ : દક્ષિણભારતના કુરુક્ષેત્રમાં કાવેરીનદીનેકિનારેહરિઃ ઊંઆશ્રમનીસ્થાપના.

૧૯૮૪ થી સુરતના કુરુક્ષેત્રમાં એક ઓરડીમાં મૌનઅંકાંતનો આરંભ.

૧૯૮૫ : (તા. ૨૮-૫-૧૯૮૫) નડિયાદ, શેઢીનદીનેકિનારેહરિઃ ઊંઆશ્રમની
સ્થાપના.

૧૯૮૬ : (તા. ૨૩-૪-૧૯૮૬) સુરત, કુરુક્ષેત્રમાં હરિઃ ઊંઆશ્રમનીસ્થાપના.

૧૯૮૨થી ૧૯૭૫ : શરીરના અનેક રોગો-સતત પ્રવાસ સાથે તહ અધ્યાત્મ-
અનુભવ ગ્રંથોનું લેખન-પ્રકાશન.

૧૯૭૬ : ફાજલપુર-મહીનદીના કિનારે શ્રી રમણભાઈ અમીનના ફાર્મ હાઉસમાં
તા. ૨૩-૭-૧૯૭૬ના રોજ માત્ર છ જણની હાજરીમાં આનંદપૂર્વક
દેહત્યાગ. પોતાનું ‘ઈટ-ચૂનાનું સ્મારક ન કરવાનો આદેશ’ અને આ
નિમિત્તે મળેલી રકમનો ઉપયોગ દૂર ગુજરાતનાં પદ્ધત ગામોમાં પ્રાથમિક
શાળાના ઓરડાઓ બંધાવવાના લોકફળણમાં કરવાની સૂચના.

॥ હરિઃ ઊં ॥

॥ હરિઃઊં ॥

આરતી

ॐ શરણચરણ લેજો, પ્રભુ શરણચરણ લેજો,
પતિત ઉગારી લેજો (૨) કર ગ્રહી ઉર લેજો. ... ઓં શરણ.

મનવાણીના ભાવો, કર્મ વિષે ઉતરો, પ્રભુ (૨)
મન, વાણી ને દિલને (૨) કૃપાથી એક કરો. ... ઓં શરણ.

સર્વ મળેલાં સાથે, દિલ સદ્ગ્રાવ ઉગો, પ્રભુ (૨)
છો અપમાન થયાં હો (૨) ત્યાંયે ભાવ બઢો. ... ઓં શરણ.

નિભ્ન પ્રકારની વૃત્તિ, ઉર્ધ્વગમન કરવા, પ્રભુ (૨)
પ્રભુકૃપાથી મથાજો (૨) ચરણશરણ ગ્રહવા. ... ઓં શરણ.

મનના સકળ વિચારો, પ્રાણતણી વૃત્તિ, પ્રભુ (૨)
બુદ્ધિતણી સૌ શંકા (૨) ચરણકમળ ગળજો. ... ઓં શરણ.

જેવા દિલ હોઈએ પ્રભુ, તેવા દેખાવા, પ્રભુ (૨)
મતિ મુજ ખુલ્લી રે'જો (૨) સ્પષ્ટ જ પરખાવા. ... ઓં શરણ.

દિલમાં કંઈક ભર્યું હો, તે થકી બીજું ઉલદું, પ્રભુ (૨)
કદી પણ મુજથી ન બનજો (૨) એવી મતિ દેજો. ... ઓં શરણ.

જ્યાં જ્યાં ગુણ ને ભાવ, દિલ ત્યાં મુજ ઠરજો, પ્રભુ (૨)
ગુણ ને ભાવની ભક્તિ (૨) દિલ મુજ સંચરજો. ... ઓં શરણ.

મન, મતિ, પ્રાણ પ્રભુ ! તુજ ભાવ થકી ગળજો, પ્રભુ (૨)
દિલમાં તુજ ભક્તિની (૨) છોળો ઉછળજો. ... ઓં શરણ.

-શ્રીમોટા

બુદ્ધ શ્રીમોદાના પુસ્તકો

- | | |
|----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------|------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------|
| <p>૧. મનને (પદ્ય)</p> <p>૨. તૃજ ચરણે (પદ્ય)</p> <p>૩. હિંદુપુરકાર (પદ્ય)</p> <p>૪. જીવનપણલે (પદ્ય)</p> <p>૫. શીલીનગાંધેરી (પદ્ય)</p> <p>૬. તેથેવચ્ચરૂપકુમણી (પદ્ય)</p> <p>૭. કર્મગાથા (પદ્ય)</p> <p>૮. પ્રાણમખાપ (પદ્ય)</p> <p>૯. પુનિત પ્રેમગાથા (પદ્ય)</p> <p>૧૦. જીવનસંગ્રહામ (પદ્ય)</p> <p>૧૧. જીવનસંદેશ (પદ્ય)</p> <p>૧૨. જીવનપણેય (પદ્ય)</p> <p>૧૩. AT THY LOTUS FEET ('તૃજ ચરણે'નો અનુવાદ)</p> <p>૧૪. જીવનપરણ (પદ્ય)</p> <p>૧૫. TO THE MIND ('મનને'નો અનુવાદ)</p> <p>૧૬. જીવનપુરણ (પદ્ય)</p> <p>૧૭. જીવનપણશી (પદ્ય)</p> <p>૧૮. જીવનમણણ (પદ્ય)</p> <p>૧૯. જીવનસોપાન (પદ્ય)</p> <p>૨૦. જીવનપ્રવેશ (પદ્ય)</p> <p>૨૧. જીવનગીતા (ગાંધી-પદ્ય)</p> | <p>૨૨. જીવનપૂર્કાર (પત્રો)</p> <p>૨૩. આર્તીપ્રકાર (પ્રાથીના)</p> <p>૨૪. છર્જિજન સંતો (ગાંધી-પદ્ય)</p> <p>૨૫. Life's Struggle ('જીવનસંગ્રહામ'નો અનુવાદ)</p> <p>૨૬. જીવનમણ (પત્રો)</p> <p>૨૭. જીવનસંશોધન (પત્રો)</p> <p>૨૮. જીવનસંશોધન (પત્રો)</p> <p>૨૯. જીવનસંશોધન (પત્રો)</p> <p>૩૦. જીવનપરણ (સારાંશથી)</p> <p>૩૧. અભ્યાસીને (પદ્ય)</p> <p>૩૨. જિજ્ઞાસા (પદ્ય)</p> <p>૩૩. જીવન અનુભવ ગીત (પદ્ય)</p> <p>૩૪. જીવનસંકળક (પદ્ય)</p> <p>૩૫. જીવનલક્ષ્ણ (પદ્ય)</p> <p>૩૬. જીવનસરણ (પદ્ય)</p> <p>૩૭. જીવનસરણ (પદ્ય)</p> <p>૩૮. જીવનસરણ (પદ્ય)</p> <p>૩૯. શ્રદ્ધા (પદ્ય)</p> <p>૪૦. જીવનસરણ (પદ્ય)</p> <p>૪૧. ભાવ (પદ્ય)</p> <p>૪૨. જીવનસરણ (પદ્ય)</p> <p>૪૩. જીવનસરણ (પદ્ય)</p> <p>૪૪. જીવનસરણ (પદ્ય)</p> <p>૪૫. જીવનસરણ (પદ્ય)</p> <p>૪૬. જીવનસરણ (પદ્ય)</p> <p>૪૭. જીવનસરણ (પદ્ય)</p> <p>૪૮. જીવનસરણ (પદ્ય)</p> <p>૪૯. રાગદેશ (પદ્ય)</p> <p>૫૦. જીવનઅનુભાવ (પદ્ય)</p> <p>૫૧. જીવનપ્રતાત (પદ્ય)</p> |
|----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------|------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------|

- | |
|-----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------|
| <p>૫૦. જીવનસોરણ (પદ્ય)</p> <p>૫૧. જીવનસરણ સારંશ (પદ્ય)</p> <p>૫૨. જીવનસરણ (પદ્ય)</p> <p>૫૩. જીવનસરણ (પદ્ય)</p> <p>૫૪. જીવનસરણ (પદ્ય)</p> <p>૫૫. જીવનસરણ (પદ્ય)</p> <p>૫૬. જીવનસરણ (પદ્ય)</p> <p>૫૭. જીવનસરણ (પદ્ય)</p> <p>૫૮. જીવનસરણ (પદ્ય)</p> <p>૫૯. જીવનસરણ (પદ્ય)</p> <p>૬૦. જીવનસરણ (પદ્ય)</p> <p>૬૧. જીવનસરણ (પદ્ય)</p> <p>૬૨. જીવનસરણ (પદ્ય)</p> <p>૬૩. જીવનસરણ (પદ્ય)</p> <p>૬૪. જીવનસરણ (પદ્ય)</p> <p>૬૫. જીવનસરણ (પદ્ય)</p> <p>૬૬. જીવનસરણ (પદ્ય)</p> <p>૬૭. જીવનસરણ (પદ્ય)</p> <p>૬૮. જીવનસરણ (પદ્ય)</p> <p>૬૯. જીવનસરણ (પદ્ય)</p> <p>૭૦. જીવનસરણ (પદ્ય)</p> <p>૭૧. જીવનસરણ (પદ્ય)</p> <p>૭૨. જીવનસરણ માટે પ્રાણપ્રતિષ્ઠા (પ્રચારન)</p> <p>૭૩. શૈખ-વિશેષ (સંસ્કાર)</p> <p>૭૪. ઝાન-પુનર્જિત્ત (સંસ્કાર)</p> <p>૭૫. ટક્કુ-સર્વર્પ (સંસ્કાર)</p> <p>૭૬. અશ્રતા-એકખાતા (સંસ્કાર)</p> <p>૭૭. જોગાલ્પ (સંસ્કાર)</p> <p>૭૮. અનચ્ય-સમચ્ય (સંસ્કાર)</p> <p>૭૯. ગ્રહશ્રદ્ધા (સંસ્કાર)</p> <p>૮૦. એક્સ્પ્રીક્શન-સમીક્રણ (સંસ્કાર)</p> <p>૮૧. ગાલે પુગલે પ્રક્રિયા (પત્રો)</p> <p>૮૨. કેન્સરની સામે (પત્રો)</p> <p>૮૩. ધનનો ધોંગ</p> <p>૮૪. મુક્તાલાનો પ્રેમસ્પર્શ (પત્રો)</p> <p>૮૫. સારહદ્ય (પત્રો)</p> <p>૮૬. સમ્ભય સાથે સમાધાન (પત્રો)</p> <p>૮૭. ઉપરોત ઉપરોતનાં પુસ્તકોમાંથી થયેલાં ૧૧૫ સંકલનનો.</p> |
|-----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------|